

વર्ष : ૪૨ • અંક : ૫

મે - ૨૦૧૮

Retail Price Rs. 10/- Each

અધ્યેત્ય સંતશ્રી આત્માનંદજી પ્રેરિતા

દિવ્યાધ્વનિ

આધ્યાત્મિક મુખ્યપત્ર

સંસ્થા સંચાલિત 'વિદ્યા-ભક્તિ-આનંદધામ' ગુરુકુળના
વિદ્યાર્થીઓ - પ્રસંગ મુદ્રામાં



શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર

(શ્રી સત્યા - સેવા - સાહેલી કેન્દ્ર સંચાલિત)

કોણા કોડ ૩૦૦. (નિ. ગાંધીનગર, ગુજરાત)

ફોન : (૦૭૯) ૨૩૨૬૯૯૭૧૦, ૨૩૨૬૯૪૮૯-૯૪

E-mail : mail@shrimadkoba.org, Web. : www.shrimadkoba.org

સંસ્થા સંચાલિત નિઃશુલ્ક છાશકેન્ડ્રો દ્વારા છાશવિતરણ વેળાએ



ବିଦ୍ୟାଧ୍ୟାନ

અનુક્રમણિકા

- | | | | |
|------|---|----------------------------|----|
| (૧) | શ્રી સદ્ગુરુપ્રસાદ | શ્રીમદ્ રાજયંત્રજી | ૫ |
| (૨) | શ્રીમદ્ રાજયંત્ર પત્રાંક-૫૮૧ | પૂજ્યશ્રી આત્માનંદજી | ૬ |
| (૩) | માયા મુર્ખ ન મન મુઆ | ડૉ. કુમારપાળ દેસાઈ.... | ૧૦ |
| (૪) | શ્રી સમાધિતંત્ર અમૃતરસપાન | પ્રા. ચંદાબહેન પંચાલી.... | ૧૨ |
| (૫) | શ્રી દેવયંત્રજી ચોવીશી...શ્રી અશોકભાઈ પી.. શાહ.... | ૧૫ | |
| (૬) | શ્રાવકાચાર | બા.બ્ર. શ્રી સુરેશજી.... | ૨૦ |
| (૭) | શ્રી ભક્તામર સ્તોત્રશ્રી મહેન્દ્રભાઈ ખંધાર.... | ૨૩ | |
| (૮) | આત્માની તત્ત્વશક્તિ | શ્રી વલભજી હીરજી.... | ૨૮ |
| (૯) | વિકારો કાબૂમાં રાખો ..સં. ગુલાબયંદ રાંભિયા.... | ૨૯ | |
| (૧૦) | ઈન્ડ્રિય-વિજ્ય | શ્રી ભાનુબેન ડી. શાહ.... | ૩૦ |
| (૧૧) | બાળવિભાગ | શ્રી મિતેશભાઈ શાહ.... | ૩૫ |
| (૧૨) | સમાજ-સંસ્થા દર્શન | | ૩૭ |

10

સે ૨૦૧૮

2015. 11



શ્રીમદ્ શાજથંક આધ્યાત્મિક સાધના કેન્દ્ર
(શ્રી સત્યશુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત)
કોબા - ૩૮૨ ૦૦૭ (નિ. ગાંધીનગર, ગુજરાત)
ફોન: (૦૭૯)૨૩૨૭૬૨૯૬/૪૮૩/૮૪
mail@shrimadkoba.org, www.shrimadkoba.org

Bank Detail : Shrimad Baichandra Adhyatmik Sadhana Kendra

Name of Bank : Kotak Mahindra Bank

Name of Bank : Kotak Mahindra Bank

A/c. No. : 08390020000044 • IFS Code : KKBK0000839

લેખકો / ગ્રાહકો / વાચકોને

- ⇒ ‘દિવ્યધ્વનિ’ દર મહિને પ્રગટ થાય છે.
- ⇒ કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે.
- ⇒ ગરણ વર્ષથી ઓછી મુદ્દતનું લવાજમ સ્વીકારવામાં આવતું નથી.
- ⇒ ચેક/ડ્રાઇટ/એમ.ઓ. ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા’ના નામનો મોકલવો.
- ⇒ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનામ્ર અપેક્ષા છે.
- ⇒ ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે.
- ⇒ સરનામામાં ફેરફાર થાયાની જીણ તાત્કાલિક કરવા વિનંતી છે.
- ⇒ કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે કમશઃ લેવો તેનો સંપાદકશ્રીને સંપૂર્ણ અધિકાર રહેશે.
- ⇒ લેખકોનાં ભંતબ્યો સાથે સંપાદકશ્રીનું સહમત હોવું આવશ્યક નથી.



: મુદ્રણસ્થાન :

ભગવતી ઑફસેટ

૧૫/સી, બંસીધર ઑસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ - ૩૮૦ ૦૦૪
ફોન : ૨૨૧૬ ૭૬૦૩

પ્રાર્થના

હે પરમકૃપાળુદેવ !

આપે કહ્યું છે કે, “વિષમભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપયોગે વર્ત્યા છે, વર્તે છે અને ભવિષ્યકણે વર્તશે તે સર્વને નમસ્કાર.”

હે ગ્રભુ ! અમે પણ એ સર્વને નમસ્કાર કરીએ છીએ, પરંતુ પ્રથમ નમસ્કાર તો આપને જ કરીશું ! આપે તો અમને આત્મદાષિ આપીને મોક્ષમાર્ગ સમજાવ્યો. વળી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લાલ્બિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લાલ્બિ જેમાં સમાય છે એવા અવિષમ ઉપયોગને આપે નમસ્કાર કર્યા છે એ અવિષમ ઉપયોગ તો આપનામાં પ્રગટ હતો ! તેથી ફરી ફરી આપને નમસ્કાર કરીએ છીએ.

આપના આ અવનિ ઉપરના અવતરણ અને દૈહપરિવર્તનના અત્યંત સફળ જીવનમાં વિશિષ્ટપણે વિષમતાઓ જ દિશિગોચર થાય છે. પૂનમની રાત્રે જ્ઞાનરવિનો ઉદ્ય, અજ્ઞાન અંધકારમાં જ્ઞાનનો પ્રકાશ, બાલ્યવયમાં જ્ઞાનવૃદ્ધનો આભાસ, વૈશ્યવેષમાં ઉદાસીનતાનો વાસ, હીરામોતીમાં અધ્યાત્મનો પ્રતિભાસ, વિપુલ ધનરાશિમાં આત્મા અતિ ઉદાસ, મોહમયીમાં અમોહ સ્વરૂપનો નિવાસ, સુખમાં પણ સુખભાસ, પુરુષસિંહમાં પરમ કારુણ્યનો વાસ, સંસારના યોગમાં વૈરાગ્યનો જોગ, તરણતારણને અલ્ય આયુષ્યનો ભોગ, ઉપાધિમાં સમાધિનો સંજોગ, કળિયુગમાં સત્યયુગનો વાસ, કૃષ્ણદેહમાં પરમબુદ્ધિનો આવિજ્ઞાર, અહિસકના હાથે ક્રાણ્યો પર વાર, વસુંધરાને થયેલો કૃષ્ણદેહનો પણ ભાર ! શું કહીએ ? અને કેટલું કહીએ ? માત્ર એટલું કહીશું - “તિમિર વિદારક, જ્યોતિ પ્રકાશક, તમો જીવોના તારણહાર, ચરણકમળમાં વંદન કરીએ ગ્રભુ ! આપને વારંવાર.”

॥ અં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

શ્રી સદગુરુપ્રસાદ

ਪੰਾਂਕ 368

ਮੁੰਬਈ, ਵੈਂਸ਼ਾਖ, ੧੯੪੮

“ગમે તેટલી વિપત્તિઓ પડે,
તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની
ઈચ્છા કરવી યોગ્ય નથી.”

ઉદ્ય આવેલો અંતરાય
સમપરિણામે વેદવા યોગ્ય છે,
વિષમધપરિણામે વેદવા યોગ્ય નથી.


તમારી આજ્ઞવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયાં જાણવામાં છે; એ પૂર્વકમનો યોગ છે.

યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા
આચયરે નહીં; માટે તમે જે આકૃતાતાને લઈ ઈચ્છા
જગ્યાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે.

જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તોપણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છાવો યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે, તો તે મુમુક્ષુની વિપત્તિ યાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં; કારણ કે અકર્તાવ્ય તે જ્ઞાની કરે નહીં.

ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે.

હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે; બાકી બીજાં પ્રયત્ન તો કર્તૃત્વ નથી



કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તનાનો દઢ નિશ્ચય કરવો તે તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે.

ગમે તે પ્રકારે પણ એ લોકલજારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની ‘ચિત્તા વડે’ પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે; માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ધારણા વખત થયાં આજીવિકા અને લોકલજાનો ખેદ તમને અંતરમાં ભેણો થયો છે. તે વિષે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તોપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તોપણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવ યોગ્ય છે.

સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણામે ત્યાં સંધી યथાર્થ બોધ પણ પરિણમે નહીં.

અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું
સત્તસંગારૂપી કલ્યવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર
રહે એમ બને તો આ જગતને વિષે તે
અગિયારમું આશ્વર્ય જ છે.

શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૫૮૧

परમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી

“વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તાવાથી આગળ પર તે વિષયમૂળ્યની ઉત્પત્ત થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મલપણું થવું સંભવતું નથી.”



વીતરાગદર્શન તેના કર્મસિદ્ધાંત માટે બહુ જાણીતું છે પરંતુ મોટાભાગે કર્મસિદ્ધાંત વીરલા જ સમજ શકે. પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે,
“જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવ સ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.”

જે સંયોગો અત્યારે મળ્યા છે તેને અત્યારે હું પાર પાડી દઉં. ભવિષ્યમાં ધીરે ધીરે વિષયોની ઈચ્છા ઓછી થઈ જશે, તેમ કેટલાક લોકો ભ્રમણાથી માને છે. ભારતીય પરંપરામાં તથા બધા મહાપુરુષોએ પણ એમ કહ્યું છે કે પાંચેય ઈન્દ્રિયના વિષયની જે કાંઈ ઈચ્છા થાય અથવા કોઈપણ ઈચ્છા થાય તો તેને જ્ઞાન દ્વારા, વैરાગ્ય દ્વારા, ભક્તિ દ્વારા તે ઈચ્છાને ઓછી કરવી. જેમ દૂધમાં ઊભરો આવે ત્યારે ગેસને બંધ કરી દો કે થોડું પાણી તેમાં નાખો છો અને ઊભરો બેસી જાય છે તેમ તે ‘ઈચ્છાઓ’ જે નિમિત્તોથી વર્ધમાન પામે છે તેવા નિમિત્તોને દૂર કરવા તથા જે નિમિત્તોથી તે ઈચ્છા ઘટતી જાય તેવા નિમિત્તોનું સેવન કરવું. એક પત્રમાં પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ એમ પણ લખ્યું છે કે ધીમે ધીમે તે વિષયોને જીતીશ. હું ઘણો બળવાન છું, હોશિયાર છું એટલે વિષયો મને શું કરશો ! પણ આવી ગફલતમાં રહેનારને એવી ખબર નથી કે ત્રણ લોકના જીવોને જેણે એકહથ્યુ સત્તાથી બાંધ્યા છે એવા કર્મો

કાંઈ સામાન્ય નથી. આપણે કથાનુયોગમાં ઘણા દણાંત પણ જોઈએ છીએ કે મોટા ઋષિમુનિઓ વગેરે ગાફેલ રહ્યા તો નીચે પડ્યા છે તો આપણી તો શી વિસાત છે ? આપણે કાંઈ એવી ઉચ્ચદશામાં નથી. ત્યાગમાર્ગ તે વીર અને વિવેકી પુરુષોનો

માર્ગ છે અને સાહસ ખેડ્યા વિના કદાપિ સંયમની સિદ્ધિ થઈ શકે નહીં. જે એમ વિચારે કે ભવિષ્યમાં મારું શું થશે માટે મારે ત્યાગમાર્ગ અપનાવવો નથી. આવું વિચારનાર ક્યારેય પણ આ માર્ગ પર આવી શકે નહીં. ત્યાગથી ડરવાનું નથી. ત્યાગ એ આત્માનો સ્વભાવ છે અને સ્વભાવ હુઃખદ હોય નહીં પરંતુ સ્વભાવને સમજ્યા વગર ખોટી રીતે પ્રવર્ત તો તે હુઃખરૂપ બની શકે છે.

ધર્મની આરાધના ધર્મત્વા અને વિવેકી પુરુષો કરી શકે છે. ઘડપણ આવે ત્યારે ઈન્દ્રિયો શિથિલ થઈ જાય છે પણ ઈચ્છાઓ તો રહ્યા જ કરે છે. ઈચ્છાઓ બંધનું કારણ છે. વિષયો ભોગવ્યા તે તો પ % ટકા બંધનું કારણ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે,

“ભોગા ન ભુક્તાઃ વયમેવ ભુક્તાઃ ।”

“માત્ર ઉદ્ય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પત્ત થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય.”

● જ્ઞાનદશા :

સમ્યક્જ્ઞાનનો અર્થ એ છે કે જે હેય છે તેને જાણો અને તેનો અપરિચ્ય કરે, જે ઉપાદેય છે તેને જાણો અને ગ્રહણ કરે તથા જ્ઞેયમાં મધ્યસ્થ રહે.

ભગવાને પણ કહ્યું છે કે,

ભેદવિજ્ઞાનતઃ સિદ્ધા, સિદ્ધા યે કિલકેચન ।

પણ ત્યાં ભેદજ્ઞાન એવો શર્બનથી વાપર્યો હે અને અહીં ગીજ વિભક્તિ ‘જ્ઞાનેન’ નથી વાપરી પણ પાંચમી વિભક્તિ વાપરી હે. અહીં સાધન-સાધ્યભાવ નથી કહ્યો. ઘણા એમ કહે છે કે અમે ભેદજ્ઞાન કરીએ છીએ પણ ભાઈ, જો તું ભેદજ્ઞાન સાચે જ કરતો હોય તો તારા જીવનની દિશા અને દશા બદલાવી જોઈએ. જ્ઞાન એટલે જ્ઞાનગુણની પર્યાય અને ‘જ્ઞાનદશા’ તેમાં દશા હે તે ચારિત્રગુણની પર્યાય હે. તો જેને જ્ઞાનદશા પ્રગટી હોય તે સાવધાન રહે હે. જે સ્વયં શિથિલ હે તે શાસ્ત્ર દ્વારા પોતાની શિથિલતા પોષે હે ! શ્રી સમયસાર વાંચીને જો આપણે અન્ય ખોટી કલ્પનાઓ કરીએ તો નીચે પડીશું. તેમાં લઘ્યું છે કે જ્ઞાનથી મોક્ષ જવાય. હવે આ વાક્યને પકડીને જો કોઈ ત્યાગમાર્ગનો નિષેધ કરે તો તેમણે આ ગ્રંથકર્તાનું જીવન જોવું. તેમણે તો ૧૦ વર્ષની ઉમરે જ ઘર છોડીને ત્યાગમાર્ગ પર ચાલી જ્ઞાનમાર્ગની આરાધના કરી. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ રત્નત્રયની અભેદતા બતાવતા ‘મૂળમાર્ગ રહસ્ય’માં કહ્યું છે કે,

“તે ગણે અભેદ પરિણામથી રે,

જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળો

તેહ મારગ જિનનો પામિયો રે,

કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળો(૮)”

પરમ અધ્યાત્મ યોગીશ્વર શ્રી ઉમાસ્વામીએ ‘તત્ત્વાર્થસૂત્ર’ અધ્યાત્મ-૧ પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે, સમ્યગ્રૂદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગः ।

આ સૂત્રમાં સમ્યગ્રૂદર્શનજ્ઞાનચારિત્રાણિ તે બહુવચન અને મોક્ષમાર્ગને એકવચનમાં લઘ્યું. માટે એકલા જ્ઞાનથી મોક્ષ થાય નહીં કારણ કે એકલું જ્ઞાન હોય તે શુષ્ણજ્ઞાન કહેવાય હે. એકલી કોરી

શ્રદ્ધાથી પણ મોક્ષ થાય નહીં. એકલી શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેવાય હે, તેવી રીતે સમ્યક્તવ રહિત ચારિત્રને કુચારિત્ર કહેવાય હે. આપણે જો કલ્યાણમાર્ગ જવું હોય તો ભગવાનની આજાને આગળ રાખવી અને આપણી બુદ્ધિને પાછળ રાખવી. જ્ઞાનસહિત જેણે જ્ઞાનદશામાં પ્રવર્તન કર્યું હે એવા મનુષ્યોની ધીમે ધીમે ઈચ્છાઓ નિર્મૂળ થાય હે. આચાર્ય ભગવાન કાંઈ બધાને દીક્ષા લેવાનું કહેતા નથી પરંતુ ત્યાગમાર્ગમાં પ્રવર્તન ન કરી અમૂલ્ય મનુષ્યભવને પશુની પેઢે અવિરતિ અવસ્થામાં ખોઈ નાખો એમ પણ નથી કહેતા ‘શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય’માં કહ્યું છે કે જ્યારે કોઈ ભવ્ય જીવ અમારે શરણે આવે અને અમને કહે કે હે પ્રભુ ! મારે ત્વરાથી આત્મકલ્યાણ કરવું હે તો મને રસ્તો બતાવો. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, જો તારે ત્વરાથી આત્મકલ્યાણ કરવું હોય તો ત્યાગમાર્ગ ગ્રહણ કર. પરંતુ જો તે સાધક એમ કહે કે પ્રભુ, ત્યાગમાર્ગ ગ્રહણ કરવાની તો મારી શક્તિ નથી, તો પછી આચાર્ય તેને શ્રાવકધર્મ બતાવે હે. આમ, બંને રીતે આત્મા આગળ વધી શકે છે પણ ત્વરાથી કલ્યાણ માટે તો દીક્ષા જ ઉપાય હે. છતાં પણ પાત્રતા વિના આવેશમાં આવીને જો કોઈ દીક્ષા લઈ લે તો પણ ઈછ નથી.

“માત્ર ઉદ્ય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પત્ત થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય.”

ઉત્સુક એટલે વ્યગ્ર, ચિંતાયુક્ત, અધીં, ઉત્કંઠાવાળું. ઉત્સુકતા એટલે હવે આગળ શું થશે તેવી ચિંતા. એવી દશા પોતે જ એમ બતાવે કે થવાનું શું છે ? કરવાનું શું છે ? તો શાંત થવું. સમજુને શાંત થવું. ભગવાનનું તો નામ જ શાંતિનાથ હે. તેઓ કેવા છે ? પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમની સુતિ કરતા કહ્યું છે કે,

“પરિપૂર્જ જ્ઞાને પરિપૂર્જ ધ્યાને,
પરિપૂર્જ ચારિત્ર બોધિત્વ દાને,
નીરાગી મહાશાંત મૂર્તિ તમારી,
પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી.”

હવે શું થશે ? એવી ઉત્સુકતા જ આત્માના રૂડા ભાવોનો નાશ કરનાર છે. સાચી શ્રદ્ધા અને વિષયોથી વિરક્તિનો પુરુષાર્થ આત્માને આગળ લઈ જનાર છે. ભવિષ્યનું જાણવાની અધીરતાવાળી દશા આપણાને આત્મજ્ઞાન કે આત્મસમાધિ તરફ લઈ જાય નહીં કારણ કે ત્યાં ચંચળતા છે. ઉત્સુક પરિણામથી ભાવઅધ્યાત્મની સિદ્ધિ થતી નથી. વચનામૃતમાં પરમકૃપાળું શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે એક શાંતપણું પ્રાપ્ત કરવાથી દ્વાદશાંગીનું રહસ્ય પામી શકાય છે. આવી પરમ શાંતિને જે પામ્યા છે તેમની દશા કંઈ ઓર જ છે.

“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રથનો પંથ ભવ અંતનો ઉપાય છે.”

આપણે સર્વથા શાંત ન થઈ શકીએ તો કંઈ નહીં પણ મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે ચાલી તેવા થવાનો પુરુષાર્થ તો કરી જ શકીએ. જેઓ એમ માને છે કે હમજાં તો જેમ જીવાય તેમ જીવીશ પણ પછી ઘડપણ આવશે ત્યારે સેવા-ધર્મ-ધ્યાનાદિ કરીશું ! તો ભાઈ, આ તારી ખોટી કલ્પના છે. તેમાં તું સફળ થઈ શકીશ નહીં. સફળ થવા માટે અભ્યાસ, વૈરાગ્ય, સાચી સમજજ્ઞા અને સમજજ્ઞાપૂર્વક સત્સંગનો વારંવાર આશ્રય કરવો આવશ્યક છે. આટલી પાત્રતા હોય તો ભેદવિજ્ઞાન થઈ શકે. કારણ કે ભેદવિજ્ઞાનની પ્રક્રિયા માત્ર જાણવાની નથી પરંતુ જાણ્યા બાદ પ્રયોગ કરવાનો છે.

“આત્મા અને આસ્થાવતણો જ્યાં, ભેદ જીવ જાણે નહીં, કોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની.”

“અશુચિપણું વિપરીતતા એ, આસ્થાવોના જાણીને, વળી જાણીને દુઃખકારણો, તેથી નિવર્તન જીવ કરે.”

આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો ખોટા વિચારોથી-આસ્થાવોથી જુદાં પડી, તે જોય છે એમ જાણો. તે જોય પણ કેવા છે ? તો હેય જોય છે એમ શ્રદ્ધાવું. જે દિવસથી તમે એવું જાણ્યું કે કોધ આ ભવમાં અને પરભવમાં દુઃખનું કારણ છે તો કોધ ઓછો કરવો અને છોડવો. તેનાથી મને સુખ થશે નહીં એમ શ્રદ્ધા કરવી. જેમ તળાવનું પાણી ઘણા દિવસ પહુંચું રહે તો તેના ઉપર લીલ જામી જાય છે તેમ કોધાદિ વિભાવોરૂપી લીલ આત્મા ઉપર જામી ગઈ છે. તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્મદર્શન થતું નથી. તેને દૂર કરવા માટે નિશ્ચય કરવો કે મારે ખપ પૂરતા જ દુન્યવી કામ કરવા છે. સત્સંગ, ભક્તિ, સેવા આદિમાં ચિત્તને જોડવું અને જેનાથી શાંતપણું પ્રાપ્ત થાય તેમજ સર્વજીવમાં મૈત્રી, વાત્સલ્ય, કરુણાભાવ ઉપજે તેવો પ્રયત્ન વર્તમાનમાં જ કરવો. હવે આગળ કહે છે કે,

“જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી.”

આ જ્ઞાનીપુરુષનું લક્ષણ કહ્યું, પણ તેનાથી ઊંધું વિષયની આકંક્ષાથી વિષયને ભોગવે તો નાચ થઈ જવાય. માટે ભગવાનની અને શુરુની આજ્ઞામાં પોતાની પૂરી શક્તિ લગાવીને તે પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો. આચાર્યભગવાન કહે છે કે,

અનીગ્રહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ् ।

જરાપણ વીર્ય ગોપવ્યા વિના સંયમનો અભ્યાસ કરવો જોઈએ. સંયમ પ્રત્યે વળવું જોઈએ. નાની નાની પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ કે જેથી આત્માનું બળ વધે. જિજ્ઞાસાબળ, વૈરાગ્યબળ, વિચારબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વધારવું તો કર્મો સાથેની લડાઈમાં જીતી શકીશું. હવે આગળ કહે છે કે,

“અને એમ જો પ્રવર્તત્વા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.”

જ્ઞાની પણ જો એમ માને કે વિષયોથી મને બાધા નથી તો હજુ તેઓ તત્ત્વનું સ્વરૂપ બરાબર સમજ્યા નથી. અહીં જ્ઞાનીને પણ ચેતવણી આપી છે. આગળ કહે છે કે,

“માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદ્ય હોય એટલે ધૂઠી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્પવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે.”

નિકાચિત કર્માની સંખ્યા તો બહુ ઓછી છે અને વિષમ પરિસ્થિતિઓમાં તો આપણને ગુરુજનોએ આચરણ કરીને બતાવ્યું છે. શ્રી સમયસારમાં અધ્યાત્મ યોગીશ્વર શ્રી કુંદુંદુચાચાર્યએ કહ્યું છે કે,

“જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મૂકાય છે, એ જિનતણો ઉપદેશ તેથી, ન રાચ તું કર્મ વિષે.”

- ગાથા ૧૫૦

પાણી ફરવાનો પ્રયત્ન કરો. ઉપશમભાવ લાવો, વૈરાગ્યભાવ ભાવો, મનને નિરંકુશ ન રાખો, સત્સંગમાં રહો. સત્પુરુષોના ચરિત્રો, ભગવાનની આજ્ઞા તેને વારંવાર અનુસરવાનો આપણે શીધ્ર પ્રયત્ન કરવાનો છે.

“રે આત્મા તારો ! આત્મા તારો ! શીધ્ર એને ઓળખો, સર્વત્તમાં સમદાચિ ધો આ વચ્ચને હદ્યે લખો.”

જ્ઞાની પણ ભૂલ કરી શકે પણ તે ભૂલ શક્ષાની નથી, ચારિત્રાની છે. આ કાળના બધા જ્ઞાની ક્ષયોપશમ જ્ઞાની છે. માટે અજ્ઞાની થઈ શકે. એટલે અભિમાનથી કે બીજા કોઈ પણ આશયથી સ્વચ્છાંદ્ર પ્રવર્તન કરવું નહીં. જ્ઞાનીપુરુષનું લક્ષણ છે કે,

“જ્ઞાની મગન વિષયસુખ માંદી,

યહી વિપરીત સંભવે નાહિ.”

જે હુન્યવી સુખમાં મળ છે તે નિયમથી અજ્ઞાની છે. હું જ્ઞાની છું માટે મને બંધન નથી એમ

જ્ઞાની અભિમાન કરતા નથી. આચાર્ય ભગવાને કહ્યું છે કે,

સમ્યદૃષ્ટે ભવતિ નિયતં જ્ઞાનવૈરાગ્ય શક્તિ: ।

જ્ઞાન-વૈરાગ્ય ન હોય તો જ્ઞાનીપણું સંભવે નહીં. કયા કર્મો નિકાચિત છે અને કયા કર્મો નિધત્ત છે તે આપણા જ્ઞાનનો વિષય નથી માટે આપણે તો ધૂશીને પુરુષાર્થ કરવો, વિષયકષાયો સાથે યુદ્ધ કરવું. મહાપુરુષો પણ બદ્ધમાં રહેતા નથી. ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે છે. જો તેમને કોઈ બળવાન ઉદ્યને લીધે વિષયાદિમાં પ્રવર્તન કરવું પડે તો તે પ્રવર્તન કરતાં પહેલા પ્રાર્થના કરે છે કે હે ભગવાન ! મને બચાવો. મારે આવી પ્રવૃત્તિ, આવું પાપ કરવું નથી. એ પહેલા અને વિષયસેવન કર્યા બાદ પણ પશ્ચાત્પવ તથા પ્રાયશ્ચિત્ત કરે છે. તેઓ વિષયમાં પ્રવર્તન પણ મંદમાં મંદ પરિણામથી કરે છે. હવા ભરેલા હુગ્ગાની જેમ અતિ તીવ્રપણે કર્મદયથી વિષય ભોગવવાની તેમને ઈચ્છા થાય પણ, જેમ હુગ્ગામાંથી બધી હવા નીકળી જાય અને થોડી જ હવા બાકી રહે તેવા મંદમાં મંદ પરિણામથી તેઓ તેમાં પ્રવર્તે છે. આગળ કહે છે કે, “સામાન્ય મુસુકુ જીવ વૈરાગ્યના ઉદ્ભબને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમ કે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડમાંડ જતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જતી શકે.”

આમ, ઉત્સુક્તામાં આકૃપતા, અનિશ્ચિતતા અને સંશાને આધીનપણું છે. મોટા મુનિઓને પણ જે પદ્ધાડી દે એવું આ મન છે. જો જરા પણ અસાવધાન રહે તો જીવ ઉપરથી પરીને છેક નીચે તળોટીમાં આવી જાય છે. આવું ન થાય તે માટે જ્ઞાની ભગવંતોની વૈરાગ્યભાવના, ત્યાગ-ભાવના ભાવવી. ભક્તિ, સત્સંગ આદિનું સેવન કરવું. આ બધું આત્માનું કલ્યાણ કરનાર છે.

॥ ઊં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

માયા મુઈ ન મન મુવા

પદ્મશ્રી ડૉ. કુમારપાણ દેસાઈ

આપણી ચોપાસની દસે દિશાઓનો તો સહુને ખ્યાલ છે. ચારે બાજુની આઠ દિશાઓ અને વળી ઉપર અને નીચે- એમ કુલ દસ દિશાઓ થાય છે. મહદૂંઅંશે માનવી એનું જીવન આ દસે દિશાઓની દોડધામમાં પસાર કરતો હોય છે, પરંતુ અને અગિયારમી દિશાની જાણકારી નથી.

આ અગિયારમી દિશા એ પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બાજુ નથી. એ માનવીની ઉપર કે એની નીચે આવેલી નથી, પરંતુ આ અગિયારમી દિશા એની ભીતરમાં આવેલી છે. માયામાં રચ્યોપચ્યો માણસ અહર્નિશ દસે દિશામાં દોડધામ કરતો હોય છે, પરંતુ આવા બાધ્ય જગતમાં ધસમસતી દોડ લગાવતા માણસને અગિયારમી દિશાનો અંદાજ હોતો નથી.

અરે ! જીવન આખું પૂરું થઈ જાય અને છતાં એ આ દશ દિશાઓમાં જ ભ્રમણ કરતો રહે છે. બહાર ભ્રમણ કરવાથી બાધ્ય વસ્તુ મળે છે. ભીતરની અગિયારમી દિશામાં જીવાથી એને પોતાની જાત મળે છે. મન સહેવ બહાર દોડાવે છે. સ્વખ એ બહારની વસ્તુ છે અને એને સિદ્ધ કરવા માટેની દોડ એ માયા છે. બહાર દોડતા માણસને જીવનની કોઈ ઘડીએ એવો ખ્યાલ પણ નથી આવતો કે એની આખીય દોટ પાછલા પગે અવળી ચાલે છે. એને જવાનું હતું પોતાની ભીતરમાં અને ધૂમતો રહ્યો સદા બહાર. પામવાની હતી આંતરિક આધ્યાત્મિકતા ને પામ્યો બાધ્યની ભૌતિકતાને.

મનથી સતત બહાર દોડતો રહ્યો અને એ દોડમાં ને દોડમાં એનું જીવન સમાપ્ત થઈ ગયું. એની બહારની દોડ એને આધિ, વ્યાધિ અને

ઉપાયિમાં ડૂબાડતી ગઈ, પરંતુ આ સઘળું થયું શા માટે ? એને માટે બીજું કોઈ જવાબદાર નથી, પણ વક્તિ પોતે જ જવાબદાર છે. વક્તિ પોતાને કારણે જીવનમાં સૌથી વધુ દુઃખી થતી હોય છે. ભીતરમાં અંધાપાનું નામ છે માયા. આ માયા તો ભારે છલનામયી છે. એનું કોઈ એક રૂપ નથી, એની કોઈ એક માગ નથી કે એની કોઈ એક ઓળખ નથી. તમારું મન જેની તૃષ્ણા સેવે, તેવો એ આકાર લે છે. તમારા ચિત્તની ઈચ્છા એ એનું રૂપ છે અને તમારી કલ્યાણા એ એનું સ્વરૂપ છે.

આવી અનેક વેષધારી, બહુરૂપી માયામાં જીવતો માનવી પળની પણ નિરાંત પામતો નથી અને અધ્યાત્મની દાખિએ કશું મેળવતો નથી, કારણ કે માયા એ તો તમે તમારા મનમાં સર્જલું સ્વખ છે. માયા એ તો તમારી મીઠી ધારણા છે અને માયા એ જાતજાતનાં રૂપ ધારણ કરતી તમારી કલ્યાણા છે. એ માણસને બહાર દોડાવે રાખે છે. આથી જ કબીરસાહેબ એમની આગવી ઇટાથી કહે છે, ‘આ મોહિની માયાએ તો ભલભલા બુદ્ધિમાનોને મોહમાં નાખ્યા છે. કોઈ એ માયાથી થોડાધંશા લપેટાય, તો પણ એમાંથી બચી શકતા નથી. એનાથી ઊગરી શકતા નથી. એ તો પ્રલોભનના ધનુષ પર લોભનું બાધ ચડાવીને માણસને ભટકાવે છે. માયા કલ્યાણમાર્ગનો સૌથી મોટો અવરોધ છે. સંત કબીરે માયાનું રૂપ આલેખતાં એમની માર્મિક વાઇભાં કહ્યું, “માયા મુઈ ન મન મુવા, મરિ મરિ ગયા શરીર ! આશા તૃષ્ણા ન મુઈ, યોં કથિ કહે કબીર.”

‘માયાનું રૂપ કેવું છે ? શરીર વારંવાર મૃત્યુ પામતું રહ્યું, તો પણ માયા કે મન મર્યાનહીં અને

આશા - તૃષ્ણા પણ સમાપ્ત થઈ નહીં.'

આમ, જ્યાં સુધી વ્યક્તિ માયા, માન, મોહ અને તૃષ્ણાથી ઘેરાયેલો છે, ત્યાં સુધી એની દોડ ચોપાસની દસ દિશાઓ ભજી હોય છે. એની અગિયારમી દિશા, જે ભીતરમાં આવેલી છે, તે ખુલતી નથી. આવી માયામાંથી માનવીને બહાર આણવાનો સંદેશો આપ્યો છે સંત કબીરે.

માનવીને દસે દિશામાં દોડાવનારી માયાને સંત કબીરે અંધારી રાત કહી છે, તો વળી શાકિની અને ડાકિની પણ કહી છે. એને મનુષ્યરૂપો પતંગિયાનો નાશ કરનારી દીપકની ઝાળ કહી છે, તો સમગ્ર સંસારને પેદા કરનારી ઇગિની કહી છે. આવી માયાનું સુખ ચાર દિવસનું હોવા છતાં માણસ એને પકડવા માટે પાછળ દોડે છે. માણસને સપનાની જેમ રાજ્ય, ધન વગેરે મળ્યું છે, પણ એ જતાં શી વાર લાગવાની ?

સંત કબીરને મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે. જો માનવી મોહ કરે જ નહીં, તો એને કોઈપણ ચીજવસ્તુઓની માયા જાગે નહીં. આથી જ્યારે એ મોહ કરે, ત્યારે માયા જાગે છે અને પછી એ સાવધાન ન હોવાને કારણે ધન, સંપત્તિ, ક્રીતિ અને જમીન-મકાન સહુનો મોહ જાગે છે અને પછી એ મોહને કારણે વ્યક્તિ અનર્થ આચરે છે. વળી બને છે એવું કે આ મોહિની માયાને પ્રાપ્ત કરવાના લોભમાં માણસ દોડે છે ખરો, પરંતુ એની ઈચ્છા પ્રમાણે કશું પામતો નથી. એણે ધાર્યું હોય છે તે ભોગ પ્રાપ્ત થતા નથી અને આમ એ અધૂરપ અને અતૃપ્તિમાં જ જીવતો રહીને જીવન પૂર્ણ કરે છે.

સંત કબીર સતત એ ભેદ બતાવે છે કે માયા

તરફ મુખ રાખનાર અને માયાથી વિમુખ રહેનાર બંનેની પ્રકૃતિ અને પરિણામ જુદા હોય છે. એમના મતે માયા અને છાયા સમાન હોવા છતાં બહુ વિરલ માણસો જ એને સમજતા હોય છે. એ કહે છે કે માયા તો એવી છે કે જે એના તરફ પીઠ રાખે છે, એની પાછળ પાછળ આવે છે અર્થાત્ માયાની પરવા નહીં કરનાર બેપરવા, મસ્ત માનવી બધું જ પ્રાપ્ત કરતા હોય છે અને જે માયાના પડછાયાની પાછળ ચાલતા હોય છે, તેની આગળ માયા ભાગતી હોય છે અને એ માનવીને દોડાવતી હોય છે.

માયા અંધારી રાત જેવી છે. મોહ અને લોભમાં નિદ્રાધીન લોકોને કામ અને કોધ જેવા ડકુઓ દ્વારા લૂંટ ચલાવે છે. ક્યારેક કબીર એનાથીય આગળ વધીને કહે છે કે આ માયા એ તો સૂકાં હાડકાંનાં ઢગલાં જેવી છે અને લોભી મનુષ્ય એ શિયાળ કે કૂતરા જેવો છે. જેમ સૂકાં હાડકાંને પ્રાણીઓ સામસામે બેંચે છે, એ જ રીતે માયાગ્રસ્ત માનવી પોતપોતાની બાજુ વસ્તુઓને બેંચે છે અને મૃત્યુ પામે છે.

વળી, માનવીનું શરીર મૃત્યુ પામે છે, પરંતુ એનું મન, આશા, તૃષ્ણા કે માયા મૃત્યુ પામતા નથી, આથી આપત્તિઓના ઉત્પત્તિસ્થાન જેવી માયા એક અર્થમાં ગ્રાણ શાખાઓવાળું વૃક્ષ છે અને એ શાખાઓનું નામ છે શોક, દુઃખ અને સંતાપ. આ શાખાઓ વિકસતા વ્યક્તિને સ્વભન્માં પણ શીતળતા સાંપડતી નથી અને અંતે એને એના ફળ રૂપે નિરાશા અને દુઃખ મળે છે. સંત કબીરે દર્શાવ્યું કે મનુષ્યને આકર્ષક લાગતા ભોગો એ હકીકતમાં પતનકારી છે અને કડવો લાગતો ત્યાગ એ વાસ્તવમાં કલ્યાણકારી છે. એક સુંદર દણ્ણાત દ્વારા તેઓ કહે છે કે સહુને મીઠાઈ ખાવાનું મન થાય છે, પરંતુ એ મીઠાઈ શરીરમાં રોગ પેદા કરનારા જેર સમાન હોય છે. જ્યારે લોકો લીમડો વાટીને પીતા નથી કે જેનાથી

(અનુસંધાન પાના નં. ૨૭ પર...)

શ્રી પૂજ્યપાદ આચાર્ય વિરચિત
સમાધિતંત્ર - અમૃતરસપાન
(ક્રમાંક - ૫૬)

પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાડ)

ઉધ્વર્ગામિની આત્મવિદ્યાના રસસિદ્ધ કવીશ્વર, અપૂર્વ આત્મદશાના મુનીશ્વર અને આત્મિક યોગીઓના પણ યોગીશ્વર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજયંદળ્ણની તપ વિષયક સૂક્તિઓ છે કે (૧) “દ્વાદશપ્રકારના તપ વડે કરી કર્મઓધને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. (૨) તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં (૩) અર્હતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશર્યા કરે છે તો તે નિયમથી દેવલોક અંગીકાર કરે છે. (૪) ધીર વીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમોને છીડી, કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. (૫) તપનું અભિમાન કેમ ઘટે? ત્યાગ કરવો તેનો ઉપયોગ રાખવાથી. ‘મને આ અભિમાન કેમ થાય છે?’ એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મોળું પડશે. (૬) તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. કષાય ઘટે તેને ‘તપ’ કહ્યું છે. લૌકિક દાણિ ભૂલી જવી. (૭) અજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.” ઈત્યાદિ સૂક્તિઓની દિવ્ય સરસ્વતી મુમુક્ષુને પરમ ઈષ છે. ગ્રહવા યોગ્ય છે. અંત:કરણમાં સ્થાપવા યોગ્ય છે.

‘સમાધિતંત્ર’ ગ્રંથ સાધકને સમભાવની સમાધિ પ્રદાન કરે છે. તેમાં બહિરાત્મા કેવી રીતે પરમાત્મા બને તેની પ્રયોગવીરતાની કેડી કંડારી છે. શાસ્ત્ર પ્રમાણો, સદ્ગુરુ બોધે સ્વીકાર કરી અંતમુખ બની સાધના આરાધે તો કાર્યસિદ્ધ થઈ શકે છે.

આપણે શ્લોકનો વિશેષાર્થ સમજી રહ્યા છીએ. પ્રથમ શબ્દ વિચાર્યો કે આત્મા અને દેહના ભેદજ્ઞાનથી જન્મેલ આલ્બાદથી આનંદ થયો છે તે. હવે તપસા શબ્દનો અભ્યાસ કરીએ.

૨. તપસા : અર્થાત્ તપથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર રત્નત્રય આરાધક મુનિ ઉત્કૃષ્ટ તપથી દુર્જ્યમ દૂર કરે છે. શ્રી શીતલપ્રસાદજી નોંધે છે કે આચાર્ય શિષ્ય કા સમાધાન કરતે હુએ કહતે હું કિ, “તપ કો કરતે હુએ ખેદ ઉસી કો હોતા હૈ જિસકો આત્મજ્ઞાન નહીં હોતા તથા જો ઉસ આત્મજ્ઞાન સે ઉત્પત્ત પરમાનન્દ કા સ્વાદ નહીં પાતા। આત્માનુભવ સે જો પરમ તૃપ્તિકારી સુખ હોતા હૈ, ઉસ સુખ કી પ્રાપ્તિ કી ગરજ સે યદિ કિસી તપસ્વી ને ઘોર તપસ્યા ભી શુરૂ કી હો તો ભી ઉસકો ઉસ તપકે તપને મેં કોઈ કષ્ટ નહીં હોતા।”

૩. ઘોરં દુષ્કૃતં ભુજ્જાનઃ : અપિ - ભ્યાનક દુર્જ્યમાને ભોગવતો હોવા છતાં. તપશર્યામાં સ્થિત થયેલા મુનીશ્વરને ઉપસર્ગ આદિ આવી જાય તો તેઓની કોઈ પ્રતિક્રિયા નથી. સ્વદ્શામાં રહીને ઉપસર્ગને પસાર કરી જાય છે. મુનીશ્વરને ઉપસર્ગ આત્મદશાની દઢતાનું નિમિત્ત મળે છે.

દેષાન્ત : શ્રી ગજસુકુમારમુનિનું દેષાન્ત વિચારીએ. હાથીનું ગળા પાસેનું તાળાનું ખૂબ કોમળ હોય છે. શ્રી ગજસુકુમાર મુનિ એટલા કોમળ હતા તેથી તેઓનું નામ ગજસુકુમાર હતું. સોળ વર્ષની વયે શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞા લઈ, સ્મશાનમાં પ્રતિમા ધારણ કરી કાયોત્સર્ગ-ધ્યાનમાં રહ્યા. સોમલ બ્રાહ્મણ આવી ચડતાં વૈરભાવ જાગૃત થયો. માટીની પાળ બાંધી, સ્મશાનમાં પડેલા અંગારા

પાળ બાંધેલ માથા ઉપર ભર્યા. સોળ વર્ષના સુકુમાર મુનિનું મસ્તક તડ તડ ટૂટવા લાગ્યું અને મુનિરાજ વધુને વધુ આત્મસ્વભાવમાં સ્થિર થતાં ગયા. દેહભાવ જતો રહ્યો. શુકલધ્યાનની શ્રેણીએ ચઢ્યા - ક્ષપકશ્રેણીના ધણી બન્યા. કેવળજ્ઞાનની જ્યોત પ્રગટી. મસ્તક બળવા લાગ્યું. આયુષ્ય કર્મ પૂર્ણ થયું અને સિદ્ધત્વને મુનિરાજ વર્યા. જ્ઞાની ભારે તપશ્ચર્યા સાધે તો પણ તેમને ખેદ થતો નથી. માટે તેઓને નિર્વાણની પ્રાપ્તિ સંભવે છે - હોય છે.

શ્રી સુકોશલ મુનિ ઉપર ઉપસર્ગ આવ્યો.
 શરીર ખવાતું હોવા છતાં આત્મધ્યાને લીન છે. પાંચ
 પાંડવોને ધગધગતી લોઢાની સાંકળથી બાંધ્યા. ત્રણ
 મોટા બાંધવ આત્મધ્યાનમાં લીન બન્યા. શરીરનો
 વિકલ્પ છૂટી ગયો છે. ક્ષપકશ્રેષ્ઠીની સાધના સાધતા
 આયુષ્ય પૂર્જ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વિદ્ધાને
 પામ્યા. તેઓના નાના બંને ભાઈને કુરુણાભાવ
 આવ્યો કે મોટાભાઈઓને કેવી વેદના થતી હશે !
 જેથી નિર્વિકલ્પ શ્રેષ્ઠી તૂટી. આયુષ્ય તેઓનું પણ
 પૂર્જ થયું પણ સવર્થસિદ્ધ વિમાનમાં દેહધારણ થયો.
 તેણીસ સાગરોપમ સિદ્ધત્વદશાથી દૂર થયા.
 જૈનદર્શનની સૂક્ષ્મતા અદ્ભુત અને અવર્ણનીય છે.

તીર્થકરોને પણ મુનિપણામાં ઉપસર્ગો આવ્યા છે, રોગાદિ થયા છે પણ ભેદજ્ઞાનની ઉત્કૃષ્ટ દર્શામાં બિરાજમાન આત્માઓ બાધ્ય વિપરીતતાથી ભેદ-ભિન્ન થતાં નથી. વિશેખ પુરુષાર્થી બનીને આત્મધ્યાનમાં સ્થિર થાય છે. શ્રી પાર્શ્વનાથ મુનિરાજ છે. કમઠની દાસ્તિ તેઓ પર જાય છે. જાતિસ્મરણજ્ઞાન થતાં વેરભાવ જન્મે છે. મુનિને ભયંકર ઉપસર્ગો આપે છે, પણ શ્રી પાર્શ્વનાથ મુનિરાજ સ્વશ્રેષ્ઠીમાં લીન બને છે. સ્વ ઉપકારના ભાવે ધરણેન્દ્ર-પદ્માવતી દેવી રક્ષા માટે આવે છે પણ તીર્થકરના જીવને વળી રક્ષા કેવી ? સ્વ-ધ્યાન લીન ભગવાન શુક્લધ્યાને ચઢ્યા, શ્રેષ્ઠી આરોહણ પામી, કેવળજ્ઞાન પામી

મોક્ષને વરે છે.

જેમ સુવર્ણ અનિથી તપ્ત હોવા છતાં તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદ્યથી તપ્ત હોવા છતાં પોતાના જ્ઞાનીપણાને છોડતા નથી એમ ગ્રંથાધિરાજ સમયસારની ૧૮૪ ગાથામાં કહું છે. આ જ ગ્રંથની ૫૧-૫૨ ગાથાની ટીકામાં કહે છે, ‘સહજ નિશ્ચયનયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે.

શ્રી દૌલતરામજી કૃત ‘દા દાળા’ ગ્રંથની છષ્ટી દાળમાં કહે છે.

“સમ્યકું પ્રકાર નિરોધ મન-વચ્ચે-કાય આતમ ધ્યાવતે,
તિન સુશિર મુદ્રા દેખિ, મૃગગણ ઉપલ ખાજ ખુજાવતે.”

મુનિરાજ મન-વચન-કાયાની ગુપ્તિમાં એટલા
લીન થઈ જાય છે કે તેઓની સ્થિર મુદ્રા દેખી પશુઓ
તેઓના શરીરને પથ્થર સમજી પોતાના શરીરને
ખંજવાળે છે પણ મુનિરાજ સ્વ-ધ્યાનમાં લીન રહે છે.

૪. ન ખિદ્યતે - ખેદ પામતા નથી. ન ખેદં ગચ્છતિ । સ્વરૂપાચરણને કારણે જ્ઞાની ખેદભિન્ન બનતા નથી. તેથી નિવાણિને પામે છે. શિષ્યનું આ રીતે પૂ. આચાર્યદિવે સમાધાન કર્યું છે. ખેદ પામે તો કર્મબંધ થાય છે. અહીં તો ખેદ પામતા નથી તેથી કર્મબંધ થતો નથી. કર્મબંધ થતો નથી તેથી ભવભ્રમણ ન થતાં નિવાણિની સ્થિતિ પામે છે. આત્મરસની જ્ઞાનીને અપૂર્વ મસ્તિ છે. શરીર ઉપર, દેહદણી થાય તો ધ્યાન ચ્યુત થતાં ખેદ આવી જાય પણ એવું બનતું નથી તેથી ખેદભિન્ન થતાં નથી.

પૂ. સોગાનીજ લખે છે કે મુનિઓને તો અંતરમાં આનંદનો સ્ત્રોત વહે છે. વીજળીના કરંટ જેમ અંતરમાં આનંદ ચાલી રહ્યો છે. પૂ. બેનશ્રી ચંપાબેનની સુધારસધારામાં આવે છે, “મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની. કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ. માગ્રા

નિજગુણોમાં જ રમણશીલ, નિરાલંબી હોય છે. મુનિરાજ મોક્ષપંથે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરા કરે છે.” “મુનિ અંતઃમુહૂર્તે અંતઃમુહૂર્તે સ્વભાવમાં દૂબકી મારે છે. અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે. તેની બહાર આવવું ગમતું નથી.” કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્ત્વચિંતન વગેરે. સાધકદશા એટલી વધી ગઈ છે, કે દ્વયે તો કૃતકૃત્ય છે જ પરંતુ પર્યાયમાં પણ કૃતકૃત્ય થઈ ગયા છે.

ભેદજ્ઞાનની પરમ તીક્ષણતા વર્તે છે. જ્ઞાનીને બાધ્ય ઉદ્ય આવે તો પણ સ્વમાં સ્થિરતા રહે છે. મુનિઓને તો ઉપસર્ગો આવે ત્યારે પુરુષાર્થની ધારા પ્રગાઢ થાય છે અને ઉપસર્ગમાં વધુ જીમતાં, શરીર લક્ષ છૂટી જતાં કેવળજ્ઞાની થાય છે. આયુષ્ય પૂર્ણ થાય તો નિર્વિષ પામે છે.

દેહથી ભિન્ન આત્માના જ્ઞાનાંદે પૂરા સુખી; તપ-તાપો દહે પાપો – ઉત્ત્ર, તોયે ન તે દુઃખી.

— પૂ. બ્રહ્મચારીજી

આત્મદેહવિભાગથી, ઉપજ્યો જ્યાં આહ્લાદ, તપથી હુઝૂત ઘોરને, વેદે પણ નહિ તાપ.

— શ્રી છોટાલાલભાઈ જી. ગાંધી.

જો જાનતા તન તથા નિજ આત્મ-ભિન્ન,

હોતા નહીં વહ કબી યતિ ખેદ ખિન્ન ।
શીતાતિશીત હિમ સે ડરતા નહીં હૈ,

સંતપ્ત ચૂલગિરિ પે તપતા વહી હૈ ॥

— પૂ. આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજ

(કુમશઃ)

• • •

સુવિચાર

- (૧) મૌત સે કિસકી ચારી ? આજ મેરી તો કલ તેરી બારી.
- (૨) ચાચિની એ જીવનનું શ્રેષ્ઠ ઘરેણું છે.
- (૩) સારા પુસ્તકો વિનાનું ઘર એટલે આત્મા વગરનું શરીર.
- (૪) કોઈને ન બને બાધક, એનું નામ સાધક.

• • •

શ્રી દેવચંદ્રજી ચોવીશી

અશોકભાઈ પી. શાહ

੮ਮਾ ਟੀਈਕੰਡ

શ્રી ચંદ્રપ્રભુ ભગવાન સ્તવન પ્રારંભ

ભૂમિકા : ગણિશ્રી દેવયંડજી મહારાજે શ્રી સુપાર્થ સ્તવનમાં પ્રભુના આનંદ ગુણની મુખ્યતા સાથે પ્રભુના અનેક વિશિષ્ટ ગુણોનું દર્શન કરાવી પ્રભુના ગુણગાન કર્યા. પ્રભુના ગુણગાન તે પ્રભુસેવા ૪ છે. પણ તે પ્રભુસેવાનું નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપ શ્રી દેવયંડજી પ્રસ્તુત સ્તવનમાં સાત નય દ્વારા બતાવી સાધકને મુમુક્ષુની ભૂમિકાથી માંડી સમ્યગુદર્શન અને તેનાથી આગળના ગુણસ્થાન આરોહણ કરાવી છે ક પરમાત્મપદ સુધી પહોંચાડી દે છે. શ્રી દેવયંડજીની ભક્તિ તત્ત્વજ્ઞાનસભર હોય છે તેનું આ સ્તવન એક ઉત્તમ ઉદાહરણ છે.

પ્રભુસેવાનું સ્વરૂપ જ્યારે ભગવાન મહાવીરે
પ્રદૂષેલી વીતરાગ દર્શનના પાયારૂપ અનેકાંત દણિથી
સાત નય દ્વારા આ સ્તવનમાં સમજુશુ ત્યારે દેખીતી
રીતે પ્રભુસેવાનું, કહો તો સાધનાનું જ સમસ્ત પાથેય
વિવિધ દણિકોણથી મળશે. તેનાથી બીજો લાભ એ
પણ છે કે પ્રભુભક્તિ અમુક રીતે જ થાય એવો
આગ્રહ મટી જ્યા અને સાધક પોતાની ભૂમિકા
અનુસાર યોગ્ય નયનું અવલંબન લેતો, પાત્રતા
વધારતો, પ્રગતિ કરતો જ્યા અને અંતે પોતાના
શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતારૂપ ધ્યેયને પ્રાપ્ત કરે.

‘નય’ એટલે કોઈપણ વસ્તુને સમજવાનો એક દસ્તિકોણ, Viewpoint. વસ્તુ અનંત ધર્માત્મક હોવાથી તેને વિવિધ મુખ્ય ધર્મો વડે, નય વડે સમજુએ ત્યારે જ તેનું સર્વાંગી પ્રમાણજ્ઞાન થાય. એક હાથી, સાત અંધ વ્યક્તિ અને એક સજજન દસ્તિવાન વ્યક્તિનું દસ્તાંત આ માટે સર્વવિદિત છે.

નય તે પ્રમાણજ્ઞાનનો અંશ હોવાથી, એક નયથી સમજુએ ત્યારે બીજા નય ગૌણ હોય પણ તેનો અભાવ નથી હોતો. તેથી તેનો વિરોધ ન હોય, તેનો પણ સ્વીકાર જ હોય. આ જ છે વીતરાગદર્શનની અનેકાંતદાસ્તિ અને તેને કહેવાની જે પદ્ધતિ તે છે 'સ્યાદ્વાદ'. ઇન્દ્રસ્થ સાધકનું જ્ઞાન મર્યાદિત હોવાથી તે દરેક પડખેથી વસ્તુને સમજે તો જ તેને વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. તેથી તેને પોતાની સર્વ પ્રકારની સાધનામાં આ અનેકાંતદાસ્તિનું અવલંબન લેવું ઘટે છે. પ્રભુસેવા પણ મોક્ષમાર્ગની સાધનાનું એક અગત્યનું અંગ હોવાથી તેને પણ અનેકાંતદાસ્તિથી સમજવી જરૂરી છે, જેથી તેમાં કોઈ એકાંતમાં બેંચાઈ જઈ સાધક પોતાના સ્વરૂપપ્રાપ્તિના લક્ષ્યી દૂર ન ચાલ્યો જાય. એ હેતુથી શ્રી દેવચંદ્રજીએ માત્ર સાધકના આત્મકલ્યાણને આગળ કરી આ સ્તવનમાં પ્રભુસેવાને સાત નય દ્વારા રજૂ કરી આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે.

સાત નય સમજવા પ્રારંભિક અવસ્થામાં
કઠિન લાગે પણ મહાવીરનો અનુયાયી તેના જ
પ્રરૂપેલા અનેકાંતના મુખ્ય સિદ્ધાંતમાં આવરિત સાત
નયને સમજવાનો અભિલાષી તો હોવો જ જોઈએ
ને ? તેથી તેને ધીરજપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ
તો આપણી સાધનામાં જો લેશ પણ દુરાગ્રહ કે
મતાગ્રહના અંશ હોય તો તે ટળી જશે, કોઈ
વિપક્ષની વાત કે દાખિલોણ સમજુને સ્વીકારવાની
ઉદારદાખિ કેળવાશે અને પવિત્ર, નિર્મલ
આધ્યાત્મિકતા તરફ આગળ વધાશે. આ લેખકને
પણ આ સ્તવનમાં કહેલ સાત નયથી જિનસેવાની
વાત સમજવામાં કઠિન લાગતાં આચાર્યશ્રી
વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી તથા પૂજયશ્રી

રાકેશભાઈના વિવેચનોનો મુખ્ય આધાર લઈ અહીં પથાશક્તિ રજૂઆત કરી છે. આશા છે કે સર્વ મુમુક્ષુઓને પ્રભુભક્તિના સર્વાંગી સ્વરૂપને સમજવામાં તે લાભકારી નીવડે. તો ચાલો, આટલી ભૂમિકા સાથે હવે સ્તવનનું અવલોકન કરીએ :

**શ્રી ચંદ્રપ્રભ જિનપદ-સેવા હેવાએ જે હલિયાજી;
આતમગુણ અનુભવથી મલિયા,**

તે ભવભયથી ટલિયાજી. શ્રી૦૧

શબ્દાર્થ : જેને શ્રી ચંદ્રપ્રભુ જિનેશ્વરના ચરણની સેવા કરવાની ટેવ પરી ગઈ છે તેને આત્માના ગુણોના અનુભવરૂપ પ્રભુમિલન થાય છે અને તેનો ભવભ્રમણનો ભય ટળી જાય છે. (હેવાએ હલિયા = ટેવ પરી ગઈ છે; હેવા = ટેવ; મલિયા = પ્રભુ મળ્યા; ટલિયા = ટળે છે, નાશ પામે છે.)

વિશેષાર્થ : શ્રી દેવચંદ્રજી સૌ પ્રથમ તો પ્રભુપ્રેમમાં તલ્લીન એવા એક ઉત્તમ ભક્તનો ઉત્સાહ અને ઉમંગ બતાવે છે કે જે શ્રી ચંદ્રપ્રભુની ચરણસેવામાં “હેવાએ હલિયો” છે — અર્થાત્ તેને જિનપદ-સેવાની એવી ટેવ પરી ગઈ છે કે જ્ઞાણે તે જ તેનું જીવન હોય, તેના પ્રાણ હોય. “વાયક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે” — એવી તેની ભક્તિમય દશા છે. જેમ કોઈ વ્યસનીને વ્યસનની ટેવ હોય તેમ આને પ્રભુભક્તિની એવી ટેવ પરી છે, એવી લત લાગી છે કે તેના વિના તેને ચેન ન પડે. પ્રભુસેવાની ટેવથી તે એવો હલી ગયો છે કે પ્રભુપ્રેમના વાયરાથી તેનું સમસ્ત અસ્તિત્વ હચ્છયા ગયું છે, જેનાથી જીવનમાં એક આધ્યાત્મિક કાંતિ જાગી છે. એવી કાંતિ કે પોતાના દોષોને દૂર કરવામાં અને પ્રભુ જેવા ગુણો અપનાવવામાં અવિરત પુરુષાર્થ જાગે છે અને તેમાં હવે જરાય પ્રમાદ તેને પોષાતો નથી.

આવા પ્રભુપ્રેમીને તેની “જિનપદ-સેવા”ના બે પારમાર્થિક ફળ મળે છે : (૧) આત્મગુણ

અનુભવથી મલિયા, (૨) ભવભયથી ટલિયા. જીન સેવાથી ધીમે ધીમે સાધક નિજસેવા તરફ વળતો જાય છે. અર્થાત્ પ્રભુ સાથે એકત્વ થતાં પ્રભુના જેવા જ આન્મિક ગુણો જેમ કે સમ્યક્જ્ઞાન-દર્શન, નિરાકૃત આનંદ જેવા ગુણો જે અત્યાર સુધી આવરિત હતા તે સાધકની દશામાં પ્રગટ થાય છે; એટલું જ નહિ, તેનો અનુભવ પણ થાય છે. વળી, ભવભ્રમણના કારણરૂપ એવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આદિ દોષો કમશઃ નાશ પામતાં તેનો હવે થોડા જ ભવોમાં સંસારનો અંત થવાનો હોવાથી ભવનો, જન્મ-મરણનો ભય ટળી જાય છે. સાધકનું જાગ્રત ઉપાદાન અને જિનપદ-સેવારૂપ ઉત્તમ નિમિત્તની સંધિ થતાં કેવું ઉત્તમ ફળ આવે તે આપણને પ્રેરણારૂપે શ્રી દેવચંદ્રજીએ આ ગાથામાં દર્શાવ્યું. જે સેવાથી આત્મગુણોનો સાક્ષાત્કાર અને ભવનો અંત આવતો હોય તેવી પ્રભુસેવાનું સ્વરૂપ સમજવું અત્યંત જરૂરી છે. એ દસ્તિએ શ્રી દેવચંદ્રજી સેવાના મુખ્ય બે પ્રકાર - દ્રવ્યસેવા અને ભાવસેવાની સમજણ હવે પછીની ગાથાઓમાં આપશે. (ખરેખર ચાર નિક્ષેપથી સેવાના ચાર પ્રકાર છે — નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-સેવા. તેમાંથી અહીં મુખ્ય બે પ્રકારનો ઉલ્લેખ છે.) દ્રવ્યસેવાનું સ્વરૂપ બીજી ગાથામાં અને ભાવસેવાનું સ્વરૂપ વિસ્તૃતપણે સાત નય દ્વારા ગાથા ત્રીજીથી નવમી સુધી આવશે. તો પહેલાં દ્રવ્યસેવાનું સ્વરૂપ માત્ર એક ગાથામાં પ્રસ્તુત કરે છે તે જોઈએ : દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્થન વળી ગુણગ્રામોજી, ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિષ્કામોજી. શ્રી૦૨

શબ્દાર્થ : પ્રભુને વંદન, નમન, પૂજન કરવું તેમ જ તેમના ગુણગ્રામ કરવા એ દ્રવ્યસેવા છે, જેમાં પરભાવ પ્રત્યે નિષ્કામપણું છે અને પ્રભુ સાથે ભાવ-અભેદતા સાધવાની ઈચ્છા છે. (અર્થન = પૂજન; ગુણગ્રામોજી = ગુણોનું ગાન, કીર્તન; ઈહા = ઈચ્છા; પરભાવે = પરમાં જતો ઉપયોગ; નિષ્કામો = કામનારહિતપણું)

વિશેષાર્� : પ્રભુને મંદિરમાં જઈ વંદન, નમન કરીએ, ચૈત્યવંદન કરીએ, અષ્ટદ્રવ્યપૂજા-અર્ચના કરીએ, અભિષેક-પ્રક્ષાલ કરીએ, પ્રભુના ગુણગાન કરું કીર્તન, સુતિ કરીએ - આ સર્વે મન, વચન, કાયાના યોગથી થતી ક્રિયાઓ હોવાથી તેને દ્રવ્યસેવા કહી છે. પરંતુ અહીં શ્રી દેવચંદ્રજી એક ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય અને ચેતવણીરૂપ લાલબત્તી ધરે છે કે આ દ્રવ્યસેવા કરતી વખતે (૧) પરમાત્મા સાથે અભેદ થવાની તીવ્ર ઈચ્છા (ઈહા) હોવી જોઈએ, તેની જૂરણા અને જંખના હોવી જોઈએ. અર્થાત્ પરાભૂતિ સુધી પહોંચવાના લક્ષ સાથે તે થવી જોઈએ અને (૨) પરભાવનો, પુણ્યાદિનો, લૌકિક ક્ષણિક સુખની કામનાનો ભાવ તેમાં બિલકુલ ન હોવો જોઈએ. નિઝામપણે, કોઈ પરદ્રવ્યની અપેક્ષા વિના તે દ્રવ્યસેવા થવી જોઈએ. ટૂંકમાં તે દ્રવ્યસેવા ભાવસેવાના લક્ષથી થતી હોય તો જ તેને દ્રવ્યસેવા કહેવાશે, નહીં તો તે માત્ર શુભક્રિયામાં ખપશે કે જે માત્ર અલ્ય પુણ્યનું કદાચિત કારણ બને, જે સાધકનું લક્ષ નથી. ભાવસેવા એટલે સાધકના અંતરંગ પરિણામોની શુદ્ધિ, જેનું સ્વરૂપ વિસ્તારથી આગળની ગાથાઓમાં શ્રી દેવચંદ્રજી સમજાવે છે તે જોઈએ : ભાવસેવ અપવાદે નૈગમ, પ્રભુ-ગુણને સંકલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદાભેદ વિકલ્પેજી. શ્રી૦૩

શબ્દાર્થ : પ્રભુગુણનો સંકલ્પ કરવો તે નૈગમનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે. પ્રભુ સાથે ભેદ અને અભેદતાના વિકલ્પ સહિત, મારી આત્મસત્તા પ્રભુ સમાન છે એવી તુલના અને આરોપણ કરવું તે સંગ્રહનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે. (સત્તા = આત્મસત્તા, તુલ્યારોપે = તુલના અને આરોપણ કરવું. બીજા શબ્દોના અર્થ વિશેષાર્થમાં જ સમાવી લીધા છે.)

વિશેષાર્થ : હવે આ ગાથાથી નય-વિવક્ષા શરૂ થાય છે. સૌ પ્રથમ તો શ્રી દેવચંદ્રજી ભાવસેવાના

બે પ્રકાર બતાવે છે : (૧) અપવાદ ભાવસેવા, જેને ગાથા ત થી પ સુધી સાત નય દ્વારા રજૂ કરી છે અને (૨) ઉત્સર્જ ભાવસેવા. તેને પણ ગાથા ૬, ૭, ૮માં સાત નય દ્વારા રજૂ કરી છે. આ બંને પ્રકારની સમજણ જો કે ગાથા ૮માં આપી છે છતાં અહીં જ તે સમજી લઈએ, જેથી આગળની નય - વિવક્ષા સમજવી સહેલી પડે.

જિનેશ્વરની ભક્તિ આદિ આત્માના વિશુદ્ધ પરિણામ જે (સ્વાત્મોપલબ્ધિરૂપ કાર્યના) કારણરૂપે છે, તેને ‘અપવાદ ભાવસેવા’ કહેવાય છે. અને જ્યાં સ્વાત્મોપલબ્ધિરૂપ કાર્ય થઈ ચૂક્યું છે તેવા આત્માના શુદ્ધ પરિણામ તેને ‘ઉત્સર્જ ભાવસેવા’ કહેવાય છે. આમ, અપવાદ અને ઉત્સર્જ ભાવસેવા વચ્ચે કારણ-કાર્ય સંબંધ છે. અપવાદ ભાવસેવા તે કારણ અને ઉત્સર્જ ભાવસેવા તે કાર્ય. અહીં ગાથા-ઉમાં અપવાદ ભાવસેવાને બે નયથી રજૂ કરી છે - નૈગમનય અને સંગ્રહનય.

નૈગમનયથી અપવાદ ભાવસેવા : નૈગમનય એટલે જેમાં લોકદિનો, લોકરૂદ્ધિનો સ્વીકાર હોય તેવો દાષ્ટિકોણ. કોઈ પદાર્થ, ક્રિયા આદિમાં ભૂત-ભાવિ આદિનો વર્તમાનની જેમ સંકલ્પવિશેષ કરવો તેને નૈગમનય કહે છે. જેમ કે ભાવિમાં તીર્થકર થનાર મહાત્મા શ્રેષ્ઠિકને હમણાં જ તીર્થકર કહેવા તે ભાવિ નૈગમનય છે. એ જ રીતે અહીં જિનભક્તિનો અનુરાગી સાધક ભાવિમાં થનારી ઘટનાનો હમણાં જ સંકલ્પ કરે છે, કે “પ્રભુગુણને સંકલ્પેજી” - મારામાં પ્રભુ જેવા ગુણો પ્રગટે. વર્તમાનમાં ભાવિનો સંકલ્પ તેથી નૈગમનય અને આવો સંકલ્પ તે સાધકનો અંતરંગ આત્મ-પરિણામ હોવાથી તે ભાવસેવા છે. હજુ તે ગુણો પ્રગટ્યા ન હોવા છતાં તેનો સંકલ્પમાત્ર પણ એક ઉત્તમ ભાવ હોવાથી તેને ભાવસેવા કહેવાની ઉદારતા તે નૈગમનય અને આગળ ઉપર તે ગુણો પ્રગટવારૂપ

કાર્યસિદ્ધિનો આવો સંકલ્પ તે કારણરૂપ બનતો હોવાથી તે ‘અપવાદ ભાવસેવા’. આ સંકલ્પ તે કંઈ કલ્પના નથી, પણ અંતરંગ આત્મબળ છે. સંકલ્પરૂપ કારણ આપીશું તો કયારેક પ્રભુ જેવા થવાનું કાર્ય બનશે ને ! આવી સુંદર પ્રેરણા અને ઉત્સાહ આ ‘નૈગમન્યથી થતી ‘અપવાદ ભાવસેવા’માંથી મળે છે.

સંગ્રહનયથી અપવાદ ભાવસેવા : સંગ્રહનય એટલે બે કે વધારે વસ્તુઓમાં રહેલા ભેદને ગૌણ કરી તે સર્વમાં રહેલી સમાનતાને, સામાન્ય ગુણોને મુખ્ય કરે, ગ્રહણ કરે તે સંગ્રહનય. સાધક પ્રભુભક્તિ કરતાં નિરંતર પ્રભુ સાથે પોતાની તુલના કરે છે. અને ત્યારે “ભેદાભેદ વિકલ્પેજી” – પ્રભુની પરમાત્મદશા અને પોતાની પામરદશા વચ્ચેનો ભેદ તેમ જ પ્રભુની ચૈતન્યસત્તા જેવી મારી ચૈતન્યસત્તા છે એમ અભેદતા - એ રીતે પહેલાં તો ભેદ-અભેદતાના વિકલ્પો તેને હોય છે. પરંતુ પ્રભુ સાથે એકત્વ સાધવા “હું પ્રભુ જેવો”; “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” - પરમાત્મા અને સદગુરુ જેવો જ હું સહજ-આત્મસ્વરૂપ, એમ પ્રભુ સાથેની સમાનતાને મુખ્ય કરે છે. “સંગ્રહ સત્તા તુલ્યારોપે” – મારી આત્મસત્તા શક્તિ અપેક્ષાએ પ્રભુ જેવી જ છે એવું તુલનાત્મક આરોપણ કરી પ્રભુની પ્રગટ સત્તા સાથે પોતાની અપ્રગટ સત્તાને સરખાવવી અને એ રીતે પ્રભુ સાથે જે સાચ્ય છે તેનું ચિંતન કરવું તે છે ‘સંગ્રહનયથી અપવાદ ભાવસેવા’. પૂજ્યશ્રી રાકેશભાઈ આ નયને એક સુંદર દિશાંતથી સમજાવે છે કે એક વ્યક્તિએ પ૫૦૦ રૂ.ની નોટ ખીસામાંથી વાપરવા માટે બહાર કાઢી છે અને બીજાએ પ૫૦ રૂ.ની નોટ ખીસામાં રાખી મૂકી છે. - એમ માત્ર પ્રગટતા, અપ્રગટતાનો જ ભેદ છે, સત્તા અપેક્ષાએ કોઈ ભેદ નથી ! “હું પ્રભુ જેવો જ છું” – એવો ભાવ લાવવાથી પોતાની પામરતાને પ્રભુતામાં

પલટાવવાનો એક અદ્ભુત ઉત્સાહ અને વીર્યબળ જાગે છે. સંગ્રહનયની દિલ્લિએ થતી આ ભાવસેવા આગળની આત્મસિદ્ધિરૂપ કાર્યમાં કારણભૂત હોવાથી તેને ‘અપવાદ’ ભાવસેવા કહી છે. હવે આગળની ગાથામાં વ્યવહારનય અને ઋજુસૂત્રનય વડે શ્રી દેવચંદ્રજી અપવાદ ભાવસેવાનું સ્વરૂપ સમજાવે છે તે જોઈએ :

વ્યવહારે બહુમાન શાન નિજ, ચરણો જિનગુણ રમણાજી; પ્રભુગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાન સ્મરણાજી.

શ્રી૦૪

શબ્દાર્થ : પોતાના જ્ઞાનમાં પ્રભુનું બહુમાન થાય અને જિનેશ્વરના ગુણોરૂપ ચરણકમળમાં રમણતા થાય તે વ્યવહારનયથી ભાવસેવા છે અને આમ પ્રભુના ગુણોના આલંબન લઈને ધ્યાન અને સ્મરણ દ્વારા સ્વ-આત્માના શુદ્ધ પરિણામ થાય તે ઋજુસૂત્રનયથી ભાવસેવા છે.

વિશેષાર્થ : સંગ્રહનયમાં સમાનતા મુખ્ય હતી તો હવે વ્યવહારનયમાં સાધકના અને પ્રભુ વચ્ચેના ભેદને, તફાવતને મુખ્ય કરી ભક્તિ થાય છે. પોતાની પામરદશાની સામે પ્રભુની સર્વજ્ઞતા અને વીતરાગતારૂપ દશા તેમજ પ્રભુની દેશનારૂપ હિતોપદેશીપણાના ઉપકારનું જ્યારે સ્મરણ થાય છે, ત્યારે સાધકને પ્રભુ પ્રત્યે અત્યંત બહુમાન જાગે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવથી જે ભાવોલ્લાસ જાગે છે તેના દ્વારા તે પ્રભુના ગુણોરૂપી ચરણકમળમાં રમણતા કરે છે, તન્મય થાય છે. પ્રભુના ગુણોને અનુસરનારા સાધકના નિજ જ્ઞાનાદિ ગુણોના પરિણામ તે વ્યવહારનયથી પ્રભુની અપવાદ ભાવસેવા છે. વ્યવહારનય એટલા માટે કે અહીં (૧) પ્રભુની અને પોતાની દશા વચ્ચેના ભેદને મુખ્ય કર્યો છે અને (૨) પ્રભુરૂપી પરદવ્યનું અહીં અવલંબન છે.

ઋજુસૂત્રનય એટલે સરળનય, જે ભૂત,

ભવિષ્યની અપેક્ષા ન રાખતા માત્ર વર્તમાન પર્યાયને જ લક્ષમાં લઈ કથન કરે છે. જેમ કે, જે રાજ્ય કરી રહ્યો છે તે જ રાજી. રાજકુંવરને ભવિષ્યનો રાજી માની તેને આ નય રાજી કહેતો નથી. પ્રભુનું અવલંબન લઈને હવે સાધક એક પગલું આગળ વધી નિઝાતમાનું અવલંબન લ્યે છે. ધ્યાન અને આત્મસ્મરણ દ્વારા સાક્ષીભાવના અભ્યાસથી આત્મસ્વરૂપમાં સ્થિરતા કરે છે તે ઋજુસૂત્રનયથી ભાવસેવા છે. કારણ કે ધ્યાન અને સાક્ષીભાવ દ્વારા થતી સાધકની તે વર્તમાન પરિણાતિ છે. હવે આગળ ગાથા-પમાં શ્રી દેવચંદ્રજી અપવાદ ભાવસેવા છેલ્લા નાણ નય-દ્વારા રજૂ કરે છે :

શબ્દે શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી;
બીએ શુક્લ અવિકલ્પ એકત્વે,

એવંભૂત તે અમમેજી. શ્રીંપ

શબ્દાર્થ : શુક્લ ધ્યાન પર આરોહણ તે શબ્દનયથી, દશમા ગુણસ્થાને સમભિરૂઢનયથી ને બીજું શુક્લધ્યાન જ્યાં નિર્વિકલ્પ, નિર્મભ, સમાધિરૂપ સ્વરૂપ સાથે એકત્વતા છે તે એવંભૂતનયથી અપવાદ ભાવસેવા છે.

વિશેષાર્થ : હવેના ત્રાણ નયથી થતી અપવાદ ભાવસેવાનો શ્રી દેવચંદ્રજીએ સાધકના ગુણસ્થાન સાથે સંબંધ કર્યો છે. (એ દિલ્લીએ ઉપરોક્ત વ્યવહારનયથી થતી ભાવસેવામાં શ્રાવકના સ્વાધ્યાય, ભક્તિ, પૂજા આદિનો સમાવેશ થતો હોવાથી તે પાંચમા ગુણસ્થાને અને ઋજુસૂત્રનયથી થતી ભાવસેવામાં ધ્યાનની મુખ્યતા હોવાથી તે મુનિદશાનું છિંહ અને સાતમું ગુણસ્થાન એમ લઈ શકાય.) હવે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયથી ગણિશ્રી અપવાદ ભાવસેવાનું જે સ્વરૂપ બતાવે છે તે જોઈએ.

આચાર્યશ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી આનું ટૂંકું વિવેચન કરતાં લખે છે, “શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્યના આલંબન વડે પૃથક્તવ-

વિતર્કસપ્રવિચારરૂપ પ્રથમ પ્રકારનું શુક્લધ્યાન ધ્યાવવું તે શબ્દનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.” શ્રેષ્ઠી આરોહણ કરતાં ૮મા ગુણસ્થાને પ્રથમ શુક્લધ્યાન હોય છે. જે અર્થ મનમાં ધાર્યો હોય તે જ પ્રમાણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરવો તેને શબ્દનય કહે છે. કારણરૂપ અપવાદ ભાવસેવાનો ખરો અર્થ શુક્લધ્યાનના પહેલા તબક્કામાં પ્રગટ થતો હોવાથી તે ભાવસેવા શબ્દનયની અપેક્ષાએ કહી. સમભિરૂઢનય શબ્દનું વધારે સ્પષ્ટીકરણ માંગે છે. આ નય એક શબ્દના અનેક અર્થોમાંથી મુખ્ય જે પ્રસિદ્ધ થઈ ગયો હોય તેને જ ગ્રહણ કરી બાકીનાને ગૌણ કરે છે. દશમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાને માત્ર અત્યંત સૂક્ષ્મ લોભ કષાય છે અને જો ક્ષપકશ્રેણી ચઢે તો તુરત તેનો નાશ થવાનો છે એ દિલ્લીએ ભાવસેવાના અર્થની અહીં વધુ સ્પષ્ટતા હોવાથી ગણિશ્રી દેવચંદ્રજી દશમા ગુણસ્થાનનો સમભિરૂઢનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા કહે છે. એવંભૂતનય : જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે, તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે પદાર્થને ગ્રહણ કરનાર તે એવંભૂતનય છે. જેમ કે પૂજારી જ્યારે પૂજા કરતો હોય તે સમયે જ પૂજારી કહેવો, અન્ય સમયમાં ન કહેવો તે એવંભૂતનયથી પૂજારી. એ જ રીતે બારમા ક્ષીણમોહ ગુણસ્થાને જ્યાં બીય એટલે શુક્લધ્યાનનો બીજો પ્રકાર વર્તે છે ત્યાં નિર્વિકલ્પ સમાધિરૂપ છંચસ્થ વીતરાગદશા હોવાથી ‘તે સમયની’ ભાવસેવા તે એવંભૂતનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.

આમ, ઉપરોક્ત સાતે નયમાં થતી ભાવસેવા તે સર્વેને અપવાદ ભાવસેવા તરીકે ગણિશ્રી દેવચંદ્રજીએ પ્રસ્તુત કરી. ત્યારબાદ આ જ સાત નયથી ‘કાર્યસિદ્ધરૂપ’ ઉત્સર્ગ ભાવસેવાનું સ્વરૂપ આગળની ગાથાઓમાં આવશે, જે યથાવસરે વિચારીશું.

(કમશા:)

• • •

શ્રાવકાચાર (એકદેશ ચારિત્ર)

(કમાંક - ૧૬)

બા.બ્ર. શ્રી સુરેશજી

(ગતાંકથી ચાલુ...)

શ્રાવકની પ્રતિમાઓ

(૧૧) ઉદિષ્ટત્યાગ પ્રતિમા :- પોતાને લક્ષ્યમાં રાખીને અન્યો દ્વારા બનાવેલ આહારનો ત્યાગ કરવો ઉદિષ્ટત્યાગ પ્રતિમા છે. અર્થાત્ આ પ્રતિમાના ધારી શ્રાવક ન તો પોતાના માટે સ્વયં આહાર બનાવે છે અને ન તો તેમને લક્ષ્યમાં રાખીને અન્ય દ્વારા બનાવેલ આહાર લે છે. એવો સાધક અતિથિ બનીને યોગ્ય ઘરોમાં ભિક્ષાટન માટે જાય છે. જ્યાં પણ તેમને પોતાને યોગ્ય પ્રાસુક આહાર આદર-સત્કાર-પૂર્વક મળી જાય છે, તેમના ઘરમાં તેઓ પૂર્વ આયોજન વિના આહાર ગ્રહણ કરે છે. આ પ્રતિમા સાધકની દેહ તથા ઈન્ડ્રિયવિષયો પ્રત્યે અતિઉદાસીનતા તથા અસાધારણ સંતોષવૃત્તિની પરિચાયક છે. આહાર સિવાય અન્ય સર્વ દેહને પોષણ કરનારા પરિગ્રહોનો તો પહેલા જ ત્યાગ કરી દીધો છે, હવે દેહસક્તિને પોષણ કરી શકે એવા આહાર તથા વસ્તુ બે જ સાધન બચ્યા છે. પોતાના માટે સ્વયં ભોજન બનાવતા નથી. ભીક્ષા દ્વારા જ કામ ચલાવે છે, ભીક્ષામાં પણ તેમના નિમિત્તથી ન બનાવ્યું હોય તથા તથારૂપ શુદ્ધ સાત્ત્વિક આહાર હોય, તેમાં પણ દાતા દ્વારા વિનય-ભક્તિપૂર્વક-હદ્યથી અપાય તો જ, લોકલાજ કે દ્બાવમાં આવીને ન દીધો હોય એવા જ આહારને આ પ્રતિમાધારી ગ્રહણ કરે છે. આ બધી અનુકૂળતાઓ સદાય મળવી મુશ્કેલ છે તેથી ક્યારેક - ક્યારેક આહારનો અલાભ પણ થાય છે પરંતુ તેને તપનો અવસર માનીને શાંતભાવથી ધર્મધ્યાનમાં

મન લગાવીને વિશેષ કર્મનિર્જરા કરે છે. વસ્તોમાં એક લંગોટી તથા એક ચાદર બે જ વસ્તુ રાખે છે. વાસણમાં માત્ર એક જ પાત્ર ભોજન માટે રાખે છે. આવો સાધક મુખ્યરૂપથી ગૃહિત્યાગ કરીને મુનિસંધમાં રહે છે. પોતાના જ્ઞાન, ધ્યાન, તપમાં વૃદ્ધિ તથા સંધર્થ સાધુઓની યથાયોગ્ય સેવા આ બે પ્રધાન કાર્ય આ પ્રતિમાધારી શ્રાવકના હોય છે. એમને કુલ્લક અને એલક એમ બે નામોથી જાણવા. પરંતુ એલકની સર્વ કિયાઓ મુનિ જેવી હોય છે. અંતર માત્ર એક લંગોટીનું જ હોય છે. કુલ્લક બે વસ્તુ રાખે છે, એલક એક વસ્તુ રાખે છે, કુલ્લક ભોજન માટે એક પાત્ર રાખે છે, એલક કરપાત્રી હોય છે. કુલ્લક બેઠા-બેઠા ભોજન કરે છે, એલક મુનિની જેમ ઊભા-ઊભા અથવા બેસીને પણ ભોજન કરી શકે છે. કુલ્લક વિહારાદિ માટે વાહનનો ઉપયોગ કરી શકે છે, એલક વાહનનો ઉપયોગ કરતા નથી. તેઓ પાદવિહારી હોય છે. કુલ્લક માટે કેશલોચનો નિયમ નથી, એલક નિયમથી કેશલોચ કરે છે. બસે શ્રાવકની જ શ્રેણીમાં આવે છે, બસે પંચમ ગુણસ્થાનવર્તી જ હોય છે, પરંતુ એલકની વિશુદ્ધિ કુલ્લકથી વધારે હોય છે. કુલ્લક ઉત્કૃષ્ટ તથા એલક સર્વોત્કૃષ્ટ શ્રાવકની ગણતરીમાં આવે છે. હકીકિતમાં આ દશા મુનિપણાની અતિનિકટની છે. આવો સાધક કોઈપણ સમયે મહાત્રતોને ધારણ કરીને પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો નાશ કરી શકે છે. આવો શ્રાવક આદરણીયથી પૂજનીય થાય છે.

આશય એ છે કે જેટલા-જેટલા વિષયોનો સંકલ્પપૂર્વક ત્યાગ કરવામાં આવે તેટલી-તેટલી અંતરંગ વાસનાઓની કમી થઈ જવાથી ઉપયોગ

વિશુદ્ધ થતો જાય છે. ઉપયોગ જેટલો-જેટલો વિશુદ્ધ થતો જાય છે, તેટલું અંતરંગ કષાયોનું ઉન્મૂલન થવા લાગે છે. કષાયોના ઉન્મૂલનથી નિરાકૃણતા વધ્યતી જાય છે, નિરાકૃણતાથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ સમાધિથી તત્કષણ અપૂર્વ નિજનંદ તથા અનંત કર્મની નિર્જરાનો લાભ થાય છે અને પરંપરાથી પરિપૂર્ણ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. એમ વસ્તુસ્વરૂપ જાણીને ઉપરોક્ત પ્રતિમાઓમાં વર્ણિત કર્મથી પોતાની શક્તિ ધૂપાવ્યા વિના વિષય-કષાયોના ત્યાગ માં ઉદ્ઘર્ષીલ રહેવું જોઈએ એવી આમ પુરુષોની દેશના છે.

સંલેખના (સમાધિમરણ)

● સ્વરૂપ :-

ઉપસર્ગે દુર્ભિક્ષે જરસિ રૂજાયાં ચ નિઃપ્રતીકારે ।
ધર્માય તનુવિમોચનમાહુઃ સંલેખનામાર્યઃ ॥

● અર્થ : જેનો પ્રતિકાર ન થઈ શકે એવા ઉપસર્ગ, દુકાળ, વૃદ્ધત્વ તથા રોગ થઈ જવાથી સ્વર્ધમની રક્ષા માટે શરીરનો ત્યાગ કરી દેવો તેને ગણધરાદિ આર્યો દ્વારા સંલેખના કહી છે.

આનું બીજું નામ સમાધિમરણ પણ છે. સમાધિનો અર્થ વિકલ્પરહિત થવું થાય છે. અર્થાત્તુ વિકલ્પરહિત થઈને દેહત્યાગ કરવો તે સમાધિમરણ કહેવાય છે. વિકલ્પનું મૂળ કારણ વાસના છે. આ ઈચ્છા જ વિવિધ પ્રકારના વિકલ્પોની જનની છે. જ્યારે કોઈપણ ઈચ્છા ન રહે ત્યારે વ્યક્તિ શાંત - નિરાકૃણ નિરીહવૃત્તિવાળો થઈ જાય છે. એમ નિરીહવૃત્તિયુક્ત થઈને દેહત્યાગ કરવો તે જ વાસ્તવમાં સમાધિમરણ છે. “આ જગતમાં મારે કોઈથી રાગ નથી અને ન તો કોઈથી દ્વેષ છે, મારો કોઈ શર્નુ નથી અને ન તો કોઈ મિત્ર છે. હું જ્ઞાન-દર્શન સ્વભાવી ચેતનતત્ત્વ સર્વથી ભિન્ન સ્વયંમાં જ પરિપૂર્ણ છું. આ લોકસંબંધી મને કોઈ ઈચ્છા નથી

અને પરલોક સંબંધી પણ મને કોઈ ભય કે ઈચ્છા નથી, મને ન તો જીવવાની ઈચ્છા છે ન તો મરવાની અભિલાષા, ન પરિવાર મિત્રાદિથી વિભૂતા પડવાનું દુઃખ છે, ન તો સ્વર્ગાદિના સુખોની લાલસા છે. બસ, હવે તો સર્વ જગતિક વાસનાઓનો ત્યાગ કરીને પોતાના ચૈતન્યલોકમાં જ રહેવું છે. પ્રત્યેક અવસ્થામાં સમત્વભાવમાં જ રહેવું છે. સમત્વભાવ જ પરમ નિર્ભય સ્થાન છે, શેષ સર્વલોક ભયસ્થાન જ છે, માટે હે ચેતન ! હવે કોણી આશા કરે છે, શાંત થઈ જા, નિરાકૃણ થઈ જા ! સ્વરૂપસ્થ થઈ જા ! આ પ્રકારના અભિપ્રાય અને પરિણામોથી યુક્ત થઈને શાંતભાવથી દેહત્યાગ કરવો તેને વાસ્તવમાં સમાધિમરણ કહેવાય છે.” પરંતુ આ પ્રકારના ભાવ એકાએક જ જાગતા નથી, તેના માટે પૂર્વની ધર્ષી સાધના અને ક્રમિક તૈયારીની આવશ્યકતા છે. આ ક્રમિક તૈયારીનું નામ જ સંલેખના છે. વાસ્તવમાં તો સમાધિમરણ સાધ્ય છે તથા સંલેખના તેની પ્રાપ્તિનું વિશેષ સાધન છે, પરંતુ સાધનમાં સાધ્યનો ઉપયાર કરીને સંલેખનાને જ સમાધિમરણ કહિ દીધું છે. આ સંલેખના બે પ્રકારથી લેવામાં આવે છે. (૧) અવિચાર (અપ્રાયોજિત) સમાધિમરણ તથા (૨) વિચાર (પૂર્વ પ્રાયોજિત) સમાધિમરણ.

(૧) અવિચાર સમાધિમરણ :- અચાનક સમુદ્રમાં તોઝાન આવવું, ધરમાં આગ લાગી જવી, પ્રાણધાતક લાગવો, અચાનક આકસ્મિક દુર્ઘટના થવી, તીવ્રાંગેરી સર્પ આદિનું દંશ દેવું ઈત્યાદિમાં જ્યારે એમ લાગે કે હવે જીવિત રહેવું અસંભવિત છે ત્યારે વિવેકી સાધક તરત જ સંલેખના પ્રત ગ્રહણ કરી લે છે. આને અવિચાર સમાધિમરણ કરે છે. આમાં પૂર્વની કોઈ યોજના હોતી નથી.

(૨) વિચાર સમાધિમરણ :- કોઈ અસાધ્ય રોગ થઈ જાય કે અતિવૃદ્ધત્વ આવી જાય (થોડો

પણ ધર્મ ન થઈ શકે એવું) ઈત્યાદિમાં જ્યારે એમ લાગે કે થોડા દિવસો કે મહિનાઓમાં આ દેહ અવશ્ય છૂટી જ જશે ત્યારે કમશઃ આહારાદિનો ત્યાગ કરીને શાંતભાવથી દેહ ત્યાગકરવો તે વિચાર સમાધિમરણ કહેવાય છે.

● સંલેખના કયારે લેવી જોઈએ ?

સંલેખના બે જ પરિસ્થિતિમાં લેવી જોઈએ. એક તો જ્યારે એવું લાગે કે આ દેહ થોડી મિનિટો, કલાકો, દિવસો કે મહિનાઓમાં અવશ્ય છૂટવાનો જ છે. તેનું કારણ ઉપસર્ગ, રોગ, વૃદ્ધત્વ આદિ કંઈપણ હોઈ શકે. એવી પરિસ્થિતિમાં સંલેખના પ્રત લઈને સમાધિપૂર્વક દેહત્યાગ કરવો જોઈએ તથા બીજું જ્યારે શરીરથી થોડું પણ ધર્મકાર્ય ન થઈ શકે ત્યારે. આમાં નિકટ ભવિષ્યમાં તો દેહ છૂટવાની સંભાવના તો નથી પરંતુ દેહ ધર્મર્थમાં કાંઈ પણ ઉપયોગી સિદ્ધ ન થાય અને ઊલટો રાગ-દ્વેષનું નિમિત્ત બની રહે એવા સમયમાં દેહત્યાગ કરવાની અનુમતિ મહાપુરુષો દ્વારા કરાઈ છે. જેમ કે કોઈ વ્યક્તિના આખા શરીરમાં લક્ષ્ય થઈ ગયો છે, માત્ર સૂતો જ રહે છે તથા સ્મૃતિનો પણ ઘણો લોપ થઈ ગયો છે, માત્ર બીજાના સથવારે જ જીવન ચાલતું હોય, ધર્મકાર્ય થોડું પણ ન થઈ શકે, આખો દિવસ આર્ત - રૌદ્રધ્યાન, અપધ્યાન આદિ જ ચાલતું રહે તો એવા સમયમાં સંલેખનાપ્રત લઈને પ્રાણોત્સર્ગ કરવો જોઈએ એવી ધર્મજીની આજ્ઞા છે.

★ સંલેખનાની વિધિ :-

વિધિપૂર્વક શરીર અને કષાયોને કૂશ કરીને શાંત, વીતરાગભાવથી દેહત્યાગ કરવો તે સંલેખનાનું મૂળ પ્રયોજન છે. કષાયોને કૂશ કરવાના ઉપકમમાં સર્વપ્રથમ સાધકે જગતના સર્વજીવોથી બુદ્ધિપૂર્વક - અબુદ્ધિપૂર્વક આ જન્મમાં અથવા પૂર્વ

જન્મોમાં જે-જે દોષ થયા હોય તે બધાની ક્ષમાયાચના કરવી જોઈએ. સર્વ જીવમાં નિર્વેરબુદ્ધિ કરીને મૈત્રીભાવ સ્થાપિત કરવો જોઈએ. ત્યારબાદ પોતાના પરિવાર, કુટુંબ, મિત્રો આદિ સર્વથી રાગ બંધનો તોડીને કોઈ વીતરાગી સંત કે સંધમાં જઈને અથવા દેશ-કાલાનુસાર કોઈ નિવૃત્તિક્ષેત્ર, આશ્રમ આદિમાં જઈને સત્તસંગીઓ કે કોઈ સત્પુરુષના શરણમાં જઈને તેમને સંલેખનાપ્રત માટે નિવેદન કરવું જોઈએ. પ્રતની અનુમતિ મળી જાય ત્યારબાદ તેમના સામે આપણા આખા જીવનના ગુમ શાલ્યોને કાઢવા જોઈએ અર્થાત્ આપણે જે જે પણ ગુમરૂપથી અનૈતિક આચરણ કર્યા હોય તેને હદ્ય ખોલીને તેમના સામે પ્રસ્તુત કરવા અને તે બધાની આલોચના કરીને પોતાના મનની શુદ્ધિ કરવી જોઈએ. પછી અન્ય જે પ્રગટ પાપ થયા હોય તેની પણ આલોચના કરવી જોઈએ. જો આપણે પૂર્વમાં વ્રતી હોઈએ તો જીવનભર વ્રતોમાં જે દોષ લાગ્યા હોય તેની આલોચના કરવા યોગ્ય પ્રાયશ્ચિત ગ્રહણ કરવું જોઈએ. પછી પૂર્વમાં જ્યારે વ્રત લેતા સમયે સંકલ્પપૂર્વક વિષયોનો ત્યાગ કર્યો હતો તેવી રીતે જ હવે કષાયોના ત્યાગનો સંકલ્પ લેવો અર્થાત્ હવે, હું મૃત્યુપર્યત્ત પૂર્વ કર્મोદયથી ગમે તેટલા તીવ્ર મોહાદિ કે કોધાદિ કષાયોનો ઉદ્ય થાય પરંતુ તેમાં પ્રવર્તન નહીં જ કરું અર્થાત્ તેમને યેન-કેન પ્રકારે ઉપશમિત કરી દઈશ. પરંતુ તેની બહારથી અભિવ્યક્તિ તો ક્ષારેય થવા દઈશ નહીં આ પ્રકારે કષાય ત્યાગનો સંકલ્પ લેવો જોઈએ અને તેના નિરતિચાર પાલન માટે કષાયોત્પત્તિના બધા નિમિત્તોનો ત્યાગ કરીને સત્તસંગ કે સત્પુરુષના આશ્રમમાં રહેવું જોઈએ. આ કષાય કૂશ કરવાની વિધિ છે.

શરીરને કૂશ કરવા માટે કમશઃ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. પ્રથમ ખાદ્ય અર્થાત્ રોટલી, શાક, ભાત આદિનો ત્યાગ કરવો જોઈએ (અનુસંધાન પાના નં. ૧૪ પર...)

શ્રી ભક્તામર સ્તોત્ર (ક્રમાંક - ૪૦)

મહેન્દ્રભાઈ કે. ખંડાર

ભયભંજક પ્રભુ આશ્રય

૮. વ્યાધિ ભયભંજક

- #### ● મુળ શલોક : (વસંતતિલકા)

उद्भूतभीषणजलोदरभारभृग्नाः,

शोच्यां दशमुपगताश्वयुतजीविताशः ।

त्वत्यादपंकजरजोऽमृतदिग्धदेहः,

मर्त्या भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥४५॥

- **શાંતિાર્થ** : ઉદ્ભૂત - ઉત્પન્ન થયેલો, ભીષણ - ભયંકર, જલોદર - જલોદર રોગ, ભાર - ભારથી, ભુગનાઃ - ભાંગી પુટેલ, કેળથી વાંકા વળી ગયેલ, શોચ્યામ् - શોચનીય, દશામ् - દશાને, ઉપગતાઃ - પામેલા, ચ્યુત - ત્યક્તા, તજી દીધી છે, જીવિત - જીવનની, આશા - આશા, ત્વત् - (હે પ્રભુ !) તમારા, પાદપંકજ - ચરણરૂપી કમળ, રજોમૃત (રજાઃ અમૃત) - (ચરણ) રજૃપી અમૃત, દિગ્ધ - દેપાયેલો છે, ખરડાયેલો છે, સ્પર્શયેલો છે, દેહ - દેહ, શરીર, મર્ત્યા - મનુષ્યો, ભવન્તિ - થાય છે, મકરધ્વજ - કામદેવ(અત્યંત સ્વરૂપવાન), તુલ્ય - જેવા, રૂપાઃ - ૩૫.

- #### ● समश्लोकी अनुवाद : (मंडाकिंता)

અંગો જેનાં અતિશય વળ્યાં, પેટના વ્યાધિઓથી,
જેણે છોડી જીવન જીવવા, સર્વથા આશ તેથી;
એવા પ્રાણી શરણ પ્રભુજી ! આપનું જો ધરે છે,
તેઓ નિશ્ચે જગતભરમાં, દેવકુપે ફરે છે. (૪૫)

- ભાવાર્થ : જેઓ જલોદર (જેવો ભીષણ) રોગ ઉત્પન્ન થવાથી પેટ(માં ભરાયેલ પાણી)ના ભાર વડે વાંકા વળી ગયેલા છે, જે શોચનીય દશાને પ્રાપ્ત

થયેલા છે તથા જેમણે જીવવાની આશા છોડી દીધેલી છે, એવા મનુષ્યો (હે પ્રભુ !) તમારા ચરણકુમળની ધૂલીરૂપ (ચરણરજ) અમૃતથી પોતાના દેહને લોપે (લગાવે, ખરડે) તો કામદેવ જેવા રૂપવાળા થાય છે.

- **વિશેષાર્થ / પરમાર્થ** : અહીં સુધી વર્ણવાપેલા કષોદ
અને ભય (હાથી, સિંહ, અગ્નિ, સર્પ, યુદ્ધ, સમુદ્ર) શરીરની બહાર પ્રવત્તા હતા કે જ્યાં પ્રભુના શરણ (નામ, સ્મરણ, કીર્તન વગેરે)ની સહાયતા ભયનિવારણનું કાર્ય કરતી હતી. આ શ્લોકમાં ગમે તેવા શરીરકષ્ણની નિવૃત્તિમાં પણ પ્રભુનું શરણ (ચરણરજ) એવી જ સહાયતા આપે છે તે દરખાવિ છે.

આગળના શ્લોક (૪૪)માં માનતુંગાચાર્યે
વ્યાપક જલનિધિ (સમુદ્ર)નો ઉલ્લેખ કર્યા પછી
મનુષ્ણના શરીરમાં ભરાયેલ મહાદુઃખદાયક ભયાનક
વાધિરૂપ જલોદરનું કથન આ શ્લોક (૪૫)માં કર્યું
છે. ‘ઉદર’ કહેતા પેટ અને ‘જલ’ કહેતા તેમાં
અનાવશ્યક સંચિત થયેલું જળ, ‘જલોદર’ નામના
રોગનું રૂપ ધારણ કરે છે. આ જલોદરના ભાર
(ભૌતિક રીતે વજન, માનસિક રીતે ચિંતા) થી
મનુષ્ય ભાંગી પડે છે (શરીરથી અને મનથી).
આગળના શ્લોક સાથે આ શ્લોકનો (જલરૂપી)
સાભ્યયોગ અલંકાર છે. પૃથ્વી પરના જલોદર
(સમુદ્ર)ની ભયંકરતાનું કારણ વિરાટકાય કૂર
જળચરો, તોફાની મોજાઓ, સામુદ્રિક અભિન અને
ઝંજાવાતી વાયુનું ઘમસાણ હતા. તેના કરતા દેહરૂપી
પૃથ્વીનો જલોદર ઘણો ભયજનક છે કે જેમાં માનવીને
અસાધ વેદના અને મૃત્યુનું અમંગળ આગમન
અનુભવાય છે.

જ્ઞાનીઓએ શરીરને રોગોનો ભંડાર અને વેદનાની મૂર્તિ કહેલ છે. આપણા શરીરમાં સાડાત્રણ (૩.૫) કરોડ રોમ છે અને પ્રત્યેક રોમ પર આશરે પોણા બે (૧.૭૫) રોગ ગણતા કુલ ૫,૬૮,૮૮,૫૮૪ રોગોની સંભાવના આપણા શરીરમાં શાસ્ત્રકાર જગતાવે છે.

મનુષ્યના શરીરમાં પેટ એ અગત્યનું અંગ છે. તે સર્વ ખોરાકનો સંગ્રહ અને શક્તિના સંચારનું કેન્દ્ર છે. કોઈપણ રોગના મૂળમાં પેટની ખરાબી કામ કરતી હોય છે. તેથી જ વૈદ્યો (મુખ્યપણે) અને ડોક્ટરો (ગૌણપણે) આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા જુલાબ અને એનીમાથી પેટની સાફસૂફી કરાવે છે! અહીં આચાર્યશ્રી જલોદર જેવા, તે સમયે અસાધ્ય ગણતા પેટના રોગની વાત કરે છે. તે પરથી (હાલના કેન્સર કે ટી.બી. જેવા) અન્ય રોગો વિષે પણ સમજ લેવું. ઘણા રોગોની ઉત્પત્તિના કારણોમાં જલની પ્રધાનતા હોય છે. અશુદ્ધ (તરતી કે ઓગળેલી, નાની કે મોટી, પૌદ્રગલિક કે જૈવિક આદિ અશુદ્ધિવાળું) પાણી, વિષાકૃત પાણી, કસમયે ઉપયોગમાં લેવાતું પાણી, વિરુદ્ધ આહાર-પાણી, વગેરે પ્રકારના પાણી ઘણા રોગોનું કારણ બને છે.

પંચ મહાભૂતોમાં જીવને પાણીનો આધાર વિશેષ છે. આપણા શરીરના વિવિધ અંગો-અવયવોમાં ૩૧ થી ૮૨ % અને પૂરા શરીરમાં લગભગ ૬૦ % પાણી હોય છે. આ રીતે વિચારીએ તો સમજાય છે કે મનુષ્યે ગાળેલું, ઉકાળેલું અને શુદ્ધ નિર્દ્દિષ્ટ(પાસુક) જળ વાપરવું જોઈએ, જેથી અહિંસાના પાલન ઉપરાત જળજન્ય રોગોથી બચી જવાય. જૈન ધર્મમાં રાત્રે ભોજન-પાણી નિષિદ્ધ ઘણું મહત્વપૂર્ણ છે. જલોદરનો અર્થ જલના ઉદરમાં રહેલા રોગો અથવા ઉદરમાં રહેલું અશુદ્ધ રોગયુક્ત જળ એમ થઈ શકે. અશુભ કર્મના વિપાકથી જળ ઘણા રોગોનું નિમિત્ત બને છે. જલોદર સ્વયં એક એવો રોગ છે કે જે આયુર્વેદમાં મહારોગ ગણાય

છે.

રોગથી મનુષ્ય પીડા પામે છે અને હેરાન-પરેશાન થાય છે. વળી, મહારોગ થયો હોય તો પૈસે-ટકે પણ ખુવાર થઈ જાય છે, અને છેવટે કરુણારીતે મૃત્યુને ભેટે છે. આથી (મહા)રોગની ગણતા મનુષ્યના એક મહાશત્રુ તરીકે થાય છે અને મનુષ્યોને રોગ (પરિણામે મૃત્યુ અને અજ્ઞાત પરલોક) વિષે બહુ મોટો ભય હોય છે. આવા રોગોથી બચવું હોય તો શ્રી જિનેશ્વરદેવના ચરણનું શરણ લેવું જોઈએ અને તેની ધૂલી (૨૪) મસ્તકે ચડાવીને તેનો શરીર પર લેપ કરવો જોઈએ. માનતુંગાચાર્ય અહીં મહારોગો પૈકી જલોદરનો દાખલો લીધો છે. કોઈને (૧) ભયંકર જલોદરનો રોગ થયો હોય, (૨) તે તેના ભારથી કમરેથી વાંકો વળી ગયો હોય, (૩) તેની દશા અતિ શોચનીય થઈ ગઈ હોય, (૪) હાથ-પગ ગળી ગયા હોય, (૫) શરીર તદ્દન અશક્ત બની ગયું હોય, (૬) અસહ્ય વેદના હોય અને (૭) તેણે જીવવાની આશા છોડી દીધી હોય, છતાં જો તે ભક્તિભાવપૂર્વક શ્રી જિનેશ્વરદેવના ચરણરૂપી ૨૪ પોતાના શરીર પર લગાવે તો રોગ દૂર થઈને તે સ્વરૂપવાન થઈ જાય છે.

અન્ય સંતોષે પણ કહ્યું જ છે કે,
“પ્રભુ નામકી ઔષધિ, ખરી ખાંતશું ખાય;
રોગ પીડા વ્યાપે નહિ, સબ સંકટ મીટ જાય.”

પરમાર્થ વિચારતા, જેમ શરીરને વિકૃત કરવામાં જલોદર દરદ છે તેમ આત્માને વિકૃત કરવામાં કર્મ છે. કર્મરોગથી પીડાતો જીવ ૮૪ લાખ જીવયોનીના વિવિધ શરીરોની વિકૃતિ (આદૃતિ) ધારણ કરે છે. એવો આત્મા પણ જો પ્રભુનું શરણું લે, અર્થાત્ સર્વભાવ પ્રભુને અર્પણ કરી વર્તે તો અત્યુત્તમ અવસ્થા-મોક્ષગતિને પામે છે. પ્રભુના શરણે જતા, જેને જીવવાની આશા રહી નથી તેવો

જીવ પણ અમર બને છે. કાયાની અને આત્માની બંનેની બીમારીને દૂર કરનાર અજબ ઔષ્ઠ પ્રભુ ચરણરજ છે.

હે પ્રભો ! આપે ‘આરુગ્ગ બોહિલાભ’ પદની પ્રાપ્તિ કરી છે. દ્વય અને ભાવથી આપ પૂર્જી સ્વસ્થ છો, નીરોગી છો. દ્વયથી આપના શાતા વેદનીયનો ઉદ્ય હોવાથી પુણ્યોદયે પ્રાપ્ત ઔદારિક શરીરમાં એક પણ રોગ ઉત્પન્ન થતો નથી. ભાવથી જન્મ-જરા-મરણના રોગથી આપ મુક્ત બન્યા છો. હવે નવો જન્મ જ ધારણ કરવાના નથી. આપ અજન્મા-અમરણા પદને પામી ચૂક્યા છો. આપના શરણો આવેલ અને આપના ચરણકમળનો આશ્રય લેનારના દ્વયથી શરીરના રોગ નાશ પામે છે અને ભાવથી ભવરોગ નાશ પામે છે.

અહો દેવ ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આપને
 ઓળખતા મિથ્યાત્વ જેવો ભયંકર મોહરોગ પણ દૂર
 થઈ જાય છે (જુઓ પ્રવચનસાર ગાથા - ૮૦) અને
 આત્મા સમ્યકૃત્વના અપૂર્વ રૂપને ધારણ કરીને
 અલ્યકાળમાં સ્વયં આપના જેવો પરમાત્મા બની
 જાય છે. ત્યાં આપની ભક્તિના પ્રતાપે (શુભભાવથી
 પુષ્યની ઉદ્ધીરણા થતા) બાધરોગ મટીને સુંદર રૂપની
 પ્રાપ્તિ થાય છે. જ્યાં હુનિયાનું કોઈ ઔષધ કામ ન
 કરતું હોય એવા રોગમાં કે કોઢ વગેરે ભયાનક
 રોગમાં પણ જિનગુણના મહિમારૂપ ઔષધનું જે
 સેવન કરે છે તે નીરોગી થઈ જાય છે અને કામદેવ
 જેવું સુંદર રૂપ મળે છે. શ્રીપાળ-મયણા, સનતકુમાર
 ચક્રવર્તી વગેરે કથાઓ જાણીતી છે.

‘ચરણ’ના ઘણા અર્થ થાય છે : (૧) પગ (પાદ), (૨) લીટી (કાવ્યના પદની કે શ્લોકની), (૩) આચરણ, (૪) આજ્ઞા, (૫) ભક્તિ, (૬) શ્રદ્ધા-સમર્પણાતા વગેરે. અહીં ચરણરજ કહેતા વ્યવહારથી ભગવાનના ચરણ ઉપરની રજ અથવા જે રજ (ભૂમિ) પર પ્રભુના ચરણ પડ્યા હોય તે.

નિશ્ચયથી ભગવાનની આજ્ઞા-ભક્તિ સમજવી. તેના
વડે રોગ (બાધ-ભૌતિક અને આંતરિક-આત્મિક)
મટી જાય છે.

મનુષ્યના જીવનમાં જે વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તેના કારણો સમજવા જરૂરી છે. જૈનદર્શન સ્થૂળ (બાધ્ય ભૌતિક નિમિત્ત) કારણોને વિશેષ મહત્વ આપતું નથી, પરંતુ તે આભ્યંતર કારણોનું સંશોધન કરે છે. ઉત્પન્ન થયેલા દુઃખના મૂળભૂત કારણોને તપાસે છે. પ્રાણીમાત્રના જીવનમાં કર્મનો પ્રભાવ જોવામાં આવે છે. જીવ વર્તમાનમાં જે કાર્ય (ભાવ, પુરુષાર્થ) કરે છે તે કર્મરૂપે પરિણામીને ભાવિમાં ફળ આપશે. જીવે ભૂતકાળમાં જે ભાવો (અને પરિણામે કર્મો) કર્યા હતા તેનું ફળ વર્તમાનમાં મળે છે. વર્તમાનકાળના કર્મોને પુરુષાર્થ કહે છે અને ભૂતકાળના કર્મોને ભાગ્ય (પ્રારબ્ધ) કહે છે. ઘટના ઘટવામાં જે પાંચ સમવાય (સહચારી) કારણ છે તે માંછેના બે આ પ્રારબ્ધ (નિમિત્ત) અને પુરુષાર્થ છે. બાકીના ત્રણ કારણો સ્વભાવ, કાળ (લભ્ય) અને નિયતિ (હોનહાર, ભવિતવ્યતા) આ શ્લોકની વિચારણામાં અપ્રસ્તુત છે.

કર્મના સંબંધમાં ભૂતકાળના કર્મો (પ્રારબ્ધ) અને વર્તમાનકાળના કર્મો (પુરુષાર્થ) સ-ફળ છે, અને તે શુભ કે અશુભ હોઈ શકે. આમ, ભૂત-વર્તમાન અને શુભ-અશુભની ચૌભંગી નીચે પ્રમાણે બનશે : -

- (૧) વર્તમાન અશુભ કર્મો અને ભૂતકાળના અશુભકર્મો : - ઘણું વિષમ પરિણામ, મહારોગ આદિ
 - (૨) વર્તમાન અશુભ કર્મો અને ભૂતકાળના શુભ કર્મો : - પૂર્વ પુષ્યનો કથ કરે
 - (૩) વર્તમાન શુભ કર્મો અને ભૂતકાળના અશુભકર્મો : - અશુભનું શુભમાં સંકમાશ, પ્રસ્તુત શ્લોક

(૪) વર્તમાન શુભ કર્મો અને ભૂતકાળના શુભ કર્મોઃ : ઉચ્ચ સ્થિતિ, ધર્મપ્રાપ્તિ, સાધનાવિકાસ.

રોગ માત્ર અશુભ કર્મોનું ફળ છે. અહીં જે વિષમ રોગ (જલોદર)નો ઉલ્લેખ કર્યો છે તે વર્તમાનકાળના અને ભૂતકાળના એમ બંને પ્રકારના અશુભ કર્મોનું પરિણામ છે (ઉપરનો પહેલો પ્રકાર). બંને પ્રકારના અશુભ કર્મો જેગા થાય ત્યારે રોગ મહારોગ બની જાય છે. રોગની બે અવસ્થા છે : સાધ્ય અને અસાધ્ય. અસાધ્ય રોગ સામાન્ય ઉપચાર કે વૈદ્ય-ડોક્ટરની મયર્દાને ઓળંગી જાય છે. આવો મહારોગ કોઈને ગણકારતો નથી અને એ તીવ્ર અશુભ કર્મનું પરિણામ છે. તેને અશાતાવેદનીય કર્મ કહે છે.

ભગવતીસૂત્રમાં ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પૂછે છે કે, હે પ્રભુ ! જીવ અશાતાવેદનીય કર્મ કેવી રીતે બાંધે છે ? ભગવાન મહાવીર પોતાના શ્રીમુખે જવાબ આપે છે, કે હે ગૌતમ ! જીવોને મારવાથી, ઉપદ્રવ કરવાથી, દુઃખ આપવાથી, દુભાવવાથી, પરિતાપ ઉપજાવવાથી કે પ્રાણાત્મિકાત્મિક (પ્રાણહરણ) કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. પરિણામે રોગ, મહારોગ અને પીડા પામે છે.

પ્રતિપક્ષી પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે કે જીવોનું રક્ષણ કરવાથી, તેમને શાતા ઉપજાવવાથી, ઉપદ્રવાદિ દૂર કરવાથી શાતા વેદનીય કર્મ બંધાય છે. પરિણામે પીડા શાંત થઈને રોગ દૂર થાય છે.

ઉપરના વિવરણથી જાણી શકાય છે કે રોગીના વર્તમાનકાલીન કર્મો (અશુભ ભાવો) અને ભૂતકાલીન કર્મો (હુભર્ય)ના દોષોથી મહાવ્યાપ્તિ ઉત્પત્ત થયો છે. હવે જુઓ, આ મહારોગ અસાધ્ય છે અને બાધ્ય ઉપચાર કાંઈ કરી શકે તેમ નથી. અહીં માનતુંગાચાર્ય વર્તમાનકાળના અશુભ કર્મોનું

પરિવર્તન કરીને શુભ કર્મોનો પ્રપાત કરી રહ્યા છે. આ એક એવો ઉપચાર છે કે જે ભૂતકાળના અશુભ કર્મોનો નાશ (સંકમણ) કરી શકે છે. આ ઉપચાર છે : પ્રભુની ચરણધૂલી (નામસ્મરણ, આજ્ઞાભક્તિ, શ્રદ્ધા-સમર્પણાત્મા)નો સ્વીકાર કરીને એ ધૂલીરૂપ અમૃતથી (જ્ઞાનરૂપી) દેહને લોપાયમાન કરે તો (મિથ્યાત્વરૂપી) રોગ પલાયન થાય જ છે. સાથે સાથે ધૂલીરૂપ અમૃત એવા શુભ કર્મોનો ઉદ્ય કરે છે કે રોગીને કામદેવ જેવું રૂપ (સમકિત) પ્રાપ્ત થાય છે.

આચાર્યશ્રી કમશઃ બિશ બિશ પ્રકારના ઉપદ્રવ (હાથી, સિંહ, અર્જિન, સર્પ, યુદ્ધ, સમુદ્ર) અભિવ્યક્ત કરી રહ્યા છે પરંતુ તે બધાનો સંંગ એક જ પ્રકારનો ઉપચાર પ્રદર્શિત કરીને ભક્તિયોગને ઓપ આપો છે : ક્યાંક પ્રભુનું નામસ્મરણ, ક્યાંક પ્રભુનું નામકીર્તન, ક્યાંક દેવાધિદેવની કૃપા, ક્યાંક પ્રભુચરણાનો આશ્રય... તે જ રીતે આ શ્લોકમાં પણ ચરણધૂલીનું કથન કરીને સમાન ભક્તિરસ વહાયો છે. રોગ (ઉપદ્રવો, ભય)ની જેટલી વિશેષતા બતાવી છે તેના કરતા આ દિવ્ય ઉપચારની મહત્ત્વ અધિક છે. અહીં તેમણે બે પક્ષ દર્શાવ્યા છે : એક તરફ મહારોગ અને સામાપકે દિવ્ય ઉપચાર. મહારોગે દેહને વાંકો વાળીને કદરૂપો બનાવી દીધો છે, જ્યારે આ દિવ્ય ઉપચાર દેહને કામદેવનું રૂપ આપે છે.

આ શ્લોકમાં અશુભ કર્મો (પૂર્વ કુમારબ્ધ, હુદ્દેવ)ની સામે શુભ કર્મો (વર્તમાન સત્પુરુષાર્થ)નો મોરચો છે. શુભ કર્મો (શુદ્ધના લક્ષે અત્યારે કરાતા શુભ ભાવો)ના પ્રહારથી અશુભ કર્મો જર્જરિત થઈ જાય છે. હકીકતમાં સમગ્ર ધર્મસાધના અશુભ કર્મોની સામે શુભ કર્મો દ્વારા જંગ જીતી, છેવટે શુભ-અશુભ બંનેથી વાવૃત્ત થઈ મુક્ત થવા માટે છે.

આ શ્લોકમાં આખું ધર્મશાખ સમાવિષ્ટ થઈ જાય છે. એક તરફ સંસાર (પ્રેય) છે તો બીજું તરફ

પ્રભુના ચરણોનું અવલંબન (શ્રેય) છે. માનતુંગાચાર્યે ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં જે પ્રતિજ્ઞા કરી હતી તે સાંગોપાંગ જગ્યાવી રાખી છે. ઋષભસ્તુતિના પ્રથમ શ્લોકમાં જ કહ્યું છે કે ભવસાગરમાં દૂબતા જીવો માટે આપના ચરણદ્વય (યુગમ) આધારભૂત છે. (જિનપાદયુગાં આલંબન ભવજલે પતતાં જનાનામ). તે વાતને ફરી પ્રદર્શિત કરી આ શ્લોકમાં તે જ રીતે ચરણધૂલીને અમૃત કહીને અશુભકર્મરૂપી સંસારને ટાળવાની હિમાયત કરી છે અને ભક્તિનો સમરસ જગ્યાવી રાખ્યો છે.

રોગ દ્વારા શરીરમાં જે કાંઈ પરિવર્તન થાય તે અશુભ નામકર્મનો ઉદ્ય છે પરંતુ તે વખતે જે વેદના થાય છે તે અશાતાવેદનીય કર્મનો પ્રભાવ છે. તે સમયે જીવ (આત્મા) દેહ સાથે એકત્વ (મમત્વ) કરી સંકલેશ અનુભવે તે (મિથ્યાત્વ) મોહનીય કર્મના કારણે છે. પાપ કરવામાં શરીર કરતા મન (ભાવ) વધારે ભાગ ભજવે છે. મનના આધારે જ કર્મની સ્થિતિઓ બદલાય છે.

આ ચરણરજ ફક્ત ચરણની જ રજ નથી પણ પ્રભુના વિશુદ્ધ અને પવિત્ર ચેતન (યથાજ્યાત ચારિત્ર)ને સ્પર્શ પામેલા નિર્મળ પરમાણુના પુંજ છે. જો કોઈ પણ રોગી આ શુભ પુદ્ગલોથી લેપાયમાન થાય, અર્થાત્ આ પુદ્ગલો જો પીડિતને સ્પર્શ કરે તો પીડા દૂર થાય જ છે અને દેવોને દુર્લભ એવું રૂપ પણ પ્રગટે છે.

આ કોઈ ચમત્કાર કે અતિશયોક્તિ નથી. આ કાળમાં પણ એવા ઋદ્ધિધારી મુનિઓ હોય છે કે જેમને એવી લઘ્ય હોય કે તેમના શરીરને સ્પર્શને જે હવા આવે તેના વડે (અથવા તેમની ચરણરજથી) રોગ દૂર થઈ જાય. શ્રે. મૂર્તિપૂજક આમ્નાયમાં વાસકૈપની પ્રથા અને બધી આમ્નાયમાં સાધુ-સાધ્વી ભગવંતોની આશિષ પાછળ આ જ આશય રહેલ છે કે અશાતા અને (ભવ) રોગ દૂર થઈ જાય.

ભાવના દ્વારા આ શક્ય છે કે જ્યાં આંતરિક સૂક્મ કિયા કામ કરે છે. પરિણામે શરીર બાબુ સ્થૂળ કિયા કરે છે, પરંતુ મૂળમાં, ખાટલાના ચાર પાયા માફક ભક્તના પ્રેમ - શ્રદ્ધા - સમર્પણાતા - આજ્ઞાભક્તિ જોઈએ.

અંતમાં સર્વ જીવો પ્રભુની આજ્ઞાભક્તિ-પૂર્વકની ચરણરજ દ્વારા ભવરોગનો નાશ કરે તેવી મંગલ ભાવના સાથે, જિનાજ્ઞાથી કાંઈ વિપરીત લખાયું હોય તો ત્રિવિધે મિશ્ના મિ દુકુડમ્.

॥ ઊં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

॥ શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ ॥

પરમનો સ્પર્શ : માયા મુર્દ ન મન મુવા

(પાના નં. ૧૧ પરથી ચાલુ...)

બધા રોગ દૂર થઈ જાય છે.

આ રીતે માયાના કણભંગુર સુખમાં જગત દૂબેલું રહે છે. જ્યાં જ્યાં મોહ જાય છે, ત્યાં ત્યાં માયા સદા હાજરાહજૂર થઈ જાય છે. માયાના આ સ્વરૂપને સર્વાંગી રીતે દર્શાવતા સંત કબીર કહે છે,

'મન તે માયા ઉપઝે, માયા તિરગુણ રૂપ,
પૌંચ તત્ત્વ કે મેલ મેં, બાંધે સકલ સરૂપ.'

આનો અર્થ એ કે મનના મોહમાંથી જ માયા જાગે છે. એ મનથી ઉત્પત્ત થાય છે અને એમાં સત્ત, રજ અને તમ્ભું - એ ત્રણેય બેગા થયેલા હોય છે. પૃથ્વી, જળ વગેરે જળતત્ત્વોના મેળમાં જ મનોમય માયાએ સંપૂર્ણ શરીરોનું નિર્મણ કરી રાખ્યું છે. આ રીતે કબીરે માયાનું રૂપ આપીને એમાંથી મુક્તિ મેળવવાના ઉપાય રૂપે સદ્ગુરુશરણ બતાવ્યું છે. જ્યાં સંતો વારંવાર ભ્રમણ કરતા આવતા હોય, ત્યાં માયા આવી શકતી નથી. આ રીતે માયાનું સ્વરૂપ દર્શાવીને દસ દિશામાં ધૂમતા માણસની વાત કરે છે. હવે પછી કરીશું અગિયારમી દિશામાં વસતાં માણસની વાત !

આત્માની તત્ત્વશક્તિ (૨૮) અતત્ત્વશક્તિ (૩૦)

વલભજી હીરજી ‘કેવળ’

આત્માની આ બંને શક્તિઓ પરસ્પર સંબંધવાળી હોવાથી જોડકારૂપ લીધી છે.

પોતાના જ્ઞાનાદિ અનંત સ્વભાવો સાથે આત્માને તદ્દુરપતા છે ને પર સાથે અતદ્દુરપતા છે. આ રીતે તત્ત્વણું ને અતત્પણું એ બંને શક્તિઓ આત્મામાં એક સાથે રહેલી છે. આત્મા એક દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશરૂપ તેનું ક્ષેત્ર છે. નિર્મળ પર્યાયરૂપ સ્વકાળ છે. અનંત ગુણરૂપ સ્વભાવ છે. આવા નિર્મળ સ્વચ્યતુષ્યમાં આત્મા તદ્દુરપ છે. આ રીતે આત્માને નિજસ્વરૂપમાં તદ્દુરપણે રાખે છે એવી ‘તત્ત્વ’ શક્તિ છે ને પરની સાથે તદ્દુરપતા થવા દેતી નથી એવી ‘અતત્ત્વ’ શક્તિ છે. જ્ઞાનભાવમાં આ બધી શક્તિઓ વર્તે છે. જ્ઞાનભાવ પોતાના આનંદાદિ અનંત સ્વધર્મો સાથે તદ્દુરપ થઈને પરિણામે છે ને વિકાર સાથે તદ્દુરપ થયા વગર પરિણામે છે. આવું અનેકાન્તપણું જ્ઞાનને સ્વયમેવ પ્રકાશે છે. આત્માને પોતાના અનંત ગુણો ને તેની નિર્મળ પર્યાયો સાથે તદ્દુરપણું પોતાના સ્વભાવથી જ છે. સ્વભાવમાં તદ્દુરપતાને પરભાવમાં અતદ્દુરપતાને નિજશક્તિનું અવિરુદ્ધ પરિણામન છે.

શરીર, વાણી, મન સાથે તો આત્માને સદાય અતદ્દુરપતા છે. સ્વભાવ તરફ જઈને જોતા રાગાદિક અશુદ્ધભાવો સાથે અતદ્દુરપતા છે. જ્ઞાન ને રાગ એક જ ક્ષેત્રે ને એક જ સમયે વર્તે, ઇતાં જ્ઞાનને રાગની સાથે અતદ્દુરપણું છે ને જ્ઞાન-દર્શન-આનંદાદિ નિજભાવોની સાથે તદ્દુરપણું છે. આવું બેદજ્ઞાન થઈને સ્વસંભુખતા થવી તે અનેકાન્તનાં ફળ છે. તત્ત્વણું અને અતત્પણું એને વિરુદ્ધધર્મ કથ્યા પણ સ્યાદ્વાદથી સમજતાં તે વિરોધ મટી જાય છે ને અનેકાન્તમાં તે બંને ધર્મો અવિરોધપણો એક સાથે સમાઈ જાય છે. એક ચેતન ને બીજા અચેતન એમ બે વિરુદ્ધ વસ્તુને એકતા હોઈ શકે નહીં. તેમજ એક શુદ્ધતા ને બીજી અશુદ્ધતા-એમ બે વિરુદ્ધભાવોને એકતા હોઈ શકે નહિ. જ્ઞાનને

પોતાના જ્ઞાનપરિણામનની સાથે તદ્દુરપતા છે, અજ્ઞાન સાથે અતદ્દુરપતા છે. ચારિત્રને પોતાના વીતરાગીપરિણામન સાથે તદ્દુરપતા છે, રાગાદિક સાથે તેને અતદ્દુરપતા છે. આનંદને પોતાના આનંદરૂપ ભાવ સાથે તત્પણું છે, આકૃતા સાથે અતત્પણું છે. આ રીતે આત્માના પોતાના અનંતગુણના સ્વભાવ સાથે તદ્દુરપતા છે ને વિભાવો સાથે અતદ્દુરપતા છે. રાગાદિ વ્યવહારમાં અતદ્દુરપતા છે એટલે કે તે હેય છે. ને શુદ્ધ નિશ્ચય તન્મયપણે ઉપાદેય છે. પરભાવોથી જુદું રહેતું જ્ઞાન સદા જગૃત છે. સાધરૂપ છે. આવા જ્ઞાનવડે સાધ્ય આત્માને જે સાથે તેને દેહાદિમાં પ્રતિકૂળતા થવા છતાં પણ અસાધ્ય થતી નથી.

ચૈતન્યમૂર્તિ આત્મા શરીરાદિ પરદવ્યો સાથે કદી એકમેક થયો નથી. આત્મા પોતાના ચૈતન્યપણાથી કદી છૂટતો નથી ને પરરૂપ કદી થતો નથી. સ્વમાં એકત્વરૂપ ને પરથી વિભક્તરૂપ આત્મા છે. ૪૭ શક્તિના વર્ણનમાં અનંત શક્તિનો સાર સમાઈ જાય છે. એકેક શક્તિ સાથે અનંત શક્તિ ભેગી જ છે, એટલે આત્માની કોઈ પણ શક્તિને યથાર્થ ઓળખતા અનંત શક્તિવાળો આખો આત્મા જ ઓળખાઈ જાય છે.

જો આત્મામાં ‘તત્ત્વ’ શક્તિ ન હોય તો નિજગુણમાં તદ્દુરપ થઈને પોતાની શાંતિને કદી વેદી શકે નહીં. ને જો ‘અતત્ત્વ શક્તિ ન હોય તો પરથી ભિન્ન રહીને નિજશાંતિને વેદી શકે નહીં. આત્માને સ્વમાં તત્પણું છે ને પરથી ભિન્નતારૂપ અતત્પણું છે એટલે તે પરાશ્રય છોડીને સ્વાશ્રયે લીન થઈને સમ્યગ્દર્શન - જ્ઞાન-ચારિત્રને સાધે છે. આ રીતે સાધ્યની સિદ્ધિ છે. આત્માને વિકાર સાથે તદ્દુરપતા નથી. પણ અતદ્દુરપતા છે. ચૈતન્યતત્ત્વને રાગ સાથે તત્પણું નથી. જ્ઞાનલક્ષણ રાગથી ભિન્નપણે ને પોતાના નિર્મળ ગુણ-પર્યાયોથી અભિન્નપણે પ્રસિદ્ધ કરે છે. આ રીતે એકત્વ-વિભક્ત આત્માનો અનુભવ કરાવે છે. (કમશઃ)

વિકારો કાબૂમાં રાખો

સંકલન : ગુલાબચંદ ધારશી રાંભિયા

જીવન જીવવા કાંઈને કાંઈ કામ તો કરવું જ પડતું હોય છે અને આ કામ કરતા જ્યારે જ્યારે અડયણ આવે એટલે તમે સમતુલા ગુમાવો છો. ગુસ્સે થાઓ છો. પરિણામે જે ગ્રાપ્ત કર્યું છે તે ગુમાવી બેસો છો. દુર્ગુણોના સમ્રાટ એવા કોધથી વિકારભાવ ઊભો થતાં તમે એકલા પડી જાઓ છો. તમારા મિત્રો તમારાથી દૂર ભાગે છે. રાગ-દ્રેષ, કોધથી જે ટેન્શન રહે છે તેનાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોના કાયમી ભોગ બનવું પડે છે. શરીર અને મન વ્યથાગ્રસ્ત રહેવાથી કાર્યક્ષમતાને અસર થાય છે. જ્યારે માણસ કોધ કરે છે ત્યારે શરીરમાં એઝ્નાલીન હોમોનિનો સ્ત્રાવ વધે છે, લોહીના ભ્રમણમાં ફેરફાર થાય છે. લોહીનું દ્બાશ વધતાં શાસની ગતિ, હૃદયના ધબકારા વધે છે. આંખોની કીકી પહોળી થાય છે. ભૂખ મરી જાય છે. એસીડીટી અને આંતરડાના રોગો થાય છે. રોગ-પ્રતિકારક શક્તિ ઘટે છે આથી શારીરિક અને માનસિક નુકસાન થાય છે, જે વ્યક્તિને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે ભારે અવરોધક સાબિત થાય છે. વ્યક્તિએ કોધના કારણો તપાસવા જોઈએ. ભૂખ, થાક, ખરાબ આદત, લધુતાગ્રંથિ, નિષ્ફળતા, ભૂલોનો અસ્વીકાર, અહંકાર, રોગ, શારીરિક મર્યાદા કે નિષ્ફળ લગ્નજીવન જેવા કારણોથી કોધ ઉત્પન્ન થાય છે.

વ્યક્તિ દઢ સંકલ્પ સેવી પોતાની મર્યાદા હોય તે દૂર કરી શકે છે. ભગવાન કૃષ્ણ પણ અર્જુનને વિજય બનાવવા શર્સ્ટોની સજ્જતાની વાત નથી કરતા પણ મનને સ્થિર રાખવાની સલાહ આપે છે.

એક અમેરિકન કુટુંબની આ વાત છે. તેમાં એક યુવાન જ્યારે ગુસ્સે થાય ત્યારે ઘરની વસ્તુઓની

તોડફોડ કરે, નુકસાન કરે. તેના પિતાએ નામાંકિત ડોક્ટરોને બતાવ્યું. કોઈ પરિણામ નહીં. પછી પિતાએ પુત્રને કહ્યું કે હવે તને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે બહાર વંડીમાં જઈ દીવાલમાં ખીલા ખોડવા. યુવાને તે જ દિવસે ઉર ખીલા ખોડી નાખ્યા. પછી યુવાનને પોતાની ભૂલ સમજાઈ. ધીમે ધીમે દીવાલમાં ખીલા મારવાની સંખ્યા ઘટતી ગઈ.

એક દિવસ પુત્ર પિતા પાસે આવ્યો અને કહ્યું કે હવે વંડીમાં ખીલા મારવાની જરૂર પડતી નથી. પિતાએ તેને કહ્યું કે હવે જ્યારે તને ગુસ્સો આવે અને તું કાબૂમાં પણ રાખે ત્યારે હવે તારે પહેલા ખોડેલા ખીલામાંથી એક એક કાઢતો જજે. પંદરેક દિવસમાં પેલા યુવાને બધા ખીલા કાઢી નાખ્યા. તેણે પિતાને કહ્યું કે હવે મેં ગુસ્સા પર કાબૂ મેળવી લીધો છે. પિતાએ એને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે ખોડેલા ખીલા તો તે કાઢી નાખ્યા પણ તેનાથી પહેલા કાણાંની નિશાનીઓ તું કાઢી શક્યો નથી.

માણસ જ્યારે કોધ કરે છે, બીજાનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે પણ પછી પશ્વાત્તાપ થાય ત્યારે માઝી પણ માગે છે. પણ કાણાંનાં નિશાન રહી જાય છે. માઝીના શબ્દો કહેવાય છે પણ જે મન ઘવાયું હોય છે તે જલ્દી રૂઝાનું નથી અને આથી જ માણસે પોતાના વિકારોનું સતત નિરસન કરવું જોઈએ. વિકારોને કાબૂમાં રાખવા જોઈએ.

**બીજાનોની ટીકા (નિંદા) કરવામાં
જેટલો સમય બગાડો છો અનાથી અડધો
સમય પણ જે પોતાની ટીકામાં બગાડશો
તો મહાન બની જશો.**

ઇન્દ્રયવિજય

ભાનુલેન ડી. શાહ

પરમાત્માની પરમ કૃપાથી, બહુ પુણ્ય કેરા પુંજથી મોંઘો, અમૂલ્ય, ધારે તે સિદ્ધ કરી શકે એવો મનુષ્યદેહ મળ્યો છે. આર્થિકતમાં જન્મ, મહાવીર સ્વામીનું શાસન, દયામય, પ્રેમમય, અહિંસામય જૈન ધર્મ, ઇન્દ્રયોની સંપૂર્ણ પર્યાપ્તતા, જિનવાણી, મોક્ષમાર્ગને બતાવનાર સંસારત્યારી શ્રમણ-શ્રમણીઓ, કર્મભૂમિ, કર્મ કાપતાં પવિત્ર અનુષ્ઠાનો, ચોવીસ તીર્થકરોની જીવનયાત્રા અને મોક્ષપ્રાપ્તિ માટે કરેલો પ્રબળ પુરુષાર્થ, શાખવાંચન અને તેનો મર્મ, રહસ્ય, ગૂઢાર્થ- કેટકેટલું માનવીને મળ્યું છે. આ બધું મેળવવા માટે દેવો પણ માનવજન્મ જંખે છે. તેઓને માતાના ખોળામાં આળોટવાની અને ધર્મમાર્ગનું મહત્વ મા પાસેથી જાણવાની પૂરેપૂરી જૂરણા છે. તેથી માનવને જે મળ્યું છે તેની તુલના અકેય ગતિમાં મળે તેની કલ્યાણ પણ કરી શક્ય તેમ નથી.

તીર્થકરોએ પાંચ ઇન્દ્રિય અને છહું નટખટ, આમતેમ ભમાવતું, મનને ચ્યાગડોળે ચડાવતું, રખડાવતું, ચંચળ, તરલ મન-સમગ્ર પર વિજય મેળવ્યો છે. આ છ પર વિજય મેળવ્યા પછી બાકીનું છોડતાં વાર લાગતી નથી. તેથી જ કહેવાય છે કે “મન સાધું તેણે સર્વ સાધું.” તો કઠપૂતળીની જેમ ઇન્દ્રયોને નચાવનાર, મનને વશ કરવાનું છે, નાથવાનું છે, તેના પર લગામ રાખવાની છે. મનને કલ્યાગરું, પ્રભુનો બંદો બનાવવાનું છે.

આનંદધનજી અજિતનાથના સ્તાવનમાં ભગવાનને કહે છે કે “જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિસ્યું મુજ નામ ?”

તીર્થકરોએ ઇન્દ્રયોને જીતી લઈને જિનેશ્વર કહેવાય છે. જ્યારે પામર, ક્ષુદ્ર, અશક્ત, તુચ્છ

માણસ ઇન્દ્રયોથી જિતાઈ ગયો છે. અજિતનાથજીએ પણ ઇન્દ્રયોને જીતી લીધી છે, જેથી તેઓ અજિત, ગુણધામ કહેવાય છે. અને તેઓ સાચા પુરુષ, સાચા આત્મસ્વરૂપ છે.

માનવીની પાંચ ઇન્દ્રિયો અલગ અલગ કામ કરે છે. કાન શ્રવણ કરવાનું, નાક સુંધવાનું, ચામડી સ્પર્શ પારખવાનું, આંખ જોવાનું અને જીભ સ્વાદ ચાખવાનું અને બોલવાનું ડબલ રોલમાં કામ કરે છે. અને મન તો તે પાંચેયનો સૂત્રધાર છે, દોરી સંચાર કરે છે. આ છની લીલા આપણે જોઈએ છીએ. બધી ઇન્દ્રિય અનાસક્ત નિરપેક્ષભાવે કામ કરે તો જીવન સફળ થાય, નહીંતર કર્મબંધ સિવાય કાંઈ મળે નહીં.

કાનથી ઈશ્વરના ગુણગાન, ભજન, કીર્તન, પ્રવચન, ગુરુજીનો બોધ સાંભળવાનો છે, નહીં કે સિનેમાના ગીત, સંવાદો, આલાપપ્રલાપ વગેરે તરફ કાનને ખેંચવા. કાનનો પરમાર્થ ઉપયોગ કરવાનો છે. વિષયમજન થવાનું નથી. આંખથી પ્રભુજીની મૂર્તિના અહોભાવ, ભક્તિભાવ સહિત દર્શન કરવાના છે. તેમની સામે આંખથી મટકું માર્યા વગર જોવાય તો પ્રભુ પ્રત્યક્ષ હોય તેવું અનુભવાય છે. પિક્ચર, નાટક, સીરિયલ વગેરે જુએ છે અને તેથી આંખોમાં વિકાર આવે છે. તે જ દશ્યો સતત આંખ સામે છવાયેલાં રહે છે. અને તેથી કર્મબંધ થાય છે. આ બધું છોડીને પ્રભુજીની વીતરાગ પ્રતિમા જોઈએ તો આંખો ઠરે છે અને પ્રભુની આંતરદશાનો ઘ્યાલ આવે છે. તેમની મુદ્રા માનવીને પ્રભુની આંતરદશાનો ઘ્યાલ આપે છે, અંત:પ્રવેશ માટે પ્રેરણા આપે છે, ભીતરમાં જોવાનું કહે છે. ખુલ્લી આંખો હોવા છતાં તેઓ સંપૂર્ણપણે ભીતરી દુનિયામાં વસે છે.

મનુષ્ય સુખશીલિયો છે તેથી તેને દરેક ઝતુ કનડતી લાગે છે. શિયાળાની સખત ઠંડી, ઉનાળાનો

તીવ્ર પ્રખર તાપ તેને દુઃખ પહોંચાડે છે. વર્ષાત્મક પણ તેના દૈનિક કાર્યમાં અડયણો ઉભી કરે છે અને કાદવકીય તેને મળિન કરે છે. ખરેખર તો કાયાને કલેશ આપીને કર્મને કાપવાના છે. ઉનાળાનો તાપ તપસ્વી ખુલ્લા શરીરે સૂર્ય સામે બેસીને પસાર કરે છે. ઠીકમાં પણ બિલકુલ ઓછાં વખ્તો પહેરીને કે વખ્તરહિત થઈને કાયાને કષ આપે છે. વર્ષાત્મક નદીકિનારે બેસીને ભીજાતા એક બાજુ ધ્યાન ધરીને એકાગ્ર થાય છે.

સુગંધિત અત્તરો, સેન્ટ વગેરેની સારી સુગંધ નાકને આનંદ આપે છે. પ્રભુ સામે ધૂપપૂજા, કેસર-ચંદનથી અંગપૂજા કરીને મનને તેમાં રસતરબોળ કરવાનું છે, જેથી કર્મ હળવાં બને અને પૂજા સાર્થક થાય. જ્ઞબ તો બે કામ કરે છે. પ્રભુનું ભજન, કીર્તન, સ્તવન, જાપ વગેરેમાં રસનાએ રસ લેવાનો છે. સુંદર, સ્વાદિષ્ટ, લહેજતદાર, અનુપમ, સ્વાદ્યુક્ત ભોજન લઈને જ્ઞબને બહેકાવવાની નથી, પણ તપ કરીને રસસ્વાદ તજવાનો છે. વિનયયુક્ત વાણી, વર્તનથી સૌનો પ્રેમ જીતવાનો છે. ટીકાટીઘણી, કુથલી, નિંદા કરીને જ્ઞબનો દુરુપ્યોગ કરવાનો નથી. આ રીતે પાંચેય ઈન્દ્રિયોનો ઉપયોગ માત્ર પ્રભુ અર્થે કરીને જીવનને સાર્થક, સફળ, ભક્તિમય, પ્રભુમય કરવાનું છે.

શરીરની પાંચ ઈન્દ્રિયોથી વિષય-ભોગવટો કરતા કેવા હાલ થાય છે તે એક ભજનમાં વર્ણયું છે.

વનમાં શિકારી શિકાર કરવા જાય છે. મધુર સંગીત શરૂ કરે છે. સંગીતપ્રિય હરણ એ સાંભળવા દોડે છે પણ તેનાં શિંગડાં ઝડીમાં ભરાઈ જાય છે. એ તરફથીને મરે છે. ભમરો કમળની સુવાસથી અંદર બીડાઈ જાય છે. હાથી કમળને ખાવા માટે આવે છે અને ભમરો મૃત્યુ પામે છે. માઇલીઓ ખાવાના લોભે જાળમાં ફસાઈ જાય છે તેનો કાંટો જાળમાં ભરાઈ જતાં મોતને શરણ થાય છે. પતંગિયું

દીવાનું રૂપ જોઈને તેની આજુબાજુ ચક્કર કાખ્યા કરે છે. અંતે દીવામાં બળીને ભર્મ થાય છે. હાથીને મારવા ખાડામાં ઘાસ, તૃશુ, કચરો નાખીને ખોટી હાથળી ઉભી કરવામાં આવે છે. હાથી તેને સ્પર્શવા જાય છે અને ખાડામાં પડીને જીવન પૂરું કરે છે. કવિશ્રી આના પરથી આપણાને બોધ આપે છે કે — “એકેક વિષય મરણ માટે થાય છે જો પૂરતાં, તો પાંચ ઈન્દ્રિય-મોહમાં શું પુરાયે ઓરતાં ? માટે પ્રભુ કહે, વિષય-મૂર્ખ્ય છોડજે તું સત્તવરે, તો આત્મ થાયે કર્મ-ત્બિન્ન, શુદ્ધ અને બુદ્ધ ખરે.”

વિષ સમ વિષયોને સંપૂર્ણપણે છોડવાના છે કારણ કે વિષ તો એક જ ભવનો અંત આણે છે, જ્યારે પંચવિષયો ભવોભવ રખડાવે છે, ચારે ગતિમાં ચકરાવા લેવડાવે છે અને દુઃખી કરે છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” દેહ તો પરિગ્રહ છોડવા માટે મળ્યો છે.

“પરમાત્મપ્રકાશ”માં કહ્યું છે કે — પંચેન્દ્રિય રૂપ ઊંટને ચરવા દે ન યથેચ્છ, ચરી સઘળાંય વિષયવને, પટકે ભવમાં એ જ, યોગિન ધ્યાનગતિ કઠિન, મન સ્થિર કેમેય ન થાય, ઈન્દ્રિય વિષયે સુખ ગણી, ત્યાં જ ફરી ફરી જાય.”

ઊંટ જેવી અઢાર અંગથી વાંકી પાંચ ઈન્દ્રિયોને તું તેની ઈચ્છા પ્રમાણો, સ્વચ્છંદતાથી, આમતેમ, ગમે ત્યાં ભટકવા ન દે, ચરવા ન દે. બધા જ વિષયોની જાળમાં તને ફસાવીને માત્ર દુઃખસભર સંસારમાં જ રખડાવ્યા કરશે. આ મોટી, માયાવી જાળમાંથી તું છૂટી નહીં શકે, અને સંસારમાં જ તું પટકાયા કરીશ. હે યોગી ! વિષયવનમાં ભટકતાં આ મનને ધ્યાનમાં સ્થિર કરવું, એકાગ્ર કરવું, ત્યાં જ ચોંટાડવું ઘણું અધરું છે, મુશ્કેલ છે. મન અવળચંહુ, ધાર્યું ન કરવા દે તેવું આહું છે. તેને ઈન્દ્રિયોના પાંચ વિષયોમાં ભરપૂર રસ છે તેથી તે

ફરીફરી ત્યાં જ જાય છે. પ્રભુમાં નિમગ્ન થતું નથી.

દ્યારામ પણ એક કાવ્યમાં કહે છે કે મન તો હરાયાં હોર જેવું છે. તેને સરસ મજાનો લીલો ચારો ચરવા માટે આપો તોય તેને ઉકરડા ફેંદવામાં અને કચરા, કાગળિયાં ખાવાની જ મજા આવે છે.

એક ભાઈ ઉપાશ્રયે દર્શન કરવા ગયા. મહારાજ સાહેબે કંઈક બાધા લેવાનું કહ્યું. પેલા ભાઈ વિચારવા મંડ્યા કે શેની બાધા લઉં. તો મહારાજ સાહેબે તેની ભાવતી વસ્તુ- બુંદીના લાહુની બાધા લેવાનું કહ્યું. બાધા લેતા પહેલા તેણે મહારાજ સાહેબને પ્રશ્ન કર્યો, “ધારો કે હું મરીને દેવગતિમાં જાઉં તો ત્યાં લાહુ ખાવા મળે ?” મહારાજે કહ્યું, “ના, દેવો તો છ મહિને એકવાર આહાર કરે છે.” “નારકી થાઉં તો નરકમાં લાહુ મળે ?” “ના, ત્યાં તો માત્ર હુંઘ, કષ, યાતના, વેદના જ મળે છે.” તો તિર્યંચ ગતિમાં મળે ?” મહારાજે કહ્યું, “પશુને તો આપણે ખવડાવવાનું હોય, ત્યાં ન મળે.” દર્શનાર્થીએ કહ્યું, “તો મહારાજ સાહેબ, ખાવા માટે મને એક માનવભવ મળ્યો છે. તો શા માટે મારા ભાવતા લાહુની બાધા લેવાનું કહો છો ! મને લાહુ પ્રેમથી ખાવા ધોને !!!” સમજવાનું એ છે કે આપણે ખાવા માટે જીવતા હોઈએ એવી જ આસક્તિ ખાદ્યાનમાં છે. જીણે ભાવતાં બોજનિયાં ખાવા માટે જ માનવજન્મ મળ્યો છે ! ‘આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે ?’ તેથી મોજશોખમાં ભવ પૂરો થાય છે.

બ્રહ્મચારીજી કહે છે કે,

“ભોજન દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ,
જ્ઞાન કર્મક્ષય કારણે તેથી મોક્ષ સુખસાજ.”

“ભોગ રાગનું બીજ ના જાણ્યું કરતા મોજ,
ઇન્દ્રિય-વિષય ધ્યાન ધરું સદા, મરણ સમરું ના રોજ,
મૂક, મૂક, વિષય-વાસના ભોગ,
છોડ છોડ નિજ તૃષ્ણા રોગ,

કર કર વશ, મન-ગાજ જે ગાંડો,

અંતરાત્મને પરમાત્મ સંગ જોડો.”

જાણવાનું એ છે કે ભોજન માત્ર દેહને ટકાવવા માટે જ લેવાનું છે. દેહનો પરમાર્થ ઉપયોગ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાનથી સંચિત કર્મનો ક્ષય થાય છે અને તેથી જ મોક્ષપુરી સુધી પહોંચાય છે. વિષયના ભોગો રોગનું બીજ છે. તે આનંદ મંગલ કરતાં જાણ્યું નથી. ઇન્દ્રિયના ભોગવાતા વિષયો તેનું જ ધ્યાન ધરાય છે અને મરણ આપણને જીણે કોઈ દિવસ આવવાનું જ નથી તેમ તેના પ્રત્યે દુર્લક્ષ સેવાય છે તેથી બ્રહ્મચારીજી કહે છે કે ઇન્દ્રિયની વાસનાઓ ત્યજ દે, તૃષ્ણા - રોગ પણ છોડી દે, અને મન રૂપી હાથી જે ભોગવટા પાછળ ગાંડો થયો છે તેને તારા અંતરાત્મને પરમાત્મ સાથે જોડી દે. તેમાં જ તારું હિત છે.

વિષયરત્તિ ધરાવતાં આ સંસારમાં રચ્યુંપચ્યુ મન મૂળાયાં કરે છે તેને જાગૃત કરીને દાખિને નિર્મળ કરવાની છે. વિષયોની મોહિની મૂકીને મનને આત્મામાં લીન કરવાનું છે, જેથી તે પરમપદને પામી શકે. ઇન્દ્રિયના વિષયોને છોડીને મન જે આત્મામાં લીનતા પામે તો મુક્તિનાં દ્વાર તેના માટે ખુલ્લાં થાય છે તેથી વિષયો તરફ ખેંચતી ઇન્દ્રિયોને સંયમની લગામથી બાંધવી જોઈએ. તો જ નિર્ભય મુનિ થઈ શકાય છે. વિષયભોગો માટે નરભવને ગુમાવવા જેવો નથી. ધર્મરહિત થવાનું નથી પણ ત્યાગધર્મ નિભાવીને સમાધિસુખને અને મોકની વાનગીને મેળવવા માટે આ મનુષ્યજન્મ ધારણ કર્યો છે તેને વ્યર્થ ગુમાવી દેવા જેવો નથી. વિષયભોગને ભયાનક ગણીને કાયાને જન્મ - કેદમાંથી છોડાવવાની છે અને મોહમાયા રહિત થવાનું છે. પ્રભુનું ધ્યાન ધરતાં સમગ્ર ચિંતાઓ મટી જાય છે અને ઇન્દ્રિય તૃષ્ણા પણ જતી રહે છે. દરિયાનાં ખારાં પાણીમાં મીઠાં જળ વહીવહીને નદી તરફથી આવે છે અને દરિયામાં ભળી તૃષ્ણા છીપવવાં નકામા

બનાવી દે છે તેવી રીતે ઈન્ડ્રિયભોગ વૃથા જાય છે અને પાપનો ભારો બંધાય છે.

વિભાવો સંસારનું મૂળ છે પણ સદ્ગ્વિચારથી બળી જાય છે અને તેથી સુખની લાલસા જતી રહે છે તથા આત્માનું સુખ મળે છે. વિષયો તો તુચ્છ છે. સદ્ગુરુના ચરણે મનને સ્થિર કરો તો ભક્તિમાર્ગ આપોઆપ જવાનું મન થશે. ભવવાસીઓ દેહની સુશ્રૂષા કરે છે પણ આત્મા પર ધ્યાન દેતા નથી. આત્માર્થે પ્રવૃત્તિ કરે તો વિષયો તેને વિષરૂપ લાગ્યા વગર રહેશે નહીં. તો પછી પાપના બીજને પોષીને દુર્ગતિમાં જવાનું શા માટે વિચારવું જોઈએ ? તૃપ્તાઓ અજિન જેવી છે અને ભોગ અજિનમાં કાજ નાખવા જેવું છે.

મૂર્ખ માણસ લાગેલ અજિનમાં તેલ રેડીને ઓલવવાનો પ્રયત્ન કરે છે તેવી રીતે શાંતિ મેળવવા માટે આપણે વધુને વધુ ભોગનો ઉપયોગ કરીએ છીએ. શરીરથી ભોગવાતા ભોગો તો મળમૂત્રની ખાંસ છે. તેથી આવા પાપ બંધાવતા દેહને ધિક્કાર છે. એનું મૂલ્ય ધૂળ જેટલું જ છે. તેથી ધર્મધ્યાન માટે આ શરીર જે શિવસાધન છે તેને બરાબર ધ્યાનમાં રાખી, આવો અવસર પુનઃ નહિ મળે, તેથી વેળાસર ચેતી જા. એમાં જ તારું શ્રેય છે. પંચન્દ્રિયોને વિષયોથી વિમુખ કરીને રાખીએ તો સંકલ્પો, વિકલ્પો, વિચારો, વિકારો કયાંથી આવશે ? આ દેહદેવળમાં આત્મદેવ બિરાજે છે. તો દેહને તું વિષય-મદિરાથી ઉન્મત કર મા. શરીરના મોહમાં મૂર્ખિત ન થા. તારા દેહદેવળને ભૂલી ન જા. આપણું જ્ઞાનમંદિર આપણી અંદર જ છે તેને સદા યાદ રાખ.

ભોજન તો દેહને ટકાવવા માટે અને સાધના કરવા માટે શરીર સ્વસ્થ રાખવા કાજે કરવાનું છે. બાકી દેહનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ માટે કરવાનો છે. સાધના દેહથી કરવાની છે, જેથી કર્મક્ષયનું કામ કરી શકે. સંપૂર્ણ કર્મક્ષયથી સંપૂર્ણ સુખ મળે છે,

જેને મોક્ષ કે મુક્તિ કહે છે. એ જ આપણને મળેલા દુલારા દેહથી પામવાનું છે.

ઈન્ડ્રિયનો ભોગવટો આધિ, વ્યાધિ, ઉપાધિનું મૂળ છે. પણ પુણ્યોદયે આપણને જે આનંદપ્રમોદ મળ્યા છે તેમાં જ આપણે ગળા સુધી ગરકાવ છીએ. ખાવું, પીવું, બોલવું, સાંભળવું, જેવું એમાં જ મશાગૂલ છીએ. તેના જ ધ્યાનમાં રૂબેલા છીએ. એક દિવસ આ વિષયી જીવનનો અંત આવી જશે તેની યાદ તો કદ્દી આવતી જ નથી. જાણો કાયમ આ પૃથ્વી પર અમનચ્યમન કરવાના છીએ અને મોત આપણી બાજુ ફરકવાનું જ નથી તેવું જ લાગ્યા કરે છે !

વિષયરૂપી સંસારમાં તલ્લીન, રમમાણ રહીને મન એકદમ મૂળ્યવશ અનુભવે છે. શાંતિને બદલે શરીર ને સહન કરવાનું આવે છે. તેથી હે પ્રભુ, મારા આત્માને જાગૃત કરો, મારી દાસ્તિને નિર્મણ કરો. મારું મન વિષયાસક્રિયા દૂર રહીને, આત્મામાં એકાગ્ર થવામાં જો સફળ થશે તો પરમાત્મપદને પામી શકશે. ઈન્ડ્રિયવિષયોની બેંચતાણ સતત રહે છે, પણ સંયમની લગામથી તેને વારી શકાય છે અને આત્માને નિર્ગંધ, નિર્વિકલ્પ, નિર્વિચાર, નિર્વિકાર કરી શકાય છે. ઉપશમિત મન, આત્મા સમાધિસુખને પામીને સિદ્ધાંતનું અખંડ, અભંગ સુખ મેળવી શકે છે. માનવજન્મ કર્મરહિત, ધર્મસહિત કરવા મળ્યો છે તેને વિસારો નહીં અને જૂઠી બાબતોમાં વ્યતીત કરો નહીં. શરીરની કેદમાં નિર્દોષ આત્મા પુરાયો છે તેને મુક્ત કરવા જગતની સઘળી મોહમાયા છોડવાની છે. તેથી વિષય-પંક્તી દૂર થઈને પંક્ત જેવો ન્યારો થઈ જા. સિંહ જેવો શૂર અને નિર્ભય થઈ જા. ભોગી લોકો તો ભોગ ભોગવવા અને ઈન્ડ્રિય સુખ પામવા માટે જ જન્મયા છે અને યોગીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે દેહ ગાળવા અવતર્યા છે. જો જ્ઞાન સમ્યક્ થાય તો ઈન્ડ્રિયના વિષયો વિષ જેવા ઘાતકી લાગે છે અને તેથી કાયાને પાપથી પોષીને દુર્ગતિના બીજ વાવવાથી ફારેગ

રહે છે. તૃષ્ણાઓ અભિની જેમ આગળ વધે છે અને માનવીને વિષય-ભોગરૂપ કાળથી બાળે છે. તેથી વિષ, વિષયો, દુર્જન વગેરે જીવને ઘણું દુઃખ આપે છે. મૂર્ખ માણસ આગાને ઓલવવા માટે લાગેલી આગમાં તેલ રેતે છે, તેમ મનુષ્ય શાંતિ માટે ખૂબ ખૂબ વિષયભોગો ભોગવે છે. આવા ધૂળ જેવા પાપી શરીરને વિકાર છે.

વિષયોથી વિરક્ત શરીર ધર્મધ્યાન, શુક્લ ધ્યાનના હેતુ માટે છે. શિવસ્વરૂપ મેળવવા માટેનું ક્ષેત્ર છે. આવો અવસર ક્યારે મળશે ? માટે હે માનવ, તું ચેતી જા અને શરીરને પરમાર્થમાં જોડી દે. પંચેન્દ્રિયોને વિષયોથી વિમુખ કરીને વીતરાગમાં જોડી દે. કાયા, માયા, પરસ્કી પ્રીતિ બધું છોડીને, તોડીને પ્રભુના શરણમાં, ચરણમાં આવી જા.

જે યોગી યોગથી આત્મધ્યાનમાં એકાગ્ર થઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર મેળવે છે અને પંચેન્દ્રિયને પર ગણીને નિજ આત્મામાં ચિત્તને જોડે છે, જેનાથી તેને નિર્વિકલ્પ સમાધિસુખ મળે છે અને અનંત જ્ઞાનયુક્ત આત્મસ્વરૂપમાં એકાકાર થઈ શકે છે.

વિષયોમાંથી મળતું સુખ ક્ષણિક અને અલ્યજીવી છે. ત્યારબાદ માત્ર દુઃખ જ છે. હે બુદ્ધિશાળી માનવ, તું તારા ચિત્તને અભિત ના કર અને તારા હાથે જ તારા પગ પર કુહાડી માર મા. આપણાથી જ આપણને દુઃખ મળતું હોય છે પણ તેનો આપણને જ ખ્યાલ આવતો નથી. તેથી સાંસારિક વાસનાઓ છોડીને પરમાત્મ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગને લગાડવાનો છે. જે મનુષ્ય ઈન્દ્રિયસુખને છોડી શકે છે તે નર ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે અને પરમ પ્રીતિયુક્ત છે. એવા નર પર વારી જવાનું દરેક વ્યક્તિને મન હોય છે.

પાંચ ઈન્દ્રિયના સૂત્રધારને પહેલા કબજે કરવાનો છે. ત્યારબાદ પાંચેય ઈન્દ્રિયો વશ થઈ જશે. ઝાડનાં મૂળિયાને જો કાપી નાખીએ તો થડ, ડાળી, પાન, ફૂલ, ફળ ક્યાંથી લાગશે ? ઝાડનું

અસ્તિત્વ જ ખતમ થઈ જશે. તે રીતે મનને વશ કરતા મેળવવા ધારેલું આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. મનને જીતવાથી આત્મા જિતેન્દ્રિય કહેવાય છે. આત્મા અને શરીર અલગ છે એવું જેદજ્ઞાન થાય છે. એટલે શુદ્ધાત્મ તત્ત્વની ભાવના જ માત્ર ભાવવી જોઈએ. એ જ આપણા આત્માનું કલ્યાણ કરશે.

શરીરને પાળવા, પોષવા, પંપાળવામાં, સજવવામાં કેટલો સમય ગુમાવ્યો ? તેથી હે વિષયાસકત જીવ ! હવે જાગ અને શિવનો સંગ કર. જીવને સત્યમૂ શિવમૂ સુંદરમૂ બનાવ અને મોક્ષની પ્રાપ્તિ કરી લે. અનાથી જ તારા જીવતરનું ભલું થવાનું છે અને તને અનંત સુખસ્વરૂપ, વીર્યસ્વરૂપ સ્વાત્માની પ્રાપ્તિ થશે. અને દેહાતીત બનવાથી દેહની આધિ, વ્યાધિ, ઉપાધિથી તું કાયમ માટે મુક્ત થઈ શકીશ.

● ● ●

બાળવિભાગ

(પાના નં. ઉદ્દ પરથી ચાલુ...)

એક દિવસ વિનોબાળ એ દુકાન પાસે થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે દુકાનદારે કહ્યું, “પેલા તાળાની કિંમત ત્રણ આના જ હતી. લો, તમારા આ સાત આના પાછા !”

વિનોબાળની આંખોમાં કોણ જાણે કેમ આંસુ ઉભરાઈ આવ્યાં.

આ પ્રસંગ વિશે તેમણે પાછળથી કહેલું કે, “દુકાનદારના એ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. ભગવાને મને સત્યનિષ્ઠાનો પ્રથમ પાઠ શીખવ્યો ! સત્યનિષ્ઠ મનુષ્યે બીજા પર વિશ્વાસ રાખવો જ જોઈએ. મેં એ દુકાનદારના વચન પર વિશ્વાસ રાખીને જ તાણું દસ આનામાં ખરીદ્યું હતું. છેવટે તેના અંતરાત્માએ તેને કહ્યું કે, એ સમયે જૂદું બોલ્યો હતો, પણ હવે એ જૂઠાણાને તું સુધારી લે.”

● ● ●

ભાગ વિભાગ

સંકલન : મિતેશભાઈ એ. શાહ

‘હરિનામ’ની જ ધૂન

ભક્ત હરિદાસ જન્મે મુસલમાન હતા, પણ કૃષણભક્તિનો તેમને એવો નાદ લાગ્યો હતો કે તેઓ હિંદુ ભક્ત બન્યા અને કૃષણભક્તિના ભજનો તથા કીર્તનો ભાવપૂર્વક ગાઈને પોતાના જીવનને ધન્ય બનાવવા લાગ્યા. તેમને ખોરાક કે પાણી વિના ચાલે, ભગવાનનું નામ લીધા વિના ન ચાલે. ભગવાનના નામ વિના એ પરમ ભક્તને કશું ચેન પડે નહિ.

એ પુલિયા ગામમાં એક કંદર મુસ્લિમ રહે. તે સ્વભાવનો દુષ્ટ હતો. કોઈનું કલ્યાણ કરવામાં નહિ, પણ બૂરું કરવામાં જ તેને રસ હતો.

એક દિવસ તેણે આ ગામના મુસ્લિમ રાજાને ફરિયાદ કરી : “હરિદાસ એક કાફર છે ! એવા કાફરને તો આપ એવી સજા કરો કે ભવિષ્યમાં તે આવું કાર્ય કરવાનું ભૂલી જાય.”

“તેને કેવા પ્રકારની સજા થવી જોઈએ, તે મને કહો.”

પેલાએ કહ્યું, “તેને સીધી રીતે મારી નાખવો નહિ, તેની પીઠ પર ચાબૂકો વીજી વીંજીને તેને માર મારવો. તેની રિબામણીનો કોઈ પાર ન રહે એ રીતે તેને મૃત્યુને ઘાટ પહોંચાડવો.”

રાજાને આ વાત જચી ગઈ.

તેણે પોતાના સૈનિકોને ફરમાન કર્યું, “જાઓ, એ કાફરને અત્યારે ને અત્યારે મારી સમક્ષ હાજર કરો.”

સૈનિકોએ થોડીવારમાં ભક્ત હરિદાસને રાજસભામાં હાજર કર્યો. પછી રાજાએ સૈનિકોને ભક્ત હરિદાસના ઉઘાડા બરડા પર ચાબૂકો

વીજવાનો હુકમ કર્યો.

આમ, ચાબૂકો પોતાના બરડા પર વીજાવા લાગ્યા, લોહીની ટશરો ફૂટવા લાગી, છતાં હરિદાસે મોંઅથી ‘હરે રામ, હરે કૃષ્ણ’ બોલવાનું બંધ કર્યું નહિ. સૈનિકોએ કહ્યું, “તું હરિનામ બોલવાનું બંધ કરે તો તને છોડી મૂકવામાં આવશે. બોલ, બંધ કરે છે કે નહિ ?”

પણ આ હરિદાસ તો સાચા ઈશ્વરભક્ત !

તેમણે કહ્યું, “હરિનું નામ તો મારા શાસે શાસે વજાઈ ગયું છે. તેને હું બંધ કરી શકું નહિ. મારા ખુલ્લા બરડા પર વીજાતા ચાબૂકોની પીડા હું સહન કરી શકું, પણ ભગવાનનું નામ લેવાનું બંધ કરી શકું નહિ.”

આવો જવાબ સાંભળી સૈનિકો વધુ રોષે ભરાયા અને વધુ જોરથી ચાબૂકો વીજવા માંડ્યા.

બરડા પર લોહીના રેલા વહેવા લાગ્યા. આખો બરડો લોહીલોહાણ બની ગયો.

છતાં હરિદાસના મુખે ‘હરિનામ’ ચાલુ જ રહ્યું. છેવટે તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા.

રાજાએ તેમને મરી ગયા માનીને સૈનિકોને હુકમ કર્યો, “આને નદીમાં ફેંકી આવો !”

રાજાના ફરમાન અનુસાર સૈનિકોએ બેભાન બનેલા હરિદાસને ઉપાડી લીધા અને ગામ નજીક વહેતી એક નદીમાં ફેંકી દીધા. પણ હરિદાસ મરણ પામ્યા નહોતા, તેઓ બેભાન જ બની ગયા હતા.

નદીના શીતળ જળથી એમના લોહીલોહાણ બરડામાં શાંતિ થઈ આવી. શરીરમાં ચેતના આવી.

તેઓ ભાનમાં આવ્યા. અંખો ઉધાડી ચારે બાજુ નજર ફેરવવા માંડ્યા.

આ વાતની સૈનિકો અને ગામ લોકોને જાણ થઈ કે તરત જ તેઓ નદીકિનારે આવ્યા.

રાજાને હવે પોતાના અધમ કૃત્યનો ખૂબ પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો. તે પણ નદીકાંઠે આવ્યો અને હાથ જોડીને હરિદાસને કહેવા લાગ્યો, “મને અધમને મારા અધમ કૃત્ય બદલ માફ કરો ! હું આપ જેવા સાચા સંતને ઓળખી શક્યો નહિ. આ અધમ કૃત્ય બદલ મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે.”

એટલું બોલીને તે હરિદાસના ચરણમાં આગોટી પડ્યો !

હરિદાસે રાજાને તેના હાથ પકડીને ઉભો કર્યો અને કહ્યું, “તેંતો મારા પર એક મોટો ઉપકાર કર્યો છે ?” સૈનિકો અને ગામ લોકોને સમજાયું નહિ કે હરિદાસ રાજાના કયા ઉપકારની વાત કરે છે !

હરિદાસ બોલ્યા, “તારો કોઈ અપરાધ નથી. મનુષ્યે પોતાનાં કર્માનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ બધું જે કંઈ મને હુંથી પડ્યું તે મારા કર્માનું જ ફળ છે. તું તો એમાં નિમિત્તમાત્ર છે. હવે તેંતો મારા પર શો ઉપકાર કર્યો તે હું તને કહું છું. મને એવો ગર્વ હતો કે મારા જેવો કયો બીજો સંત એવો હશે કે જે સદા હરિનામ રટ્યા કરે ! પણ મારો આ ગર્વ સાચો છે કે નહિ તેની કોઈ કસોટીમાં મારે મુકાવાનું થયું નહોતું. મારે એ જાણવું હતું કે હું આ બાબતમાં સાચો છું કે જૂઠો ? પણ આજે ઈશ્વરે તને નિમિત્ત બનાવીને મારી કસોટી કરી, અનિપરીક્ષા કરી. એ અનિપરીક્ષામાં હું ઉત્તીર્ણ રહ્યો. મારા પર ચાબૂકો વીંઝાતા હતા છતાં મેં હરિનામનો નાદ ચાલુ રાખ્યો. જો તેંતો તારા સૈનિકો દ્વારા મારા ખુલ્લા બરડા પર ચાબૂકો ન વીંઝાવ્યા હોત તો મારું માનવું સાચું છે કે જૂદું એની મને ખબર ક્યાંથી પડત ?

મારામાં તો કોઈ શક્તિ નથી, પણ ઈશ્વરની પરમ કૃપાથી જ હું બેભાનમાંથી ભાનમાં આવ્યો. ઈશ્વરની કૃપાથી જ મારામાં છેક છેલ્લી ઘરી સુધી હરિનામ લેવાની ચેતના રહી હતી. અને આમ છતાં તું માનતો હોય કે તેંતો અપરાધ કર્યો છે, તો એ બદલ હું નહિ, ઈશ્વર જ તને માફ કરી શકે !”

હરિદાસની આ સંતવાણી સાંભળતાં જ ત્યાં એકત્ર થયેલી માનવમેદનીએ સંતના નામનો જયપોકાર કર્યો.

જેણે રાજાને હરિદાસની વિરુદ્ધ ફરિયાદ કરી હતી તે તો હરિદાસની વાણીથી એવો તો પ્રભાવિત બની ગયો કે તે તરત જ હરિદાસના ચરણમાં પડ્યો અને ગદ્દગદ સ્વરે બોલ્યો : “આ પાપીને માફ કરો !”

એટલું જ નહિ, એ દિવસથી તે હરિદાસનો શિષ્ય બની ગયો અને ‘હરિનામ’ની રોજ ધૂન લગાવવા લાગ્યો.

સત્યનિષ્ઠ મનુષ્ય

ઈ.સ. ૧૮૧૯ના વર્ષનો એક પ્રસંગ છે. એ સમયે વિનોબાળ બનારસમાં અભ્યાસ કરી રહ્યા હતા. એક દિવસ તેઓ બજારમાં એક તાળું ખરીદવા ગયા. તેમણે એ તાળાની કિંમત દુકાનદારને પૂછ્યી.

દુકાનદારે કહ્યું, “એની કિંમત દસ આના છે.”

વિનોબાળએ તાળું આમ તેમ ફેરવીને થોડીવાર જોયા કર્યું અને પછી તેમણે દુકાનદારને કહ્યું, “આની કિંમત ત્રણ આનાથી વધુ હોઈ શકે નહિ ! છતાં તમે એની કિંમત દસ આના કહો છો. તો તમારા બોલવા પર વિશ્વાસ રાખીને હું દસ આનામાં આ તાળું ખરીદું છું.”

તાળું ખરીદાને પંદરેક દિવસ વીત્યાં હશે કે
(અનુસંધાન પાના નં. ૩૪ પર...)

સમાજ-સંસ્થા દર્શન

‘દિવ્યધવનિ’ વિશિષ્ટ સહયોગી દાતા બનવા અંગે વિજાપ્તિ

‘દિવ્યધ્વનિ’ની ગુણવત્તા જાળવી રાખવા અમો સતત પ્રયત્નશીલ છીએ. છેલ્લા થોડા વર્ષોથી ટાઈપસેટિંગ, પ્રિન્ટિંગ, કાગળ વગેરેના ભાવમાં વધારો થયો છે; જેનો આર્થિક બોજ સંસ્થાએ ઉઠાવવો પડે છે. આપને ‘દિવ્યધ્વનિ’ના વિશિષ્ટ સહયોગી દાતા બનીને જ્ઞાનયજ્ઞમાં યથાશક્તિ આહૃતિ આપવા નામ નિવેદન કરીએ છીએ. ‘દિવ્યધ્વનિ’ સહયોગી દાતા તરીકે રૂ. ૨૧,૦૦૦/-નો સહયોગ આપનાર દાનવીર મહાનુભાવોના નામ ‘દિવ્યધ્વનિ’ના ટાઈટલ પેજ - ૪ પર પ્રગટ કરવામાં આવશે.

સંસ્થામાં શ્રી ગુરપૂર્ણિમા શિબિર દરમિયાન

બા. દ્વ. પૂજયશ્રી ગોકુળભાઈની સ્વાદયાયશ્રેણીનું આયોજન

સંસ્થામાં તા. ૨૭-૭-૨૦૧૮ થી તા. ૨૮-૭-૨૦૧૮ (શુક્રવારથી રવિવાર) દરમિયાન ગુરુપૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં બા.બ્ર. પૂજ્યશ્રી ગોકુળભાઈ શાહની સ્વાધ્યાયશ્રેષ્ઠી ઉપરાંત સત્સંગ, જિનપૂજા, ભક્તિસંગીત વગેરે. વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો યોજાશે. શિબિરમાં પધારવા સૌને ભાવભર્યું નિમંત્રણ છે. આપના આગમનના અગાઉથી સંસ્થામાં જાણ કરવા વિનંતી છે.

સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહિતદરે ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ

આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સમજોપયોગી સતકાર્યો કરવાની સંસ્થાની નીતિ રહી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષ પણ ગુણવત્તાયુક્ત ચોપડાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક નંગ ચોપડાની કિંમત રૂ. ૨૦/- રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલ રજૂ કરી સંસ્થાના કાર્યાલયમાંથી ચોપડા મેળવી લેવા વિનંતી છે.

સંસ્થા સંચાલિત નિઃશુલ્ક છાશકેન્દ્રો દ્વારા જરૂરતમંદો માટે છાશવિતરણ

આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સંસ્થા દ્વારા મેડિકલ સેવાઓ, રક્તદાન શિબિર, યુવાશિબિરો, ગુરુકુળ સંચાલન દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારસિંચન, કપડાંવિતરણ આદિ સમાજોપયોગી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પૂજ્યશ્રી આત્માનંદજીની આજ્ઞા અને શુભાશીર્વાદથી છેલ્લા ઘણા વર્ષોથી સંસ્થા દ્વારા જુદા જુદા સ્થળોએ નિઃશ્લેષક છાશકેન્દ્રો ચલાવવામાં આવે છે, જેથી જરૂરતમંદ લોકો માટે છાશનું વિતરણ થઈ શકે.

પૂજયશ્રી આત્માનંદજી તથા પૂજય બહેનશ્રીના પાવન સાનિધ્યમાં તા. ૮-૪-૨૦૧૮ના રોજ છાશકેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવા કોબા, જૂના કોબા, બોરિયા તલાવડી, વાઘોડિયા તલાવડી, નભોઈ વગેરે કેન્દ્રો પરથી જરૂરતમંદોને છાશવિતરણ કરવામાં આવે છે. આ ઉપરાત શ્રી મહાવાર આરાધનાકેન્દ્ર, કસ્તૂરબા વિદ્યાલય તથા સંસ્થાના કર્મચારીઓ, મજૂરવર્ગ અને જરૂરતમંદોને છાશવિતરણ

કરવામાં આવે છે. એક દિવસનો છાશકેન્દ્રો ચલાવવાનો અંદાજિત ખર્ચ રૂ. ૫૦૦૦/- આવે છે. છાશકેન્દ્રો દ્વારા કુલ ૫૦૦ પરિવારો (૨૫૦૦ વ્યક્તિઓ)ને વ્યક્તિદીઠ ૨૫૦ ગ્રામ છાશનું વિતરણ કરવામાં આવે છે. આ સેવાકાર્યના યજ્ઞમાં શ્રી રામજીભાઈ ચૌધરી, શ્રી જેઈતારામભાઈ પરમાર, શ્રી સંતોષભાઈ રાણા, શ્રી કરસનકાકા, શ્રી કાંતિભાઈ ઠાકોર, શ્રી નવનીતભાઈ મિશ્રા વગેરે સેવાભાવી મહાનુભાવો નિઃસ્વાર્થભાવે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત સંસ્થાના રસોડાના કર્મચારીઓ પણ આ સેવાકાર્ય માટે સહયોગ આપી રહ્યા છે. સર્વ સેવાભાવી મહાનુભાવોના સેવાકાર્યની અનુમોદના કરીને અનેકશા: ધન્યવાદ પાઠવીએ છીએ.

આ સેવાકાર્યના યજ્ઞ માટે આર્થિક યોગદાન આપીને પુણ્યાર્જન કરવા સર્વ દાનવીર મહાનુભાવોને વિનંતી કરીએ છીએ. આ સત્કાર્ય માટે આર્થિક યોગદાન આપનારા સર્વ દાતાઓને સંસ્થા તરફથી સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ.

પરમકૃપાળુદેવના સમાધિમરણાદિન નિમિત્તે સંસ્થામાં યૈવિદ્યપૂર્ણ કાર્યક્રમો સંપત્તિ

ચૈત્ર વદ પાંચમ એટલે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમરણાદિન. આ દિવસ નિમિત્તે આપણી સંસ્થામાં વૈવિદ્યપૂર્ણ કાર્યક્રમો સંપત્તિ થયા.

સવારે જિનાનિષેષક બાદ શ્રી આત્મસિદ્ધિશાખની દ્વય સહિત પૂજા કરવામાં આવી. ત્યારબાદ બા. બ્ર. આદ. સુરેશજીનો સ્વાધ્યાય યોજાયો હતો. ‘સમાધિમય જીવન’ વિષય અંતર્ગત વચનામૃત પત્રાંક-૧૨હના આધારે સમાધિમરણ માટે - સમાધિમય જીવન માટે કેવું જીવન જીવવું તે અંગે રસપ્રદ શૈલીમાં સ્વાધ્યાય આપતા બા. બ્ર. સુરેશજીએ નીચેના ચાર મુદ્રાઓ પર વિશ્લેષણ કર્યું હતું : - (૧) સરળ અને પારદર્શી બનવું, (૨) નીતિયુક્ત જીવન જીવવું, (૩) પોતાનું સ્થિતિકરણ પોતે કરવાનો અભ્યાસ કરવો, (૪) સતત પ્રભુસ્મરણાનો અને તત્ત્વવિચારનો અભ્યાસ કરવો.

બધોરે આદ. શ્રી અનુપમભાઈ શાહે ‘શ્રીમદ્ રાજચંદ્રના પ્રેરક પ્રસંગો’ પુસ્તકના આધારે પરમકૃપાળુદેવના જીવનના ખૂબ અગત્યના અલોકિક, આદ્ભુત પ્રેરણાદાયક પ્રસંગોનું વાંચન કર્યું હતું.

રાત્રે થોડા વિરહપદો સહિત ભાવવાહી ભક્તિ કરવામાં આવી હતી.

પૂજયશ્રી રાકેશભાઈનું સંસ્થામાં શુભાગમન

સંસ્થાના નિમંત્રણને માન આપીને તા. ૮-૪-૨૦૧૮ના સવારે પૂજયશ્રી રાકેશભાઈ આપણી સંસ્થામાં પધાર્યું હતા. તેઓશ્રીના શુભાગમનથી સંસ્થામાં ધર્મોલ્લાસનું વાતાવરણ સર્જયું હતું. પૂજયશ્રી, પૂજય બહેનશ્રી, સંસ્થાના ટ્રસ્ટીગણ તથા મુમુક્ષુ ભાઈ-બહેનોએ ભાવોલ્લાસપૂર્વક પૂજય રાકેશભાઈનું સ્વાગત કર્યું હતું. શ્રી જિનમંદિર તથા શ્રી રાજમંદિરમાં દર્શન બાદ પૂજયશ્રી રાકેશભાઈએ સંતકુટિરમાં પૂજયશ્રી આત્માનંદજ અને મુમુક્ષુઓ સાથે ધર્મવાર્તા કરી હતી. બંને સંતોના ભાવવાહી મિલનથી કોબા આશ્રમમાં આનંદ વર્તાતો હતો. સંસ્થાના ટ્રસ્ટીગણે પૂજયશ્રી રાકેશભાઈને સંસ્થામાં અવારનવાર પધારવા માટે વિનંતી કરી છે.

સંસ્થા સ્થાપનાદિન નિમિત્તે યૈવિદ્યપૂર્ણ કાર્યક્રમો સંપત્તિ

વૈશાખ સુદ દશમ એટલે ભગવાન મહાવીરનો કેવળજ્ઞાન કલ્યાણકદિન તેમજ આપણી સંસ્થાનો સ્થાપનાદિન. તા. ૮-૫-૧૯૭૫ના રોજ ‘શ્રી સત્શ્વત સેવા સાધના કેન્દ્ર’ના નામે મીઠાખળી, અમદાવાદ

મુકામે આપડી સંસ્થાનો પ્રારંભ થયો હતો. આ નિમિત્તે તા. ૨૫-૪-૨૦૧૮ના શુભ દિને સંસ્થામાં વૈવિધ્યપૂર્જી કાર્યક્રમો સંપદ થયા. સવારે જિનાભિષેક બાદ ભગવાન મહાવીરની પૂજા કરવામાં આવી. ત્યારબાદ સૌઅં શ્રી આત્મસિદ્ધિશાખનું ભાવપૂર્વક પારાયણ કર્યું. મ્રાસંગિક ઉદ્ઘોધનમાં પૂજયત્રી આત્માનંદજીએ પૂ. સહજાનંદજી મહારજ (હમ્મી) રચિત ‘સફળ થયો ભવ મારો... પદને ભાવવાહી સ્વરમાં રજૂ કરતાં જણાવ્યું કે આપણે જીવનમાં શું ગ્રાપ્ત કર્યું અને શું ખોલ્યું તેનું અંતરનિરીક્ષણ કરવું જોઈએ. ધાર્થું વાંચે પણ પરીક્ષામાં નાપાસ થાય તો વાંચેલું નિષ્ફળ જાય, તેમ ધર્મમાર્ગે આપણે ઘડી મહેનત કરીએ પણ યોગ્ય ફળ ન મળે તો પુરુષાર્થ નિષ્ફળ જાય. શક્તિ અનુસાર જીવનમાં ઉતારે તો સદ્ગ્રામના સાર્થક કહેવાય. કળિયુગમાં પરમકૃપાળુટેવ જેવા મહાપુરુષ આપણને મળ્યા તે આપણું પરમ સદ્ગ્રામ છે, પણ જો તેઓએ કહેવા સિદ્ધાંતોને જીવનમાં ન (ઉતારીએ તો આપણે કૃપાળુટેવને (તેઓની વાણીને) પચાવ્યા નથી. મહાપુરુષોના ઉત્તમ બોધને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સફળ થાય.

પૂજ્ય બહેનશ્રીએ સંસ્થાસ્થાપના અને તેના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા સ્વ. ચંદુકાકા, સ્વ. હરિકાકા, સ્વ. ભોગીકાકા, સ્વ. મણિકાકા, સ્વ. હેમેન્ડ્રભાઈ જેવા અનેક મહાનુભાવોને સ્મરણાંજલિ અર્પી હતી. આપણા જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય વધે અને મહાપુરુષોની આજ્ઞા અનુસાર જીવન જીવીએ તેવી શુભ ભાવનાઓ પૂર્ણ બહેનશ્રીએ અભિવ્યક્ત કરી. ત્યારબાદ પ્રભુ-ગુરુની આરતી કરવામાં આવી. સાંજે બા. બ્ર. આદ. સુરેશજીએ શ્રી વ્યાખ્યાનસાર - ૧ના આધારે મનનીય સ્વાધ્યાય આપ્યો હતો. રાત્રે પ્રભુ મહાવીરના ભક્તિપદો દ્વારા સૌઝે પોતાના હદયના ભાવ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે ડૉ. રાજેશભાઈ સોનેજી પરિવાર તરફથી ભોજનાલયમાં કેરીનો રસ રાખવામાં આવ્યો હતો.

પૂ. લઘુરાજસ્વામીજીનો સમાધિદિન

વૈશાખ સુદ આઈમ એટલે પૂ. લઘુરાજસ્વામીજીનો સમાધિદિન. આ દિવસે સંરથામાં પૂ. આત્માનંદજી લિખિત ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો’ પુસ્તકમાંથી પૂ. લઘુરાજસ્વામીના જીવનચરિત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. સાંજની ભક્તિમાં વિરહપદો દ્વારા સમરણાંજલિ અર્પવામાં આવી. પૂ. લઘુરાજસ્વામીજીમાં રહેલ વિનય, ભક્તિ, નિઃસ્પૃહતા, સમર્પણતા જેવા ગુણોને આપણો સૌ આત્મસાત્ત કરીએ તેવી પ્રભુને માર્થના.

સંસ્થામાં થાઈરોઇડ નિદાન કેમ્પનું આયોજન

આપણી સંસ્થામાં ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે આયોજિત શિબિરના ભાગડુપે સંસ્થા સંચાલિત મેડિકલ સેન્ટરના ઉપકમે થાઈરોઇડ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિસ્તૃત જાણકારી આવતા અંકમાં આપવામાં આવશે. સંપર્કસૂચ્ર : (૧) શ્રી વિજયભાઈ પટેલ - મો. ૯૮૨૭૦ ૯૦૩૮૩, (૨) શ્રી નીતાબેન લોહીયા - મો. ૮૭૨૩૩ ૫૦૩૬૮

વરસીટપના પારણા

આપણી સંસ્થામાં રહીને સેવા-સાધના કરતાં આદ. મુમુક્ષુશ્રી રમણભાઈ શાહના પુત્રવધુ અ.સૌ. જિજાસાબેન વિમલભાઈ શાહના વરસીતપના પારણા ૧૮ એપ્રિલે હસ્તિનાપુર મુકામે સંપત્ત થયેલ છે. આ પ્રસંગે તેઓના પરિવારજનો તરફથી બોરીજ(ગાંધીનગર) મુકામે 'ભક્તામર સ્તોત્ર'નું મહાપુજન રાખવામાં

આવેલ અને આપણી સંસ્થાને રૂ. ૫૦૦૦/-નું દાન આપેલ છે. જિજ્ઞાસાબેને છેલ્લો અષ્ટમ કરીને પારણું કર્યું હતું. સમસ્ત કોબા પરિવાર જિજ્ઞાસાબેનના વરસીતપની અનુમોદના કરે છે.

સંસ્થાના વિવિધ વિભાગોમાં આર્થિક સહયોગ આપનારા દાનવીર મહાનુભાવો

સંસ્થાના વિવિધ વિભાગોમાં આર્થિક સહયોગ આપનારા નીચેના દાનવીર મહાનુભાવોને સંસ્થા સાભાર ધન્યવાદ પાઠવે છે : -

● ગુરુકુળ :	(૧) શ્રી ઓમસાગર એન્જિનીયરીંગ પ્રા.લિ., મુંબઈ	રૂ. ૫,૦૦,૦૦૦/-
	હસ્તે : શ્રી મૌલિક જશુભાઈ શાહ	
	(૨) શ્રી ઉખાબેન કિશોરભાઈ શેઠ, યુ.એસ.એ.	રૂ. ૩,૦૦,૦૦૦/-
	(૩) શ્રી દિનેશભાઈ એસ. બાવીસી, રાજકોટ	રૂ. ૧,૦૦,૦૦૦/-
● સાધકનિવાસ :	શ્રી ઉખાબેન કિશોરભાઈ શેઠ, યુ.એસ.એ.	રૂ. ૨,૦૦,૦૦૦/-
● જ્ઞાનદાન :	શ્રી ઉખાબેન કિશોરભાઈ શેઠ, યુ.એસ.એ.	રૂ. ૧,૦૦,૦૦૦/-
● છાશકેન્દ્ર :	(૧) શ્રી ઊર્મિલાબેન ધોળકિયા, વડોદરા	રૂ. ૫૦,૦૦૦/-
	(૨) શ્રી દિનેશભાઈ એસ. બાવીસી, રાજકોટ	રૂ. ૪૦,૦૦૦/-
	(૩) ડૉ. ભાર્ગવભાઈ નારણદાસ પટેલ, ભાડ	રૂ. ૩૫,૦૦૦/-
	(૪) શ્રી ભારતીબેન અરવિંદભાઈ કારાડી, મુંબઈ	રૂ. ૩૦,૦૦૦/-
	(૫) શ્રી ભારતીબેન એન. ગાલા, મુંબઈ	રૂ. ૨૦,૦૦૦/-
	(હસ્તે : સુસ્મિતાબેન અને દીપેનભાઈ ગાલા)	
	(૬) શ્રી દક્ષેશભાઈ એમ. મય્યર, બોપલ, અમદાવાદ	રૂ. ૧૫,૦૦૦/-
● પક્ષીયાં :	(૧) શ્રી ઊર્મિલાબેન ધોળકિયા, વડોદરા	રૂ. ૫૦,૦૦૦/-
	(૨) શ્રી દિનેશભાઈ એસ. બાવીસી, રાજકોટ	રૂ. ૧૦,૦૦૦/-
	(૩) શ્રી આષિત હસમુખરાય ઘેલાણી, મુંબઈ	રૂ. ૫,૦૦૦/-
● ચોપડા વિતરણ :	શ્રી દિનેશભાઈ એસ. બાવીસી, રાજકોટ	રૂ. ૨૫,૦૦૦/-
● ગુરુસેવા :	શ્રી પૂર્ણિમાબેન નરેન્દ્રભાઈ શાહ, મુંબઈ	રૂ. ૧૧,૧૧૧/-
● ભોજનાલય :	શ્રી આષિત હસમુખરાય ઘેલાણી, મુંબઈ	રૂ. ૧૧,૦૦૦/-

‘ગૂઢાર્થતત્ત્વાલોક’ ગ્રંથના આધારે ૮૦,૦૦૦ શ્લોક પ્રમાણ

બૃહત્ ટીકા ‘યશોલતા’નું સર્જન

ગચ્છાધિપતિશ્રી જયધોષસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ૧૩ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરનાર મુનિશ્રી ભક્તિયશવિજ્યજી મહારાજે જૈનાગમોનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે. તેઓશ્રીએ માત્ર ૧૨ વર્ષના સંયમપર્યાયમાં અને ૨૫માં વર્ષના જીવનપર્યાયમાં પંડિતવર્ય શ્રી ધર્મદત્ત જા રચિત અતિગૂઢ ‘ગૂઢાર્થ તત્ત્વાલોક’ ગ્રંથ પર ૮૦,૦૦૦ શ્લોક પ્રમાણ ‘યશોલતા’ નામની સંસ્કૃત ટીકા અને ‘વિનભા’ નામે ગુજરાતી

વિવેચન દ્વારા સમાજને પોતાની વિદ્વત્તા, જ્ઞાનયજ્ઞ અને કઠોર પરિશ્રમનો પરિચય આપ્યો છે. આ ભગીરથ કાર્ય દ્વારા મુનિશ્રીએ જિનશાસનની ગરિમા વધારી છે. કોબા પરિવાર મુનિશ્રીને અભિનંદન સહ વંદન કરે છે.

૪૫ આગમોની વાંચના

પુ. આર્યાંશ્રી તપોરતસૂરીશુરજી મ.સા.ની નિશામાં ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ મુકામે તા. ૨૩-૪-૨૦૧૮ થી ૪૫ આગ્મેની વાંચના શરૂ થયેલ છે; જે લગભગ ૬ થી સાત મહિના ચાલશે. (સમય : સવારે ૮ થી ૧૧, બપોરે ૨ થી ૫)

શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા ૨૪મા જૈન સાહિત્ય સમારોહનું આયોજન

શ્રી મહાવીર જૈન વિદ્યાલયે “૨૪મા જૈન સાહિત્ય સમારોહ”નું આયોજન શ્રી રૂપ માણસ ભંશાલી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ અને સહકારસહ તા. ૧૨, ૧૩, ૧૪ જુલાઈ, ૨૦૧૮ દરમ્યાન કોબા જૈન તીર્થમાં (ગાંધીનગર - અમદાવાદ હાઇવે, કોબા સર્કલ પાસે, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭, ફોન નં. ૦૭૯-૨૪૨૭૬૨૦૪) કરેલ છે.

આ સમારોહમાં જૈન ધર્મના ચાર ફિરકાના જૈન-અજૈન વિદ્વાનો “જિનશાસનના જ્યોતિર્ધરો” વિષય ઉપર પોતાના શોધનિબંધ લઈને પદ્ધારશે અને તેનું વાંચન કરશે અને પછીના સમારોહમાં એ શોધનિબંધનું ગ્રથ સ્વરૂપે પ્રકાશન કરવામાં આવશે.

ગ્રાણ દિવસ માટે યોજનારા આ સમારોહમાં લગભગ ૧૨૫થી વધુ શોધનિબંધનું વાંચન થાય છે, એનું પરિશીલન અને એનો પરિસંવાદ થાય છે. લગભગ ૩૦૦થી વધુ વિદ્યુતજનો આ સમૂહ શ્રુતપૂજામાં સહભાગી થાય છે. આપ સર્વેને ૨૪માં જૈન સાહિત્ય સમારોહમાં પધારવા શ્રી મહાવીરજૈન વિદ્યાલય તથા શ્રી રૂપ માણક ભંશાલી ચેરીટેબલ ટ્રસ્ટ હાર્ડિક આમંત્રાણ પાઠવે છે. આપશ્રીને નમ્ર વિનંતી કે આપશ્રી ઉપરોક્ત સમારોહમાં પધારવાની ભાવના ધરાવતા હો તો આપશ્રી વિદ્યાલયની “headoffice@smjv.org,” ઉપર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી. ફોન નં. (૦૨૨) ૨૬૨૪૦૩૭૬.

ભાવનગર મુકામે પરમફુપાળુદેવના ચિત્રપટની સ્થાપના

આપણી સંસ્થામાં અવારનવાર પધારીને સત્સંગનો લાભ લેતા તથા પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત અહોભાવ ધરાવનાર સરળ હૃદયી મુમુક્ષુ શ્રી અરવિંદભાઈ પી. શાહ (ભાવનગર)ના ૭૭મા જન્મદિન નિમિત્તે તા. ૨૪-૦૩-૨૦૧૮ના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ (ઉદ્ઘોગશાળા ટ્રસ્ટ, ભાવનગર મુકામે કાયમી ધોરણે પરમહૂપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી તથા મહાત્મા ગાંધીજીના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી. કોબાના મુમુક્ષુ પ્રતિનિધિ તરીકે શ્રી અરવિંદભાઈએ આ ચિત્રપટની સ્થાપના ભાવનગરની પી.એન.આર. સોસાયટીના ચેરમેન શ્રી મહાસુખભાઈ જકડીયાના વરદ હસ્તે કરાવેલ. આ પ્રસંગે માનદ્રામંત્રી શ્રી અનંતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ તરફથી સ્વામિવાત્સય રાખવામાં આવ્યું હતું.

તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તં સેવજે. - શ્રીમદ રાજયંદ્રભૂ

દેરાગય સમાચાર

[૧] પાલનપુર : પૂ. નગીનભાઈ જી. શાહનું તા. ૨૧-૪-૨૦૧૮ના રાત્રે ૮-૦૫ કલાકે ૮૫ વર્ષની વયે સમભાવપૂર્વક દેહાવસાન થયું છે. નાનપણથી જ તેમનામાં અંતર્મુખ વૃત્તિ, વૈરાગ્યદશા અને પૂર્વજન્મના ધર્મના સંસ્કાર દસ્તિગોચર થતા હતા. વર્તમાન જીવનમાં તેઓએ પરમાર્થની પ્રાપ્તિ કરી હતી. સાંદુ જીવન અને સરળ વ્યક્તિત્વ ધરાવતા પૂ. નગીનભાઈ પરિચયમાં આવેલા જિજ્ઞાસુઓ સાથે ધર્મવાર્તા કરતા અને માર્ગદર્શન આપતા. સાધુ-સાધીજીઓ પણ તેઓની અંતર્મુખ દસ્તિનો લાભ લેતા. મુંબઈ, અમદાવાદ, પાલનપુર વગેરે સ્થળોના મુમુક્ષુઓ તેઓના પરિચયમાં રહી જિજ્ઞાસાઓનું સમાધાન મેળવતા અને અંતરના માર્ગની સમજણ પ્રાપ્ત કરતા. નગીનભાઈ વર્ષમાં બે વાર પાલિતાણા સાધના અર્થે જતા. તેઓએ મુમુક્ષુઓને પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. તેઓશ્રીએ લખેલ ‘સાવધાન’ અને ‘ગ્રથિલેટ’ નામના પુસ્તકો મુમુક્ષુસમાજ માટે માર્ગદર્શકરૂપ છે. કોબા સંસ્થામાં પધારીને તેઓએ સ્વાધ્યાયનો લાભ આપ્યો હતો. સ્વર્ગસ્થનો આત્મા આગામી થોડા ભવોમાં પરમપદને પ્રાપ્ત કરે તેવી સમસ્ત કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.




[૨] અમદાવાદ : આપણી સંસ્થાના કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી બિપીનભાઈ મણિયારના પિતા શ્રી રતિલાલ નાનયંદ મણિયાર (૩.વ. ૮૮)નું દેહાવસાન તા. ૬-૪-૨૦૧૮ને શુક્રવારના રોજ અમદાવાદ મુકામે થયેલ છે. તેઓશ્રી ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા તથા જીવદયાના કાર્યોમાં તન-મન-ધનથી સેવા આપતા હતા. બોટાદ મહાજન પાંજરાપોળમાં તેઓએ ટ્રસ્ટીશ્રી તરીકે સેવાઓ આપી હતી. સાધુ-સંતોની ખૂબ વૈયાવચ્ચ કરવા માટે આખા સંપ્રદાયમાં જાણીતા હતા. તેઓએ ખૂબ જ પરિશ્રમ કરીને આખા કુટુંબને ધાર્મિક સંસ્કારોથી રંગી દીઘેલ છે. તેઓશ્રી કોબા સંસ્થામાં પધારી અવારનવાર સ્વાધ્યાય-ભક્તિનો લાભ લેતા હતા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખૂબ જ આદર અને સદ્ગુરૂભાવની લાગણી હતી. તેઓશ્રી નિખાલસ, સરળ, ધર્મપ્રેમી અને જીવદયાપ્રેમી હતા. સમાજના ધણા ક્ષેત્રે તેઓ અવારનવાર દાન આપતા હતા. સ્વર્ગસ્થના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તથા આગામી થોડા ભવોમાં પરમપદને પ્રાપ્ત કરે તેવી સમસ્ત કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.




[૩] અમદાવાદ : આપણી સંસ્થામાં પધારીને સત્સંગ-ભક્તિનો લાભ લેતાં રંજનબેન રમણલાલ શાહનું તા. ૨૦-૪-૧૮ના રોજ ૮૭ વર્ષની વયે દેહાવસાન થયું છે. દેહાવસાનના પાંચ દિવસ અગાઉ રંજનબેને મહાસતીજ પાસેથી અંત સમયના પચ્ચાખાણ લીધા હતા. તેઓનું જીવન સાંદુ અને સંતોષી હતું. સ્વાવલંબનનો ગુણ તેઓમાં દસ્તિગોચર થતો હતો. તેઓની સહનશક્તિ પણ સરાહનીય હતી. લાંબી બીમારી અને પથારીવશ હોવા છતાં ફરિયાદ કર્યા વિના શાંતિપૂર્વક સહન કરતા. દ્યાળુ સ્વભાવ એ તેઓના વ્યક્તિત્વની ધ્યાનાકર્ષક વિશેષતા હતી. તેઓ ધર્મપ્રિય અને શાંત સ્વભાવના હતા. અગાસ આશ્રમ ઉપરાંત કોબા આશ્રમમાં તેઓ સત્સંગ અર્થે રહેતા હતા. તેઓના સુપુત્ર શ્રી વિક્રમભાઈ પણ કોબા આશ્રમમાં અવારનવાર સત્સંગ અર્થે પધારતા રહે છે. સ્વર્ગસ્થના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ અર્પે તેવી સમસ્ત કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.



સંસ્થામાં પૂજયશ્રી રાકેશભાઈનું શુભાગમન



શ્રી કૃપાકુમારસિંહજી અંધ ઉધોગ શાળા ટ્રસ્ટ, ભાવનગર મુકામે
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજયંત્રજીના ચિત્રપટની સ્થાપના વેળાએ (તા. ૨૪-૩-૧૯૮૫)



Registered under RNI No. : GUJGUJ/2008/25883
Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal
Regd. No. : GAMC - 309/2018-2020 issued by SSP Ahmedabad valid upto 31-12-2020
Publication Date 15th of every month

દ્રવ્યના સામાન્ય ગુણો

બધાં દ્રવ્યોમાં જોવા મળતાં ગુણોને સામાન્ય ગુણો કહે છે.

૧. અસ્તિત્વ : જે શક્તિને કારણે દ્રવ્યનો કદાપિ નાશ ન થાય અને દ્રવ્ય કોઈથી ઉત્પલ પણ ન થાય તે શક્તિને અસ્તિત્વ ગુણ કહે છે.
૨. વસ્તુત્વ : જે શક્તિને કારણે દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ થાય અર્થાત્ પોતાની પ્રયોજનભૂત કિયા થાય છે તે શક્તિને વસ્તુત્વ ગુણ કહે છે. પ્રત્યેક દ્રવ્યનું પરિણામન (કાર્ય) દ્રવ્યમાં પોતાને કારણે જ થાય છે.
૩. દ્રવ્યાત્મા : જે શક્તિને કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાય છે તે શક્તિને દ્રવ્યાત્મા ગુણ કહે છે. દ્રવ્ય કાયમ રહે છે પરંતુ તેની અવસ્થા – પર્યાય નિરંતર બદલે છે.
૪. પ્રમેચાત્મા : જે શક્તિને કારણે દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિખય બને તેને પ્રમેચાત્મા ગુણ કહે છે.
૫. આગુરુલઘૃત્વ : જે શક્તિને કારણે દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે છે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યએ થતું નથી, એક ગુણ બીજા ગુણએ થતો નથી, દ્રવ્યમાં રહેનારા અનંત ગુણ વિભરાઈ જુદાં જુદાં થતાં નથી. આ શક્તિને આગુરુલઘૃત્વ ગુણ કહે છે.
૬. પ્રદેશાત્મા : જે શક્તિને કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય છે તે શક્તિને પ્રદેશાત્મા ગુણ કહે છે.
 - ઇ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે.
 - ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે
 - જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં રહે છે તેને ગુણ કહે છે.
 - ગુણના વિશેષ કાર્યને (પરિણામનને) પર્યાય કહે છે.

આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા

- ૧ 'દિવ્યધ્વનિ' મે - ૨૦૧૮ના અંક માટે રૂ. ૨૧,૦૦૦/-નો આર્થિક સહયોગ
શ્રી રજનીકાંત આર. સોલાણી પરિવાર (વાંકાનેર, હાલ મુંબઈ)
હસ્તો : શ્રી ગ્રધ્યભભાઈ દીપકભાઈ સોલાણી
તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ 'જ્ઞાનદાન'ની અનુમોદના કરે છે.
- ૨ 'દિવ્યધ્વનિ' મે - ૨૦૧૮ના અંક માટે રૂ. ૨૧,૦૦૦/-નો આર્થિક સહયોગ
ચિ. અનાયા, ચિ. અણુષા અને ચિ. અર્જુન
હસ્તો : તેજલભેન સુમિતભાઈ ખંધાર પરિવાર (ચુ. એસ. એ.)
તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ 'જ્ઞાનદાન'ની અનુમોદના કરે છે.

Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Soneji on Behalf of
Shrimad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba - 382 007.
Dist. Gandhinagar (Gujarat). Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate,
Bardolpura, Ahmedabad - 380 004. Editor : Shri Mitesh A. Shah